

વार्षिक लવाजम ३ा. ૧૫૦/-

वर्ष : ૪૬મુન્
મે - ૨૦૨૧
અંક - ૫૧૬

મંગલ મંદિર • મે-૨૦૨૧ • ૧
(કુલ પાણા : ૫૪)




મંગલ મંદિર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનું માસિક મુખ્યપત્ર

માર્ગ પહેરો, હાથને સાફ કરો વારંવાર
બે મીટરની દૂરી બનાવી રાખો

કોરોનાથી ગભરાહઠ નહીં, સમજદારી
અને સતર્કતા એજ આપણી સલામતી



૧૫૦ મે ૧૯૬૦
ગુજરાત દથાપણ દિન

મુખ્ય કાર્યાલય :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માતુશ્રી સાક્રબહેન રવજી મોરારજી લાલન (કોડાય-સુપીમવાળા)

શ્રી કચ્છી જૈન ભવન

તંગી મંડળ :

પ્રતાપ નારાયણ દંડ - મુખ્ય તંગી


દિનેશ આર. મહેતા - સહંતન્ત્રી

૪૩-૪૪, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી, પાલડી, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬

ફોન : (૦૭૯) 4890 6001, 4890 6004, 4890 6006

Email : kjssmangalmmandir@gmail.com • Web site : www.kuthchijainahd.org

કચ્છી સાહિત્ય જગતના બેખદારી કવિશ્રી 'તેજ'નું નિધન....



કચ્છમાં ગામ નલિયાના અને હાલે ગાંધીધામ નિવાસી મૂર્ખન્ય બુરુજાં સાહિત્યકાર અને કચ્છી કવિશ્રી તેજપાલ ધારશી શાહ (નાગડા) કવિ 'તેજ'નું તા. ૧૬-૦૪-૨૧ના રોજ અવસાન થયું છે. તેમના અચાનક નિધનથી સાહિત્યકારોમાં અને ગુજરાતની વિવિધ સાહિત્ય પ્રવૃત્તિ કરતી સંસ્થા બુહસ્પતિ કાવ્યધારા તથા સાહિત્ય મંડળમાં આધાતની લાગણી ફેલાઈ હતી. તેમના લગભગ ૪૦ જેટલા કચ્છી સંગ્રહ પ્રગત થયા છે. એમની બોલી અને લેખનમાં કચ્છી સાહિત્ય ભાષાની મીઠાશ છલકતી હતી. જે આત્મશક્તિ સાથે કુદરતી બદ્દીસ હતી. તેવા કચ્છી ભાષાના સાહિત્યકાર અને પદ્ધીવિદની વિદાયથી, પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે.

કવિ તેજને ઘણા પુરસ્કારો અને સન્માન પ્રામ થયા છે. તે પેકી મુખ્ય વિગતની નોંધ લઈએ તો... ૧૯૮૮માં મુંબઈ સમસ્ન કચ્છી સમાજ દ્વારા સન્માન, 'કચ્છ શક્તિ'નો સાહિત્ય રતા અંવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર દ્વારા પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર 'ભાષા સન્માન' - કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી સન્માન. આ ઉપરાંત કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક પુરસ્કાર તેમને અર્પણ થયા છે.

કચ્છી સાહિત્ય જગતના આ જળહળતા સિતારાને 'મંગલ મંદિર' પરિવાર પુષ્પાંજલિ અર્પે છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે અને એમના કુદુરુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

કચ્છના શ્રી દિલીપ આચાર્ય 'દિલકશ', શ્રી વિપુલ જોશી 'કચ્છી બેફામ' વગેરે સાહિત્ય રસિકોએ તેમની સેવાને બિરદાવીને શબ્દાંજલિ આપી હતી.

તજા લેખકશ્રી મુરજુ ગનશી ગડાનું તા. ૨૪-૦૩-૨૦૨૧ના વડોદરા ખાતે દુઃખ નિધન થયું છે

॥ ભાવાંજલિ ॥



સ્વ. મુરજુ ગડા મૂળ કચ્છના વતની હતા. તેમનો ઉછેર મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.ઇ. (મિકેનિક) થયા અને એ જ ક્ષેત્રમાં અમેરિકામાં એમ.એસ. કરી ત્યાં કન્સલ્ટન્સી કરી હતી. વીસેક વર્ષ અમેરિકામાં ગાળી છેલ્લે વડોદરામાં સ્થાયી થયા હતા. તેઓ જીવનને થોડી જુદી નજરે નિહાળનાર વ્યક્તિ હતા. 'અભિવ્યક્તિ' બ્લોગ ઉપરાના તેમના લેખ ઘણા પ્રિય થયા છે. તેમના પુસ્તકો 'માન્યતાની બીજી બાજુ', 'કુદરતને સમજુઓ', 'શોધણ અને વૈશિષ્ટ પ્રવાહો' અને 'વિચારવા જેવી વાતો'માં રેશનાલિઝમની જીંદી અસર જોવા મળે છે.

'મંગલ મંદિર' સામયિકમાં ઘણા લાંબા સમયથી તેમના બુદ્ધિગમ્ય તથા તાર્કિક લેખો પ્રકાશિત થતા રહ્યા છે. તેમના અનેક લેખોને વાચકવર્ગ દ્વારા સારો પ્રતિસાદ પ્રામ થતો રહ્યો છે. તે અન્યથે જરૂર જણાય ત્યાં તેઓશી વિગતવાર સ્પષ્ટતા પણ કરતા હતા. તેમની અચાનક વિદાયથી 'મંગલ મંદિર' પરિવારે એક ઉત્ત્ય કશાના સર્જકને ગુમાવ્યા છે, જેનો હંમેશાં રંજ રહેશે.

તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ બદ્દે અને તેમના પરિવારજનોને આ તીવ્ર આધાત જરૂરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.

છેલ્લા ૪૫ વર્ષથી દર મહિનાની ૫ તારીખે
નિયમિતપણે પોટ કરવામાં આવતું
“શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું
મુખ્યપત્ર

“મંગલ મંદિર”

મુખ્ય કાર્યાલય

શ્રી કચ્છી જૈન ભવન,
૪૩-૪૪, શ્રી બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
પાલડી, એલિસબિલ્ઝ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.
ફોન : (૦૭૯) ૨૬૪૭૮૮૮૨, ૨૬૪૮૭૫૦૭
ફેક્સ : (૦૭૯) ૨૬૪૮૨૦૬૦
ઈ-મેઇલ : kutchijainam@gmail.com
વેબ-સાઇટ : www.kutchijainahd.org

તંત્રી

પ્રતાપ નારાણાં દંડ

સહ તંત્રી

દિનેશ આર. મહેતા
મો. ૯૯૨૪૩ ૪૨૬૨૮

અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખો તથા અન્ય વિભાગની
માહિતીઓ સાથે તંત્રીમંડળ સહમત છે તેમ માની વેચું
જરૂરી નથી. રજૂ થયેલ વિચારો જે તે વ્યક્તિના હોય
છે, જેની નોંધ લેવા વિનંતી.

લેખકોને નામ વિનંતી

‘મંગલ મંદિર’માં પ્રગટ કરવા
માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી
અમને મળતી રહે છે અને એટલે
સ્વીકૃત કૃતિઓને પ્રગટ કરવાનું પણ
સ્વાભાવિક રીતે વિવિધભાય. મંગલ
મંદિરના ઘોરણને ધ્યાનમાં લઈ,
પોતાની રચના મોકલતી વખતે લેખક
સ્વાવિષેક દાખલે તેવી વિનંતી છે.

એક સાથે એકથી વધુ કૃતિઓ
ન મોકલવા વિનંતી.

ભાષાદોષ અને લાંબા લેખો
અસ્વીકાર્ય બનશે તેની નોંધ લેવા
વિનંતી. લેખમાં એકની એક વાતનું
પુનરાવર્તન (રેપિટેશન) ટાળ્યું
જરૂરી છે. કૃતિની હસ્તપ્રત સ્વચ્છ
અને સુવાચ્ય હોવી જોઈએ. આશા
છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો
સહકાર અમને મળી રહેશે.

- મુખ્યતંત્રી

અનુકમણિકા

- શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા
કોરોના સંક્રમિત વ્યક્તિને ઓનલાઈન / ટેલિફોનિક ડૉક્ટરની સલાહ ૫
- શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ
“સક્રમ” ટેવલપમેન્ટ સેન્ટર દ્વારા ફી સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ ૬
- તંત્રી લેખ :**
- સરકારી નીતિઓ લોકોના જીવન સુખી રાખવામાં
કેવી ભૂમિકા ભજવે છે? દિનેશ આર. મહેતા ૭
- દીપશીખા**
- બોડી લેંગેજની મહત્ત્વાં ● “ઈમ્પ્રેક્ટ કોડ” ડૉ. પૂજા કોટક ૮
- સાંપ્રદાય**
- વિશ્વ તમાકુ નિષેધ ટિવસ
આ વર્ષની થીમ : છોડવા માટે કટિબધ્ધતા ડૉ. મિહિર એમ. વોરા ૯
- વિચાર મંચ**
- સ્વર્ગ અહો જ છે, માત્ર આપણે એને પ્રાત કરવાની જરૂર છે ડૉ. યાસીન દલાલ ૧૧
- સ્ત્રી : સંસારની સેન્દ સરિતા...! દિનેશ પાંચાલ, જનાલિસ્ટ ૧૩
- પ્રસંગ કથા**
- ભષણતરનું વાવેતર નટવર આહલપરા ૧૪
- નવલિકા**
- ચિત્રકાર રમેશ પટેલ, લેખક-કવિશ્રી ૧૬
- પચારવચા**
- ગ્લોબલ વોર્મિંગ વિકાસને ભરપી જશે પ્રા. સૂર્યકાંત ભણ ૨૧
- ગુલશાન (ચાલુ શ્રેણી) (મણકો-૬)**
- “દિલની જબાન” :
ગજલકાર ડૉ. નટુભાઈ પંડ્યા “નટવર” ચંદ્રકાંત પટેલ ‘સરલ’, સાહિત્યકાર ૨૨
- અનુભવ**
- એકાંતવાસના આ દિવસો ડૉ. અલકા સુનિલ શાહ ૨૫
- શાશ્વત**
- ‘બીજી માણા’ સ્વરૂપે શોભે ‘સ્માર્ટ મોબાઈલ’ જગદીશચંદ્ર છાયા ૨૭
- ચિરંશ્ચાવી**
- “મારી અમૃત દિવરી – કિરણ્ણ” રક્ષાબેન ચોટલિયા ૨૮
- કારકીદા**
- GPSC પરીક્ષાઓ ૧૦૦ દિવસના અભ્યાસમાં પાસ કરવી શક્ય છે? હીરેન દવે ૩૧
- નારી ગોરવગાચા-૨**
- કેન્સરગ્રસ્ત દર્દીઓને માનસિક રીતે તેથાર કરતા : રોહિણીબેન દવે મનોજ પંડ્યા ૩૨
- સુભિરે... બલબીરા, સ્મૃતિપટ પર સંભારણાં (સંકલન : બલબીરસિંહ જાડેજા)**
- “હા, પસ્તાવો વિપુલ જરણું... પુષ્યશાળી બને છે” – કવિ કલાપી ભવસુખ શિલુ ૩૩
નિવૃત આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર
- અભિનુંદ્ય**
- જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે... મા પાદુલ દેશાં ૩૪

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના
“પદાધિકારીશ્રીઓ”

મેળેજિંગ ટ્રસ્ટી

શ્રી પ્રતાપ નારાણજી એંડ
ઘર : ૦૯૬- ૨૬૪૦૫૦૪૭ મો. ૯૮૨૬૭ ૨૫૬૧૮

ઉપમુખ-૧

શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ
ઘર : ૨૬૪૪ ૬૪૧૩, આ. ૨૬૪૦ ૧૧૫૦
મો. ૯૮૨૫૦ ૩૧૫૨૮

ઉપમુખ-૨

શ્રી શાંતિલાલ મુળજી સાવલા
ઘર : (૦૨૭૭૧) ૨૩૪૪૫૫ મો. ૯૮૨૫૦ ૪૮૬૪૫

માનદ મંત્રી

શ્રી પ્રદીપ સૂર્યલાલ મહેતા
ઘર : ૨૬૬૧૨૦૮૮
મો. ૯૮૨૫૦ ૬૧૧૬૦

સહમંતી

શ્રી રોહિત સંઘવી

ખજાનચી

શ્રી ચંદ્રકાંત દામજી શાહ
ઘર : ૨૬૬૦૫૨૨૪

સાહ ખજાનચી

શ્રી રજનીકાંત ધરમશી પારેખ
મો. ૯૮૮૮૦ ૫૩૫૨૯

શ્રી કચ્છી વિશ્વામ ગૃહનું સરનામું :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ
સંચાલિત

શ્રી કચ્છી વિશ્વામ ગૃહ
અર્થિંતનગર દેરાસરની સામે,
ગાંધી વિદ્યાલયની ગીવીમાં, રચના સ્કૂલની પાછળ,
રાજ્યથાન હોસ્પિટલ પાસે, શાહીબાગ,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.
ફોન : ૦૯૬-૨૨૮૮૪૫૭

સેવા ભવનનું સરનામું :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત
માતુશ્રી કંકલેન કાળજીભાઈ રવજી (નાની ખાખરવાળા) સેવા
ભવન, એસ. ટી સ્ટેન્ડ પાસે,
સંકાર ગેટ હાઉસની સામે, રૂગાનાથપુરા,
અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૯૬-૨૫૪૬૧૨૭૦

‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ

www.kutchhijainahd.org

ઉપર... [બ્લોગ](http://www.kutchhijainahd.org)...

www.hellokutchis.com

ઉપર વાંચી શકાય છે.

જીવન નામ

- ભાબી - મા એમ. ડૉ. સોંંકિ.... ૩૫
- “સાસુ-વહુ” - એક કટુ પણ અનિવાર્ય સંબંધ દિનેશ એન. વેન્નાવ.... ૩૮

લદ્ય કથા

- કોળિયા જસ્મીન દેસાઈ ‘દર્પણ’.... ૪૦

નોદ્ય કથાઓ

- ઈનામ ● સોનાનો હાર હસમુખ રામદેપુંગ્રા, શિક્ષકશ્રી.... ૪૧

YOUTH CLUB

- Some Golden Thoughts Presentation : Dinesh R. Mehta ૪૨

માહિતી

- મહત્વની માહિતી : વિશ્વનો અલભ્ય ગણતરી યંત્ર (ચાલુ શ્રેણી) ૪૩
- તા. ૧-૪-૨૦૨૧થી જી.એસ.ટી. કાયદામાં નવા સુધારાઓ અમલમાં આવ્યા. ૪૪

સમાચાર સંક્ષિપ્તમાં

- જાહુના સમાચાર જુનિયર કે.લાલનું કોરોનાથી અવસાન ૪૫
- વરિષ્ઠ અભિનેત્રી શરીકલાનું સુંબર્થમાં નિધન ૪૫
- મુશાયરાના બાદશાહ ખ્લીલ ધનતેજીવી જશતનશીન ૪૫
- સ્વ. મુરજી ગનશી ગડા કોણા ગડા.... ૪૬

ગ્રંસ ગેલરી

- પઢલ-૧ : ચક્કયૂહ ● પઢલ-૨ : ફિલ્મી તોરણ સંકલન : કિરણલેન પી. ૬૫૫૨..... ૪૭
- કેપિટલ અક્ષર પરથી વાક્યની રચના. ભાવના એ. ઝવેરી..... ૪૮

વૈવિદ્ય

- આંજો કાગર ૪૮
- ...તો સારું લાગે – એક આસ્વાદ રમેશ પટેલ, લેખક/કવિશ્રી..... ૫૧
- કર્ય દર્શન સંકલન : દિનેશ આર. મહેતા.... ૫૨
- રોગ અને સાવધાની ● કોરોના સંક્રમણ માટે ધરમાં નીચે મુજબ જરૂરી કીટ રાખી શકાય ૫૩
- કોરોનાના કેટલાક લક્ષણો ● સ્વાસ્થ્ય માટે ધ્યાન આપશો ૫૪

મનોરમ્ય : કાવ્ય સૂચિ

- બીજા માટે : કિંજલ પટેલ ● હરિ આવો : હર્ષ ચૌહાણ ૫૫
- અવસર : રક્ષા ચોટલિયા ‘ધરા’ ● ગામદું : ડૉ. નાનુભાઈ પ્ર. પંડ્યા ૫૫
- લતા યાદ આવી : દર્શના રાવલ ● ગાજલ : હરીશ પંડ્યા ● મુક્તક : રમેશ પટેલ ૫૬
- ગાજલ : આમિદ ભણ ● લદ્ય કાવ્યો : અરુણા અરુણ ૬૫૫૨..... ૫૬
- આનું થાય કેમ? : ‘આર્સી’ શાહ ૫૭

નિયમિત વિભાગો

- ભાલું જ્યું ગાલિયું સંકલન : ગુલાબચંદ ધારશી રાંભિયા.... ૫૮

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

- સમાજ દર્શા ૫૮
- સંસ્થા સમાચાર ૬૦

Printed & Published by : Mr. Pratap Dand, For Shri Kutchhi Jain Seva Samaj - Ahmedabad.

Printed at : Gajanand Offset, Amraiwadi, Ahmedabad.

Published at : Shri Kutchhi Jain Seva Samaj – Ahmedabad, 43/44, Brahman Mitra Mandal Soc., Opp. Navchetan High School, Paldi, Ellisbridge, Ahmedabad-380 006. ● Editor : Mr. Pratap Dand ● Yearly Subscription : Rs.150/-

શ્રી કાચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

૬/૨૧....

**કોરોના સંક્રમિત વ્યક્તિને
ઓનલાઇન / ટેલિફોનિક ડોક્ટરની સલાહ**

Online MD Doctor Consultation

શ્રી કાચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ માને છે કે આજની પરિસ્થિતિમાં સાચું નિદાન અને સમયસર સારવાર વિના કેસ અચાનક જ ગંભીર બની જાય છે. તેથી આપણા પોતાના જ MD ડોક્ટર્સ ડૉ. નીતુબેન તથા ડૉ. શિલ્પાબેન, આપણા સમાજના કોરોના સંક્રમિત કોઈપણ વ્યક્તિને ૧૪ દિવસ સુધી Online / Telephonic સલાહ આપશે. મોટાભાગે સાચા નિદાનથી ઘરે જ સારવાર થઈ શકે છે.

- ★ ડોક્ટર્સ ફક્ત નિદાન કરીને સલાહ આપશે. બાકીની બધી વ્યવસ્થા પરિવારે જાતે કરવાની રહેશે (હોસ્પિટલ, ઓક્સિજન કે દવા વગેરે)
- ★ આ સેવા ફક્ત રૂ. ૪,૦૦૦/-ના દરે એક દર્દી માટે રહેશે. (૧૪ દિવસના રૂ. ૪,૦૦૦/- એટલે કે રોજના માત્ર રૂ. ૨૮૫/-)
- ★ જેને સેવા લેવાની હોય તેઓએ નીચેના નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ડૉ. હિતેન્દ્ર શાહ : 98981 98616

આધ્યાત્મિક સાવલ્યા : 98259 38771

છીરેન (HK) શાહ : 98250 13715

જો કોઈને આ સેવા માટે આર્થિક મદદ જોઈએ તો
સમાજના માનદ્ય મંત્રી
પ્રદીપ મહેતા (98250 61160)નો સંપર્ક કરવો.



શ્રી કાચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

“સદ્ગુરૂ” ડેવલપમેન્ટ સેન્ટર

દ્વારા....

શ્રી સાયકોલોજિકલ કાઉન્સેલિંગ

FREE Psychological Counselling

(ફક્ત શ્રી કાચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના સભ્યો માટે જ)

હાલની કોરોનાની વકરેલી પરિસ્થિતિને લીધે આખો પરિવાર માનસિક રીતે હતાશ કે તણાવમાં જોવા મળી રહ્યો છે. હતાશા અને ડરના માહોલમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. અને પરિસ્થિતિ બદ થી બદતર બની શકે છે.

જો કોઈ આવી વિકટ પરિસ્થિતિમાં માનસિક રીતે હતાશ હોય, એના જ વિચારો આવતા હોય કે મનમાં ભય બેસી ગયો હોય, તે લોકો તેના નિષ્ણાત અને અનુભવી સાયકોલોજિસ્ટ ડૉ. શૈલેન્ડ ગુપ્તા સરનો સંપર્ક કરી કાઉન્સેલિંગ કરાવી શકે છે.

આપે આપનું નામ દેવેશ દંડ (મો. ૮૮૮૦૪ ૬૦૮૨૦) પાસે નોંધાવવાનું રહેશે.


ત્યારબાદ ડૉ. ગુપ્તા સર સાચે જે તે વ્યક્તિને સાંજે ૫ થી ૬ કલાક દરમિયાન આપેલ દિવસે સાચા કે વીડિયો કોલથી વાત કરાવવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી આપના મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

જો સાયકોલોજિસ્ટ ડોક્ટરને જરૂર જણાશે,
તો ફરી મીટિંગનો સમય અને દિવસ નક્કી કરશે અને સલાહ સૂચન આપવામાં આવશે.

ઉપરોક્ત દરેક બાબત એકદમ ગુપ્ત રહેશે.

— દેવેશ દિલીપભાઈ દંડ
ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી વિકાસ સમિતિ





તંત્રી લેખ

સરકારી નીતિઓ લોકોના જીવન સુખી રાખવામાં કેવી ભૂમિકા ભજવે છે?



દિનેશ આર. મહેતા

વિશ્વ સરની સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી તાજેતરમાં વર્લ્ડ હેપ્પીનેસ અહેવાલ – ૨૦૨૧ જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં ભારતનું સ્થાન ૧૪૮ દેશોની યાદીમાં ૧૩૮મા સ્થાને આવ્યું છે. આ રીતે ભારતનું સ્થાન છેલ્લા આઠ વર્ષથી કમાંકમાં નીચે ગબડ્યું છે, જે એક ચિંતાની બાબત છે.

આમ જોઈએ તો, ખુશી - હેપ્પીનેસ માપવાનો કોઈ ચોક્કસ માપદંડ નથી કારણકે દરેક સ્થળે, દરેક વ્યક્તિના ખુશ રહેવાના કારણો અલગ - અલગ હોય તે સ્વાભાવિક છે. આનંદ - પ્રમોદ - પ્રસન્નતા - ખુશી એ દરેક વ્યક્તિની અંગત મનોસ્થિતિ હોય છે. આમ છતાં, યુ.એન. દ્વારા ખુશાહાતી માપવાના કેટલાક ચોક્કસ માપદંડ નક્કી થયા છે. આ પ્રકારની વૈશ્વિક યાદી તૈયાર કરવા માટે અર્થશાખીઓ વગેરેની એક ટીમ દરેક દેશમાં સુશાસન, ભ્રાષ્ટાચાર, માયાદીદ આવક, સ્વારથ્ય, આયુષ્ય, સામાજિક સહયોગ, સ્વતંત્રતા, ભરોસો, ઉદારતા, દાનશીલતા વગેરે માપદંડોનો આધાર લેતા હોય છે. આ અહેવાલનો ઉદ્દેશ માત્ર દરેક દેશોના શાસકોને જાણ કરવાનો છે કે તેમની નીતિઓ લોકોના જીવન સુખી બનાવવામાં કોઈ ભૂમિકા ભજવી રહી છે કે નહીં. બુટાનના પ્રસ્તાવ પર યુ.એન.એ વર્ષ ૨૦૧૨માં પહેલો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ રજૂ કર્યો હતો અને ૨૦ માર્યને વર્લ્ડ હેપ્પીનેસ તે જાહેર કર્યો હતો. પ્રથમ રિપોર્ટમાં ભારતનું સ્થાન ૧૧૧મા સ્થાને હતું અને તેનમાર્ક પ્રથમ સ્થાને હતું. પ્રથમ હેપ્પીનેસ રિપોર્ટથી લઈને અત્યાર સુધી કેટલાક દેશો એવા છે જે પહેલા દસ કમાંક જળવાઈ રહ્યા છે. જેમાં તેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ક્રેડા, ઓસ્ટ્રીયા, આઈસલેન્ડ, લક્ઝમબર્ગ તથા ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે પ્રથમ દસ કમાંકમાં એશિયાનો એક પણ દેશ નથી. એ પણ ખરેખર નવાઈની વાત એ કે સુખી સમાજની યાદીમાં આપણા દેશનું સ્થાન સતત નીચે આગળ રહ્યું છે. પ્રસન્નતાના મામલે આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના મોટાભાગના પાડોશી દેશો કરતાં પાછળ છીએ. ઉપરોક્ત અહેવાલ મુજબ ફિનલેન્ડને વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકેનો શિરપાવ મળ્યો છે. સૌથી નીચે અફ્ધાનિસ્તાનનો નંબર છે.

હેપ્પીનેસ ઈન્ડેક્શન અને આર્થિક આંકડા વચ્ચે તુલનાત્મક અભ્યાસ કરતા એવો પ્રશ્ન થાય કે જરૂરથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા લોકોને ખુશ રાખવામાં મદદરૂપ થાય છે કે નહીં.

આપણે ભારતની વાત કરીએ તો, ભારતમાં આર્થિક વિકાસનો લાભ બહુ જ ઓછા લોકોને મળી રહ્યો છે. માત્ર અભજોપતિઓની સંખ્યામાં થઇ રહેલો વધારો મજબૂત અર્થવ્યવસ્થાની નિશાની નથી. આ એક કમજોર આર્થિક વ્યવસ્થાનું ચિહ્ન છે. આ પ્રકારની વ્યવસ્થા ભ્રાષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. આજે દેશ ભલે પરમાણુ સત્તા અને અવકાશ ક્ષેત્રે પ્રગતિ સાધી હોવાનો દાવો કરે, પરંતુ બીજી તરફ ગરીબ લોકો ભૂખની સામે સતત જ્ઞાની રહ્યા છે. એક બાજુ આપણે આફિકના પદ્ધત દેશો, નેપાળ, ધ્યાનમાર, ભૂટાન, શ્રીલંકા જેવા પાડોશી દેશોને આર્થિક સહાય આપીએ છીએ અને બીજી તરફ આપણા દેશના જ અનેક ગરીબ લોકો રોજ ભૂખ્યા સૂર્ય જતાં હોય છે! ભારતમાં સંપત્તિનો અવિરત પ્રવાહ વહે છે પરંતુ તેનો ફાયદો એવા લોકોને જ મળે છે, જે શરૂથી જ સમૃદ્ધ છે. વધી રહેલી આર્થિક અસમાનતાનો પ્રજામાં ભારે આકોશ છે. પરંતુ મૂક પ્રજા આ માટે સરકાર સામે કશું બોલી શકતી નથી. જેના પરિણામે અરાજકતા અને હિંસાનો માહોલ સર્જય છે. દેશના વિકાસની સાર્થકતા એમાં છે કે જે સ્થિતિમાં દેશના સામાન્ય લોકો પોતાને સંતુષ્ટ માને.

ભારતના લોકો બેરોજગારી, ગરીબી, ભ્રાષ્ટાચાર, સ્વારથ્ય, શિક્ષણ જેવા અગત્યના મુદ્દાઓ ભાજુમાં રાખીને સ્માર્ટ ફોનના ગુલામ થઈ ગયા છે. સસ્તા સ્માર્ટફોન અને ફી મળતા ડેટા પેકેજના કારણે ઘણા લોકો અને ખાસ તો દેશનો યુવાધન વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવાના બદલે સ્માર્ટ ફોનમાં માથું ખૂંપાવીને ફોરવર્ડ મેસેજિસને આગળને આગળ ફોરવર્ડ કરવામાં વ્યસ્ત બની ગયા છે!! ખુશાહાત ભારતનું નિર્માણ કરવા માટે લોકોએ અને ખાસ કરીને દેશના યુવાધને જાગૃત થવાની જરૂર છે.

બોડી લેંગેજની મહત્વા

આપણે પશુને મોટાભાગે અભુધ જ સમજીએ છીએ, પણ એ આકમક બને તો એનો મુડ હાવભાવથી જાણી શકાય છે. એ પોતાનું કાયકેન્ટ પણ નક્કી કરી લે છે અને એ કેન્ટમાં અન્ય પણ પંખીઓની હાજરીનો વિરોધ પણ કરે છે. માનવીનું પણ આવું જ છે અને તેની પોતાની 'સ્પેસ' હોય છે. મનમાં તાણ હોય તો ચહેરા ઉપર વર્તાય છે. જુંબ બોલનાર નીચી નજર રાખે છે. ટોળામાં કે સમૂહમાં પણ અને માનવીની વર્તણૂક અંશતઃ એકસમાન જાણાય છે. આ બધી બાબત 'બોડી લેંગેજ'ની નિશાની કે તેના દાખાંત છે.

ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક ચિંતક હિપોકેટ્સે આ બાબતે લખ્યું હતું અને આજે પણ આ સંશોધનનો વિષય છે.

બોડી લેંગેજનો અર્થ છે શરીરની ભાષા, આપણા હાવભાવથી વ્યક્ત થતો સંદેશ. વિદ્યાર્થીઓ, ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ, ચુપ ડિસ્કશનમાં તેનું મહત્વ છે. જ્યારે જોબ કે ધંધા - રોજગારના કોર્પોરિટ કલ્યારમાં માણસના પહેરવેશ અને વર્તણૂકનું મહત્વ છે. આ વિષયનું સંશોધન એમ કહે છે કે કોઈ વાત કહેવામાં ૭% યોગદન શર્ધેનું છે, જ્યારે ઉચ્ચ ૩૮% બોલવાની છટા ઉપર છે તથા ૫૫% અસર બોડી લેંગેજથી થાય છે. તે પછી ૧૦% પ્રકીર્ણ બાબત વ્યક્તિગત હોઈ શકે છે.

રમતના કેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન માટે શરીરની ભાષા એક મહત્વની બાબત છે. ન્યુજિલેન્ડની 'રૂબી' ટીમ દ્વારા મેચ પહેલા કરાતું 'હાક' નૃત્ય એ આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ છે. હાર-અતની સંભાવનાની ટીમના સભ્યો ઉપરની અસર બોડી લેંગેજથી જ જાણી શકાય છે. ખાસ તો મજબૂત ટીમ કે ખેલાડીનો દેખાવ નબળો હોય ત્યારે આ પ્રતિભાવ જલ્દી દેખાય છે. ઇન્ટરવ્યૂમાં પણ 'નેગેટિવ' પ્રશ્નો પૂછીને ઉમેદવારની બોડી લેંગેજ જાણવા પ્રયાસ થાય છે. આ પ્રકારે બોડી લેંગેજને સફળતાનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. સફળતા માટે શરીરની ભાષાની મહત્વા શું છે તે આ પ્રકારે જાણી શકાય છે. તેથી તેનું ખાસ પ્રશિક્ષણ અપાય છે. શર્ધો તોળીને બોલી શકાય છે, પણ બોડી લેંગેજ ભાવનાઓ ઉપર નિર્ભર હોવાથી છુપાવવી મુશ્કેલ છે. તેથી વિદ્યાર્થી, ઉમેદવારોએ 'બોડી લેંગેજ' માટે હંમેશાં સભાન રહેવું પડે છે.

"ઇમ્પેક્ટ કોડ"

જે વ્યક્તિ જીવનમાં સફળતા, યશ, કીર્તિ, પ્રતિજ્ઞા કે પ્રભાવ ઈચ્છતી હોય છે તેણે અમુક જીવન પદ્ધતિ, કોડ કે અભિગમ અપનાવવો પડે છે તે 'ઇમ્પેક્ટ કોડ' કહેવાય છે. તેને લોકો 'ઈન રૂપ' પદ્ધતિ પણ કહે છે. તે વ્યક્તિની પ્રવર્તમાન સ્થિતિનો દર્શક છે. સફળ વ્યક્તિનો પ્રભાવ અવશ્ય પડે છે પણ તેના માટે તેનું જીવનકવન કેવું હોવું જોઈએ તે જાણવાથી ઘણી વ્યક્તિઓ 'પ્રભાવી' બની શકે છે. અતે માત્ર 'શો' કે 'દેખાડો' કામ નથી લાગતો પણ વાસ્તવિકતા બહુ ઉપયોગી થાય છે.

ભવિષ્યના ઘડતર માટે ભૂતકાળ ભૂલવો પડે છે. વર્તમાન સ્થિતિ પર ફોકસ કરવું પડે છે. હાર કે પરાજયને એક પરિણામ સમજ પુનઃ આગળ જવાથી છેવટે સફળતા મળે છે. નિષ્ફળતાનો અર્થ પડવું નથી પણ પડ્યા બાદ ઊભું ન થવું તે છે.

આપણી જીવનશૈલી ધેયથી નક્કી કરી શકાય છે. વર્તન, વાણીનો અન્યોન્ય આધાર કેળવવો પડે છે. ભૂલ ન થવી જોઈએ પણ થાય તો સ્વીકારવામાં પણ ખેલદિલી રાખવી ઉત્તમ ગણાય. દરેક બાબતે ગંભીર ન થતાં સમયને અનુરૂપ હળવાશ રાખવી. હકારાતમક્તા કેળવવી. સતત એકથથું કામ ન કરવું પણ વિશ્વાસથી કાર્ય વિભાજન કરવું. પોતાના કેન્ટમાં નિષ્ણાત થવું. યાદ રહે, ઘણાં હકારાતમક પાસાં નેગેટિવ બાબતોમાંથી પણ મળે છે, પણ નેગેટિવ તો ન જ થવાય. આ કેટલાક પ્રભાવી બનવાના પાસાં છે. **ઉપરથી ઠાઠમાઠ કે દેખાવથી કોઈ 'ઇમ્પેક્ટ' પડતી નથી.** સફળ થવા આ પ્રકારના ગુણ કેળવવાથી સફળતા નજીક આવે છે.


જીવનના દરેક કેન્ટમાં 'પ્રભાવશાળી' વ્યક્તિત્વ દરેક વ્યક્તિ માટે, જે સફળતાની સીડી ચડવા ઈચ્છે છે, તેને તેની મંજિલ સુધી લઈ જનાર પ્રેરણાબળ છે.

- S.V. પૂજા કોડક

'મંગલ મંદિર'ના પ્રકાશન બાબત

કોરોના વાયરસના સંકમણની વર્તમાન ગંભીર સ્થિતિના પગલે મુખ્યપત્ર 'મંગલ મંદિર'નું માસિક પ્રકાશન નિયમિત ધોરણે કરવાનું હાલે અશક્ય છે. આમ છતાં, આવી વિકટ પરિસ્થિતિમાં તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન્સને અનુસરીને તેનું પ્રકાશન ચાલુ રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અગર વર્તમાન સ્થિતિ હજુ વધારે નિયંત્રણ બહાર જણાશે તો મુખ્યપત્રનું નિયમિત પ્રકાશન કોઈપણ સમયે સ્થગિત કરવા મજબૂરી ઉભી થઈ શકે છે, તેની સંબંધિત સર્વેએ નોંધ લેવા અનુરોધ છે.


- દાખી મંડળ



જાગૃતિ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ

આ વર્ષની થીમ : છોડવા માટે કટિબધ્યતા



ડૉ. ભિહિર એમ. વોરા

મિત્રો, દર વર્ષે ૩૧ મે ના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની ઉજવાણી કરવામાં આવે છે. આ દિવસનો ઉદેશ્ય તમાકુના દુષ્પરિણામો અને પ્રભાવોથી લોકોમાં જગરૂકતા લાવવા માટે અને વ્યક્તિઓને તેની ખરાબ આદતોની ગંભીરતા અંગે પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ અખબારી અહેવાલો અને દાકતરી સલાહને આધારે મેં અત્રે માત્ર માહિતી પૂરી પાડી છે.

વિશ્વમાં તમાકુના બંધાળીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશીલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. જે પૈકીના ૫૦ લાખ લોકો પોતે જ તમાકુની બનાવટોનો કોઈપણ સ્વરૂપે ઉપયોગ કરતા હોય છે, જ્યારે હ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઈ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકીના સતત સંપર્કના લીધે મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ લગાવેલા અંદાજ પ્રમાણે તમાકુના ધૂમ્રપાનને લીધે દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં હ લાખ લોકો એવા છે કે જે પોતે ધૂમ્રપાન નથી કરતા પરંતુ પરોક્ષ રીતે તમાકુનો ધુમાડો તેમના શ્યાસમાં જાય છે.

ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનની ૨૦૧૪ની સમીક્ષા અનુસાર, જો આ જ રીતે તમાકુનો ઉપયોગ ચાલુ રહેશે તો ૨૧મી સદીમાં લગભગ ૧ અબજ લોકોને મારી નાખશે. તેમાંથી અડવા ૭૦ વર્ષથી નાના હશે. તમાકુની આરોગ્ય પરની આડઅસરો વિશે ઘણા સંશોધનો થયેલા છે, જેમાં મોટા ભાગના ધૂમ્રપાન પર થયા છે. તમાકુમાં નિકોટિન નામનું દ્રવ્ય હોય છે, જે વ્યસન માટે જવાબદાર છે. આ ઉપરાંત બીજા પચાસ કરતા વધુ કેન્સરજન્ય રસાયણો હોય છે. જ્યારે ધૂમ્રપાન કરવામાં આવે છે ત્યારે નિકોટિન લોહીમાં ભણી જાય છે, જે માનસિક અને શારીરિક અવલંબનનું કારણ બને છે. વિકાસશીલ દેશોમાં વપરાતી સિગારેટમાં ટારની માગા વધારે હોય છે અને ફિલ્ટરનો ઉપયોગ થતો નથી, જે આરોગ્યને વધારે જોખમ કરી શકે છે. ભારતમાં કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તિએ ૭૦-૮૦નું છે. હાલમાં ભારતમાં કેન્સરના આશરે ૨૪ લાખ દર્દીઓ છે. ઉપરાંત દર વર્ષે બીજા ૮ લાખ જેટલા દર્દીઓ ઉમેરાય છે. ૪૮% પુરુષોમાં અને ૨૦% સ્ત્રીઓમાં કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. પુરુષોમાં મોં તથા ગળાનું કેન્સર અને સ્ત્રીઓમાં

સ્તરન અને ગભર્શયના મુખનું કેન્સર વધારે જેવા મળે છે. સ્તર અને ગભર્શયના મુખનું કેન્સર તમાકુના સેવનથી સંબંધિત નથી તથા મેમોગ્રાફી અને પેપ સ્મિરઅ ટેસ્ટ જેવી સાધી તપાસથી શરૂઆતના તબક્કામાં નિદાન થઈ શકે છે.

કેટલાક દેશોએ તમાકુના ઉપયોગને નિયંત્રિત કરવા માટે પગલાં લીધેલા છે. જેમાં વપરાશ અને વેચાણ પર નિયંત્રણ, પેકેજિંગ પર ચેતવણી સંદેશ, જાહેર સ્થળો પર ધૂમ્રપાન પ્રતિબંધ તથા તમાકુ ઉત્પાદન પર વધારાના કરનો સમાવેશ થાય છે. તમાકુ ઉત્પાદનો, એ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે અને તે લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉપરાંત લોકોની આર્થિક સ્થિતિ પણ ખોરવાય છે. આમ, આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઊભી થયેલ વૈશ્વિક કટોકટીને પહોંચી વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરૂરી છે. આમ, આ વર્ષે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે "છોડવા માટે કટિબધ્યતા" – ને મુખ્ય થીમ તરીકે પસંદ કરેલ છે.

યુવાનો બહોળા પ્રમાણમાં તમાકુનો ઉપયોગ પોતાની સાથીઓ સાથે દબાણના લીધે કે બહારી જીજાસાને કારણે સેવન કરતા જોવા મળે છે. તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટિન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટિન થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે પરંતુ ખૂબ લાંબા સમયે તે તમારા હદય, ફેફસાં, પેટ અને સાથે સાથે તમારા જીબનાંતુંઓને અસર કરે છે. એક સમયના અંતરે, વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટિનનું વ્યસન થઈ જાય છે અને તેના કારણે સ્વાસ્થ્યની ઘણી બધી ગંભીર અસર ઘેરી વળે છે. તમાકુની ખરાબ અસરો જોઈએ તો ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શાસમાંથી ગંધ આવવી અને કપડામાંથી ગંધ આવવી, ચામડી કરયલીવાળી થવી, દાંતો પીળા થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે હદયની બીમારી, શાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચ્યકા આવવા, કેન્સરના ઘણા બધા પ્રકારો – જો તેમે ધૂમ્રપાન કરતા નથી તેમ છતાં તેના સંપર્કના કારણે ઘણા બધા પ્રકારના કેન્સરનો ભોગ બની શકો છો. જેમ કે ફેફસાં, ગળું, પેટ, મૂત્રાશયનું કેન્સર –

આ સ્થિતિને નિષ્ઠિય ધૂમ્રપાન કહેવાય છે. નિષ્ઠિય ધૂમ્રપાનથી ઘણી બધી સ્વાસ્થ્ય સમર્થ્યાઓ ઉદ્ભવે છે. આમ, તે સક્રિય ધૂમ્રપાનના સ્વરૂપ જેટલું જ સમાન હાનિકારક છે.

તમાકુ છોડવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. તેમાં નિકોટિન એક મજબુત ઝેરી વસન છે. તેમ છતાં પણ યોગ્ય ઉપચારો સાથે અને અભિગમપૂર્વક વળગીને આ વસનને છોડવવા માટે ધૈર્યની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ રાખવી જોઈએ. તે એક દિવસમાં બંધ નથી થતું, પણ અનેક દિવસોના અંતે થાય છે. મોટાભાગના ડિસ્સાઓમાં વ્યક્તિ ક્ષણિક મોજ-મજા માટે તમાકુનો ઉપયોગ શરૂ કરે છે, જે આગળ જતાં વસનમાં પરિણમે છે અને તમાકુની અનુપસ્થિતિમાં અનુભવાતી બેચેની, અકળામણ, તણાવ, સુસ્તીને દૂર રાખવા તેનો ઉપયોગ કર્યે રાખે છે. તમાકુની લાંબાગાળાની આડઅસરો જેવી કે સ્ટ્રોક, ફેફસા, મોં, જલ કે સ્વરપેટીનું કેન્સર, હૃદયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનું કેન્સર, નંપુંસકતા જેવી અસરો પ્રત્યે જાગૃતિ

તથા તમાકુ મુક્તિના પ્રયાસો મનોચિકિત્સકની સીધી દેખરેખ હેઠળ કરવાથી પ્રયત્નો સફળ નીવડે છે.

પરોક્ષ ધૂમ્રપાન પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. પુરુષો કરતાં ખીઓમાં ધૂમ્રપાન વધારે જોખમી છે. એક અભ્યાસ અનુસાર પુરુષ ધૂમ્રકર્તા અને ખી ધૂમ્રકર્તાના સરેરાશ જીવનમાં અનુક્રમે ૧૩.૨ અને ૧૪.૫ વર્ષનો ઘટાડો થાય છે. ધૂમ્રપાનની આદત છોડવા અથવા લાગતી અટકાવવા – બાળકો અને ડિશોરોમાં શિક્ષણ અને સલાહ દ્વારા જાગૃતિ ફેલાવવી, સ્વસ્થ ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો. આપણે થાકેલા હોઈએ ત્યારે ધૂમ્રપાનની ઈચ્છા વધારે થાય છે. ધૂમ્રપાનની મંજૂરી ન હોય તેવી જગ્યાએ જાઓ. ધૂમ્રપાન ના કરનારાઓ સાથે સમય પસાર કરો. ધૂમ્રપાન છોડવા માટે પોઝિટિવ રહો અને નાસીપાસ થયા વગર સતત પ્રયત્નશીલ રહો.

સંદર્ભ : વિવિધ અભયારી અહેવાલો અને દાકતરી સલાહ, વિકીપીડિયા “પરમેશ્વરી”, પ્લોટ નંબર ૪૬૫, હોસ્પિટલ રોડ, વિજયનગર એરિયા, મુજફ્ફત, કર્ણાસ્થા ೫೭-૩૯૦ ૦૦૧. મો. ૯૮૮૮૦ ૭૭૮૮૬

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માસિક મુખ્યપત્ર ‘મંગલ મંદિર’માં પ્રકાશિત કરવા વિજ્ઞાપન માટે દરોની વિગત...

ક્રમ	ટાઈટલ	કલર	આખું પાનું	અડ્યું પાનું	પા પાનું	અન્ય
૧.	કવર પેઇઝ નં.-૪	મલ્ટિ કલર	૭,૦૦૦	૪,૫૦૦	૩,૦૦૦	—
૨.	કવર પેઇઝ નં. ૨ તથા ૩	મલ્ટિ કલર	૬,૦૦૦	૩,૫૦૦	૨,૫૦૦	—
૩.	કવર પેઇઝ ૨ તથા ઉની સામેનું પાનું	મલ્ટિ કલર	૫,૪૦૦	૩,૨૫૦	૨,૨૫૦	—
૪.	અંદરનું પાનું	મલ્ટિ કલર	૪,૦૦૦	૩,૦૦૦	૨,૦૦૦	—
૫.	અંદરનું પાનું	સિંગલ કલર	૪,૦૦૦	૨,૫૦૦	૧,૪૦૦	—
૬.	અંદરનું સાદું પાનું	બ્લેક એન્ડ વ્હાઈટ	૨,૦૦૦	૧,૪૦૦	૧,૦૦૦	—
૭.	ટચુકડી જાહેર ખબર ૧ કોલમ X ૫ સે.મી.	બ્લેક એન્ડ વ્હાઈટ	—	—	—	૫૦૦
૮.	સાદા પાનાની નીચે ૧ ઈચ્છની પઢી	બ્લેક એન્ડ વ્હાઈટ	—	—	—	૩૫૦

નોંધ : ૧. એક સાથે ૧૨ મહિનાની જાહેરાત આપનારને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

૨. એક સાથે ૬ મહિનાની જાહેરાત આપનારને ૭.૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

૩. એક સાથે ૩ મહિનાની જાહેરાત આપનારને ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


જરૂરી રકમ “શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”ના નામે મોકલાવવા વિનંતી.

(ઓનલાઈન / ડિજિટલ પેમેન્ટ માટેની જરૂરી વિગત અન્યત્ર આપી છે.)

નોંધ : જાહેરાતની સાઈઝ

(૧) ફુલ પેજ : ૧૮.૦ x ૨૩.૬ સે.મી. (૨) હાફ પેજ : ૧૮.૦ x ૧૧.૬ સે.મી.

(૩) ૧/૪ પેજ : ૬.૦ x ૧૧.૬ સે.મી. (૪) બોટમ પઢી : ૧૮.૦ x ૨.૫૪ સે.મી.



વિચાર મંચ

સ્વર્ગ અહીં જ છે, માત્ર આપણે એને પ્રાપ્ત કરવાની જરૂર છે



ડૉ. યાસીન દલાલ

હુનિયા એક ભીડ છે અને આ ભીડમાં માણસ એકલો પડી ગયો છે. અનેક વિચારકો વરસોથી આ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરે છે પણ આજે પણ એનો અંત નથી. હુનિયા એક મેળો છે જેમાં માણસ એકલો પડી ગયો છે. આમ કેમ થાય છે? ખરેખર તો માણસ એકલો પડે છે ત્યારે ભીતર જુએ છે તો ભીતરથી પણ એ એકલો છે. માણસની અંદર પણ ભીડ છે. આ એક વિચિત્ર સ્થિતિ છે. માણસ બહારની ભીડથી ગભરાય છે અને અંદર દોડે છે. પણ ત્યાં પણ ભીડ છે. આમ, માણસને કંઈ સમજતું જ નથી. એ સતત એક ધંધામાં પડ્યો રહે છે. એને કંઈ સમજતું નથી એટલે એ લગ્ન કરી લે છે પણ લગ્નમાં પણ શાંતિ મળતી નથી. ત્યાં પણ એ પીડાતો રહે છે. ખરેખર તો લગ્ન એ જિંદગીનો બીજો પડાવ છે. પણ આ પડાવ પણ દર્દનાક અને દ્યાજનાક છે.

માણસ જ્યારે એકલો રહી નથી શકતો તો કોઈની સાથે પણ કેવી રીતે રહે. કોઈ વ્યક્તિ કોઈની સાથે રહેવામાં અસર્મર્થ હોય એ એકલો રહે એમાં જ એનું ભલું છે. ખરેખર તો માણસને એકલા રહેતા પણ નથી આવડતું. એકાંતમાં રહેવું એ પણ એક કળા છે. પાર્ટીઓમાં અને મેળાઓમાં જવું એ એકાંતથી બચવાનો વર્થુ ઉપાય છે. આવા ઉપાયોથી એનું એકાંત દૂર નહીં થાય. એકલાપણું એ પણ એક જાતની કળા છે. માણસ એકલો રહી શકતો નથી અને એ એકલો છે એ તથને નકારી પણ શકતો નથી. મેલા પિક્ચરનું એક ગીત છે : ‘ચે જિંદગી કે મેલે, મેલે મેં હમ અકેલે, પાનીમેં મિલકે પાની, અંજામ ચે કે ફાની...’ જિંદગીભર માણસ એકાંતને દૂર કરવાના ઉપાય શોધતો રહે છે અને આ મજબૂરીમાં એ શાદી કરે છે પણ એકલાપણાનો અહેસાસ થાય છે. ત્યારે એ ફરીથી એકલો પડી જાય છે.

લગ્ન નિષ્ફળ જ જાય એ જરૂરી નથી. લગ્ન સર્ફન પણ થાય છે. શરત એ, કે એને કુરૂપ બનવા નહીં દેવા. જીવનનાં ૨૫ વરસ વાતવાતમાં વીતી જાય છે. આ પછી વિષાદની શરૂઆત થાય છે. બીજા ૨૫ વર્ષ અસંમજસમાં વીતે છે. આ ૨૫ વરસ સંવાદમાં પણ વીતી શકે. આપણા દેશે હુનિયાને જે આખ્યું છે, એમાં લગ્ન પણ એક છે. પણ હવે ખબર પડે છે કે એ તો એક પ્રયોગ હતો, જે સર્ફન પણ થાય છે અને નિષ્ફળ પણ જાય છે.

સર્ફનતાની પહેલી શરત એ છે કે માણસે મસ્તીમાં રહેવું જોઈએ. પણ આ મસ્તી બીજા ઉપર નિર્ભર નહીં હોવી જોઈએ. એકબીજાના ગુલામ હોય એ વિવાહિત જીવનના દંપત્તિ ન ગણાય. એક માણસ વિવાહની વાંસળી વગાડતો હોય તો એની સાથે સંગત માટે બીજો માણસ જોઈએ. લગ્ન બે વાદીઓ વચ્ચેની સંગત છે. વગાડવાવાળો અને સાંભળવાવાળા વચ્ચે તાલમેલ હોવો જોઈએ. લગ્ન એક પ્રકારની સંગત છે. હુનિયામાં દરરોજ સંઘાબંધ લગ્નનો થાય છે પણ એમાંથી બહુ થોડાક સર્ફન થાય છે. જે નિષ્ફળ જાય એ સંગતને કરણે જાય છે. આમાં પણ એકાંત જરૂરી છે.

કહે છે કે ઈતિહાસ પોતાને દોહરાવે છે. પણ જે દોહરાય છે એ ઈતિહાસ નહીં પણ માનવીની બેહોશી હોય છે. જ્યારે માનવજાત સંપૂર્ણપણે હોશમાં આવશે કે સભાન થશે ત્યારે સોકેટિસને ઝેર આપવામાં નહીં આવે. આ બધી આપણી ઘડેલી ઊંચાઈઓ છે. જૂનું વિજ્ઞાન ધર્મના પ્રત્યાધાતરૂપે સર્જયેલું હતું, જે નૂતન વિજ્ઞાનની વાત કરે છે. તે કોઈના પ્રત્યાધાતરૂપે નહીં પણ સર્જનાત્મકતાના ઉભરા રૂપે હશે. રાજકારણે વિજ્ઞાનને કલુષિત કરી નાખ્યું. રાજકારણનું હિત લડાઈમાં હતું. ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર ન કરી શક્યો. ધર્મમાં માનનારા વહેમી હતા અને વિજ્ઞાન વહેમોનું ખંડન કરનારું હતું. વિજ્ઞાને ૩૦૦ વરસ લડવામાં કાઢ્યા. વિજ્ઞાને હિરોશીમા અને નાગાસાકીનું સર્જન કર્યું છે.

ધર્મ એ વ્યક્તિની વ્યક્તિગત બાબત છે. સંગઠિત ધર્મોએ માનવજાતને ગેરમાર્ગ દોરી છે. જ્યાં સંગઠન હોય ત્યાં એનું બંધારણ હોય અને રીતરસમો હોય. ટૂંકમાં એ એક રાજકીય ઘટના છે, ધાર્મિક નથી. સત્તા મેળવવાનો એ બીજો રસ્તો છે. દરેક પાદરી એક દિવસ તો જરૂર પોપ બનવાની કે બિશપ બનવાની ઈચ્છા રાખે છે. આ આમાંથી જ અમલદારશાહી જન્મે છે. આમાંથી જ માણસનું પતન થાય છે. આ સામૂહિક ઘટના છે. સમૂહમાં હોય એ વ્યક્તિગત રીતે સારી અને સાચી હોય જ નહીં. વ્યક્તિગત પતન, એ સામૂહિક પતનમાં ફેરવાય છે. અહીં વ્યક્તિગત હોય તો ચાલે પણ સામૂહિક અહીં આખા સમૂહનું પતન નોતરે છે. એમ. એમ. શેખ જેવા વિચારકો વરસો પહેલા આ જ કહી ચૂક્યા છે. એમણે સામૂહિક અહીં વિશે વિસ્તારથી

વાત કરીને આપણને સૌને ચેતવી દીધા હતા પણ માનવજીતે આ ચેતવણી ગાણકારી નહીં. પરિણામે ધર્મ અહીં પાછો પડ્યો. ધર્મ વ્યક્તિગત ધોરણે જ સારું કામ કરી શકે. સામૂહિક ધોરણે એ નિષ્ફળ જવા જ સજાયેલો છે. માણસજીતનું પતન જે કારણોસર થયું એમાં ધર્મ અને જ્ઞાતિ મુખ્યત્વે જવાબદાર છે. માણસે બીજું કાંઈ ન કર્યું તો નાના નાના જ્ઞાતિ મંડળો બનાવવામાં પડી ગયા. એણે સામૂહિક પતન નોતર્યું.

પ્રકાશ દેખાતો નથી, માત્ર અનુભવી શકાય છે. જ્યારે કોઈ દેખાતું ન હોય તો આપણે અનુભવી શકીએ છીએ અને અનુમાન લગાવીએ છીએ કે પ્રકાશ છે. બાધ્ય જગતમાં પ્રકાશ એક અનુભવ છે. કોઈ ઓરડામાં કાંઈ હોય નહીં તો અંધારું હોય છે. પણ આપણે તો એ ઓરડામાં હોઈએ જ છીએ. મહત્વ આપણા હોવાનો છે. આપણી દાસ્તિ અંદરની હોવી જોઈએ. બાધ્ય પ્રકાશનો અનુભવ જરૂરી નથી, ભીતરનો અનુભવ જરૂરી છે. એ એક જતનો અંતર પ્રકાશ છે. પ્રારંભમાં એનો અનુભવ લેવાનો અધરો લાગશે. આપણે જોઈએ છીએ એ સ્મૃતિથી અને વાસનાથી જોઈએ છીએ. માણસે પહેલા એનો અનુભવ લેવાની કોશિશ કરવી જોઈએ. અંધારામાં પ્રવેશ કરવો જોઈએ. ધીમે ધીમે બધી વસ્તુઓ દેખાવા માંડશે. આપણી આંખો ધીમે ધીમે બહારની દુનિયાથી એડજસ્ટ થશે અને વ્યવસ્થિત થવામાં સમય લાગે પણ એ ન દેખાય તો આપણને કોઈ ટૂંકી નજરવાળા કહે તો એ ખોટું છે. હજારો માઈલ દૂર ઉગેલા તારા મનુષ્ય નરી આંખે જોઈ શકતો નથી. કારણકે આપણને નજીકની ચીજો જોવાનો જ અનુભવ છે. આનો ઉકેલ એ છે કે આપણે અંધારામાં પ્રવેશ કરવો જોઈએ અને પછી નજર બહાર ફેંકવી જોઈએ. આપણે વિચારોને બહાર નથી ફેંકી શકતા. વિચાર કોઈ વસ્તુ નથી. એ ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી. આપણે ગુરુસે થઈએ છીએ કે ભયભીત થઈએ છીએ. જો આપણે જ્ઞાતા નથી કે ગુરુસો ક્યાંથી આવ્યો. આપણા અનેક વિચારો, ઈચ્છાઓ, ઈર્ઝિં વગેરે દબાયેલા હોય છે. ખાલી જોવાથી કશું થતું નથી. ભીતર જોવાથી પ્રકાશ વહ્યો જરો અને દાસ્તિ ખુલતી જરો. આપણાને પ્રકાશિત વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ અને આપણે એના માલિક બની જશું.

પૃથ્વી ઉપર આપણે કંઈ પ્રદાન કરવું હોય તો ચારેતરફ પ્રેમ ફેલાવવો જોઈએ. વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને આપણા વિસ્તારને સ્વચ્છ રાખવો જોઈએ. હિંસાથી બચવું જોઈએ. આપણા દેશમાં ભિખારીઓ મોટી સંખ્યામાં છે. ખરેખર તો એ આપણી નાદારાનું પ્રતીક છે. આપણું ધન એ લોકો પાસે છે. કેટલાક લોકો ખેતી કરે છે તો કેટલાક વેપાર કરે છે. વિશ્વમાં બધે એવું નથી. પૈસો અને સંપત્તિ એટલા જ છે પણ કેટલાક લોકો એમાંથી મોટો હિસ્સો લૂંટી લે છે. નોબેલ નામનો માણસ દારુગોળામાંથી એટલું કમાયો કે એને અફસોસ થયો અને એણે એક

ફાઉન્ડેશનની સ્થાપના કરી અને નોબેલ ઈનામોની રચના કરી. મતલબ, કે હથિયારોનો મોટો ઉત્પાદક શાંતિનો મોટો ઉત્પાદક થઈ ગયો. પણ તોય દુનિયામાં શાંતિ સ્થપાઈ નહીં. એકબાજુ શાંતિની તૈયારીઓ ચાલે છે અને બીજી બાજુ ધડધડ બોંબનું ઉત્પાદન થાય છે. લોકતંત્ર, સમાજવાદ અને ફાંસીવાદ સાથે ચાલે છે. એક માન્યતા કે વિચારધારા ફાવી જાય છે કે તરત આપણે બીજી વિચારધારાને પકડીએ છીએ. એક બીમારી જાય છે અને બીજી આવે છે. કોઈ માણસ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી.


માણસની મુશ્કેલી જ આ છે. કરોડો વરસ પછી પણ એ જતને ઓળખતો નથી. પૃથ્વી ઉપર બુધ્ય અને મહાવીર પેદા થયા પણ માણસને ઓળખનાર પેદા થયો નથી. કદાચ એ ટૂંક સમયમાં પેદા થાય એમ પણ બને. પણ ત્યાં સુધીમાં તો આપણે અનુમાનો ઉપર જ જીવવાનું છે. ધરતી ઉપર સ્વર્ગ ઉત્તરી આવશે ખરું? એ પ્રશ્ન છે પણ ત્યાં સુધીમાં આપણને જેવી પૃથ્વી મળી છે, એને રહેવાલાયક બનાવીએ તો જ સ્વસ્થ અને રહેવા જેવી પૃથ્વી બનશે. અતીતના અનુભવમાંથી આપણે આ શીખવાનું છે. તો જ આપણને મુક્તિ મળી શકશે. એને માટે મૌલિક અને કાંતિકારી વિચારો જોઈએ તો જ મનુષ્યત્વ પ્રામ થશે. સ્વર્ગ ઉત્તરે એની કોઈ જરૂરત નથી. આપણી આજુબાજુ જે દેખાય છે, એ જ સ્વર્ગ છે. એને વધુ રહેવા જેવું બનાવવું પડશે. આપણે એને જોઈ શકતા નથી. પરિણામે આપણે એનાથી વંચિત છીએ. પણ પ્રયત્ન કરીએ તો સ્વર્ગ જરૂર આપણા હાથમાં જ છે. એમાં કોઈ જબરદસ્તી નથી, પ્રયત્ન કરવો જ છે.

સૌજન્ય પણ્ણકેશનસ
૫, સૌરાષ્ટ્ર કલાકેન્ડ સોસાયટી, રાજકોટ - ૩૬૦ ૦૦૭.
ફોન : (૦૨૮૧) ૨૫૭૫૩૨૭

‘મંગલ મંદિર’ના અંકો નિયમિત મળવા અંગે...

કોરોના વાયરસ સંક્રમણની ગંભીર પરિસ્થિતિના કારણે તથા જરૂરી સંખ્યામાં સ્ટાફ ન હોવાથી સ્થાનિક તેમજ અન્ય કેટલાક સ્થળોની પેટા પોસ્ટ ઓફિસો સંપૂર્ણ રીતે કાર્યરત નથી. જેનાં પરિણામે સામયિકના અંકો કોઈને નિયમિત રીતે મળે નહીં તેવી સ્થિતિ છે. ‘મંગલ મંદિર’ કાર્યાલયમાંથી સામયિકના અંકો દરેક ગ્રાહકશ્રીઓને પોસ્ટના માધ્યમથી જે-તે મહિનાની પાંચ તારીખે અચૂક રવાના થાય છે. તેમ છતાં અગર કોઈ ગ્રાહકશ્રીને કોઈ અંક મળે નહીં તો સંબંધિત પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા અનુરોધ છે.

– કાર્યાલય સ્ટાફ : પરાગ સોની
મો. ૯૪૩૯૯ ૨૩૪૭૪



વિચાર મંચ

સ્ત્રી : સંસારની રનોહ સરિતા...!



દિનેશ પાંચાલ - જર્નાલિસ્ટ

સ્ત્રીઓનું શોષણ થઈ શકે તે માટે તેની પાસે અનેક યોગ્યતાઓ છે. તે પ્રેમાળ છે એથી પ્રેમનો પેચ લગાવી પુરુષને તેને ભરદોરીએ કાપે છે. સ્ત્રી મધુરભાષી છે. પુરુષને બીજું શું જોઈએ? ડાયાબિટીસવાળો પુરુષ કારેલાનો કડવો રસ પી શકે પણ પત્તી તો મધમીઠી જ ખપે! મનુષ્ય જીવનની એ વણલખી આચારસંહિતા છે. જે મધુર છે, મનોહારી છે તેને મધપુડાની જેમ લોકો નીચોવી લે છે. એ ઉપકમે સ્ત્રીઓએ સંસારનાં સંચામાં પિલાઈને પોતાનો રસકસ નીચોવી દેવો પડે છે. સ્ત્રી જીવનની વિંબનાઓ જોતાં કંઈક એવું પ્રતીત થાય છે. સ્ત્રીના તન-મનનાં પ્રત્યેક સૌંદર્યસ્થાનો કે સદ્ગુણો પર પુરુષ આકમણ કરવાનું ચૂક્યો નથી. જેટલાં સૌંદર્યસ્થાનો તેટલા પ્રધારો!

કંઈક એવું સમજાય છે કુદરતે સ્ત્રીઓના મનોદૈહિક સૌંદર્ય પર થોડાં ઓછાં નકશીકામ કર્યા હોત તો તેનું શોષણ થોડું ઓછું થતું હોત. શાક માર્કેટમાં સફરજન વેચવાવાળો સફરજન પર કટકો ઘસી તેને ચકચકતું બનાવે તે રીતે કુદરતે સ્ત્રીને ચકચકતી બનાવી સંસારના શોપિંગ સેન્ટરમાં મૂકી છે. પુરુષે તેના પર છરી ચલાવી છે.

(આપણા ઉપર્યુક્ત ચિંતનનો કુદરતે પ્રત્યુત્તર વાળણો હોય તો સંભવત: તે કંઈક એ મતલબનું કહી શકે – ‘સ્ત્રીને સૌંદર્યમથી ન બનાવતાં બાવળના કાંટા સમી પીડાકારક, જેર સમી જીવલેણ, કે અજીનિ સમી દાહક બનાવી હોત તો આ સંસારમાં તેની ઉપયોગીતા જ શી રહી હોત? સ્ત્રી-પુરુષના પ્રેમાકર્ષણ વિના સૃષ્ટિ સંવર્ધનનો શુભ યજ્ઞ શી રીતે પાર પડ્યો હોત?’)

થોડું વધુ વિચારીએ તો સ્પષ્ટ સમજાઈ શકે છે કે સ્ત્રીઓનું ભરપૂર શોષણ કરી શકાય એવી તમામ સંભાવનાઓ કુદરતે તેના શારીરિક બંધારણમાં આપી છે. અને પુરુષને જીતીયતાથી માંડી પ્રજનન સુધીની ઘણી બાબતોમાં કુદરતે શોષણમુક્ત રાખ્યો છે. તે હરે છે, ફરે છે અને ચરે છે...! એક પુરુષ વર્ગ હવે એવી દલીલો કરે છે – ‘વર્તમાન યુગની નૂતન નારી પુરુષોના જુલ્દો વેઠીને ચૂપ રહે એવી ભલી, ભોળી કે ગરીબી રહી નથી. તે પૂરી તાકાતથી પુરુષશાસિત સમાજ સામે જરૂરે છે. એ ઝનૂનનું મૂર્ત સ્વરૂપ એટલે નારી સંરક્ષણગૃહો...! બધાં જ નારી સંરક્ષણગૃહો સ્ત્રીના હકોની ખડે પગે ચોકી કરે છે. જ્યારે પુરુષો

માટે એક પણ પુરુષ સંરક્ષણગૃહ નથી!’


પુરુષોની વાત સાવ ખોટી નથી. પરંતુ અહીં પ્રશ્ન ઉદ્ભબે છે આજે સમાજમાં કેટલી સ્ત્રીઓ જાગૃત છે? શિક્ષિત મહિલાઓનો બહુ નાનો વર્ગ પોતાના હક્કો, અધિકારો અને પોતાને પ્રામ થયેલી કાયદાકીય સુવિધા અંગે જાગૃત થઈ શક્યો છે. બાકીનો એક પ્રયંક વર્ગ હજુ તરેહ તરેહના શોષણ, અન્યાય, જુલ્દ, આધાત, ટોર્ચરિંગ વગેરે સહન કરતાં જવે છે. તેમને તેમનું શોષિત જીવન એવું કોઠે પડી ગયું છે કે તેમનું શોષણ થઈ રહ્યું છે એવો ખ્યાલ પણ તેમને આવતો નથી!

આજે બહુધા શિક્ષિત કુટુંબોમાં પતિનાં કપડાં પત્તીએ ઈંખી કરી આપવાં પડે છે. કેટલાંક ઘરોમાં પતિના બૂટ પોલિશ કરવાની જવાબદારી પણ પત્તીના શિરે હોય છે. સ્ત્રીઓ હવે શોષણમુક્ત બની છે એવી દલીલો કરનારને પૂછ્યાનું મન થાય છે, પત્તી પચ્ચીસ હજારનો પગાર લાવતી હોય તો પણ તેની ચંપલ તેનો પતિ પોલિશ કરી આપે છે ખરો? (હંમેશાં નહીં, તો સમગ્ર દાંપત્ય જીવન દરમિયાન એકાદવાર પણ કરી આપે છે ખરો?) સમાજમાં વારંવાર એવું બને છે કે સસરો અને જમાઈ વહુને જીવતી સળગાવી દે છે. કદી બે શોષિત વહુઓએ ભેગાં મળીને સસરા કે સાસુને સળગાવી દેવાની કોશિશ કરી છે ખરી?

બિહારમાં (આજે પણ) ગરીબ સ્ત્રીઓને દુબઈ વેચી દેવાનો ધંધો ધમધોકાર ચાલે છે. પછાત કોમની અસહાય અભણાઓને જહેરમાં નજન કરી ફેરવવાનું અધમ કૃત્ય બિહારમાં અનેકવાર થઈ ચૂક્યું છે. ચાલુ પરીક્ષાએ સેંકડો પરીક્ષાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીની (રીકુ પાટીલ) ને ભડભડ બાળી દેવાની ઘટનાથી માંડી સ્ત્રીને તંદુરી ચીકનની પેઠે ઓવનમાં બાળી નાખવાનું જધન્ય કૃત્ય આ મહાન ભારતમાં આચરવામાં આવ્યું છે અને તેથે દેશના જવાબદાર રાજકારણીઓ દ્વારા જ!

બીજી તરફ પતિએ કેરોસીન છાંટી સળગાવી દીધી હોય તેવી સ્ત્રી પણ પોતાનું બાળક નિરાધાર ન થઈ જાય તે માટે પતિને જેલમુક્ત રાખવા પોલીસને ખોટું બયાન આપી તેને બચાવી લે છે. સ્કૂલ કોલેજ જતી યુવતીઓને માર્ગમાં કોઈ દુષ સત્તાવે તો એવાને મોં ન આપવું એવી શિખામણો વડીલો આપે છે. માવતર

(અનુસંધાન : જુહો પાના નં. - ૧૫ ઉપર)



પ્રસંગ કથા

ભણતરનું વાવેતર



નટવર આહિલપરા

કમળેજ ગામ એટલે કમળેજ. નદી, વોંકળા, હુંગરા, સીમ, ખેતર, પાદર, ગામમાં અને ગામ ફરતે જાડવા ને કમળેજના માયાળુ માનવી. દસ હજાર વસતી ધરાવતા ગામમાં મંદિર, મસ્જિદ, દેરાસર શોભે છે. પ્રાથમિક - માધ્યમિક શાળાય ખરી. ઠાકોરજીના મંદિરે સવાર-સાંજ આરતી થાય. દરબારગઢમાં નિયમિત સભા મળે. કોઈને કાંઈ વેરજેર નહીં. બધા હળીમળીને રહે.

ગામ સુખી-સંપત્ત હોવા છતાં નારણ ભગત ઊડા વિચાર કર્યા કરે. તેઓ ગામની શાળાના આચાર્યપદેશી હમણાં જ નિવૃત્ત થયા હતા. ગામમાં અને આજુબાજુના ગામમાં હજુ અભિષે લોકો છે. તેને થોહું ઘણું અક્ષરજ્ઞાન આપવું છે તેવી તેમણે પ્રતિજ્ઞા લીધી.

કમળેજ ગામના બે-ગ્રાન્ટ શિક્ષક ભાઈ-બહેનને પોતાના વેર બોલાવ્યા. પોતાની ચિંતા વ્યક્ત કરી : “મેં તમને લોકોને અહીં એટલા માટે બોલાવ્યા છે કે, આપણા ગામને અને બાજુનાં ગામોને આપણે સો ટકા સાક્ષર બનાવવા છે. તેના માટે જોડાઈ જઈએ.” નારણ ભગતની વાત સાંભળી શિક્ષક ભાઈ-બહેનનોએ બીજું જરૂરી લીધું. આઈ-દસ દિવસમાં સર્વેક્ષણ કરી કમળેજ ગામના ઠાકોરજીના મંદિરે એક સાંજે નિરક્ષર બાળકો, યુવાનો, પ્રૌઢ તેમજ વૃધ્ઘોને ભેગા કર્યા.

નારણભગત આવ્યા. સૌઅં ઊભા થઈ તેમને વંદન કર્યા. ભગતે વાત માંડી : “મારા વહાલા બાળકો, ભાઈ-બહેનો, જમાનો બદલાયો છે. જગત આખું ક્ષાણેક્ષણો આગળ વધે છે અને આપણે બે આંકડા કે બે અક્ષર ન લખી શકીએ? આપણા માટે શરમ છે. તમને સૌને મારે વાત કહેવી છે. આપણું અમદાવાદ. હું વાત કરું છું ત્રણસો વર્ષ પહેલાની. અમદાવાદનાં વેગણપુર ગામમાં શામળ વીરેશ્વર ભણનો જન્મ થયો હતો. માતા આંણદાબાઈ અને પિતા વીરેશ્વરના આ સપૃતે સુંદર બોધ મળે તેવી કવિતા લખી. તેમાંની એક તમને સંભળાવું હોય!

વિદ્યા ભણિયો જેહ, તેહ ધેર વૈભવ રૂડો;

વિદ્યા ભણિયો જેહ, કામની કંચન-ચૂડો;

વિદ્યા ભણિયો જેહ, તેહ સદાવત આપે;

વિદ્યા ભણિયો જેહ, કષ પિયારાં કાપે;

વળી વિદ્યા ભણિયો જેહ જન, સકળ કળા ગુણ સારખા; શામળ કહે બીજા બાપડા, ખાણસરખા પારખા.

હવે, તમને કવિતાનો સાર કહું : “જે ભણે તેને બધા જ સુખ વૈભવ પ્રાપ્ત થાય છે. વિદ્યા ભણનારને સુંદર કન્યા તેમજ સુંદર અલંકાર પ્રાપ્ત થાય છે. ભણેલો માણસ સદાવતો ખોલી ગરીબોની સેવા કરે છે. ભણનાર હંમેશાં બીજાના દુઃખો કાપે છે. વિદ્યા ભણે તેમાં અનેક ગુણો - કળા હોય છે.”

પણ, કવિતાના અંતે કવિ શામળ અભિષે લોકો માટે શું કહે છે? તેઓ કહે છે કે, ન ભણે તે લોકો તો બિચારાં છે, પાણા જેવા છે. તો મારાં વહાલા ભાઈ-બહેનો, આપણે પાણા જેવા નથી થવું કે નથી થવું બિચારા!

હજુ આવી બીજી વાત કરું. મારી બહેનોને, માતાઓને, આપણા મોટા ગજના સુધારક કવિ નર્મદ. તેમણે સવાસો વર્ષ પહેલાં સ્ત્રીઓ ભણે તે માટે આગેવાની લીધી હતી.

નર્મદનો જન્મ સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ લાભશંકર અને માતાનું નામ નવદુર્ગાઈરી હતું. તેમનું મોટાભાગનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું. મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવી તેમણે સુરત અને મુંબઈની શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. એમના જમાનામાં વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજે ખૂબ ફેલાયેલા હતા. સમાજ સુધારાની પ્રવૃત્તિના તે અગ્રેસર રહ્યા હતા.

તેઓ કહેતા હતા કે, “જ્ઞાનબળથી આપણે બીજા પ્રાણીઓ કરતાં ઊંચા છીએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. માણસમાં સ્ત્રી અને પુરુષ બંને છે. સ્ત્રીના હક્ક ધણાખરા પુરુષ જેટલા જ છે. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. માટે જેમ આપણે પુરુષ હક્ક સમજી કેળવણીથી જ્ઞાનબળ વધારીએ છીએ, તેમ સ્ત્રી સહાયરૂપે આપણાં બળમાં વધારો કરે છે. ભણેલી સ્ત્રી પરમાત્મારૂપ સુખ-દુઃખની વાતો કરવાની લહેજત વધારે છે, ને દુઃખ દૂર કરે છે. ભણેલી સ્ત્રી પ્રિયારૂપે રસભર્યું સુખ વધારે ને વધારે આપ્યા કરે છે. જ્યાં રાજ અને પ્રધાન બંને ભણેલા ગણેલા ને સુધર હોય ત્યાં રાજના ઉત્કર્ષ વિશે પૂછવું જ શું? જ્યાં કેળવણીથી સરખાપણું શોભતું હોય છે ત્યાં જ સ્ત્રી પુરુષના મન એકલીજ સાથે મળે છે.

મિથ્યા કેટલાએક જણ કહે છે કે સ્વીજાત પુરુષજીતથી ઉત્તરતા દરજજે છે, ને તે તેની દાસી છે. મિથ્યા કેટલાએક કહે છે કે તેનામાં મોઢું જ્ઞાન મેળવવાનું સામર્થ્ય નથી. મિથ્યા કેટલાએક કહે છે કે જ્યારે તેઓ શીખવામાં વખત ગાળશે ત્યારે તેઓ પોતાનો ઘરધંધો ક્યારે કરશે ને તેઓ શું મરદનો ધંધો કરશે? ને મિથ્યા કેટલાએક કહે છે કે તેઓ કેળવણી લીધાથી બગડશે - તેઓમાં સ્વતંત્રતાનો જુસ્સો વધાથી તેઓ અમર્યાદ થશે - તેઓ નઠારી ચોપડી વાંચી બગડશે. લખાણની મારફતે સહેલથી કુકર્મ કરશે. કેળવણી તો દુર્ગુણને કહાડનારી છે. કેળવણીથી બગાડો થતો હોય તો તે પુરુષે પણ ન લેવી જોઈએ. હું તો કહું છું કે પુરુષ કરતાં સ્વીનું મન વધારે કોમળ છે. માટે એના ઉપર ભણતર ને નીતિની છાપ બાળપણથી પડે તો તે કદી પણ જાય નહીં. વળી, સ્વીનો સ્વભાવ જન્મથી જ નઠારો ને ન સુધરે તેવો હોય, તો જે સ્વીઓએ પોતાના વિદ્યા સદ્ગુણથી મોટા નામ મેળવ્યા છે તેના વિશે શું કહેવું? હાલમાં પણ આપણે જોઈએ છીએ કે સ્વીઓ શીખી શકે છે. લખતાં આવદેથી દુરાચાર કરશે એ કહેવું પણ નિરર્થક છે. લખવું - વાંચવું એ કંઈ કેળવણી નથી પણ તેનાં સાધન છે. એથી જ્ઞાન વહેલું ને સારું ગ્રામ થાય છે ને બીજાને આપી શકાય છે. વારુ, હું પૂરું છું કે લખતાં નથી આવડતું તે સ્વીઓ કુકર્મ નથી કરતી? કુકર્મ કરવા એને લખવા વાંચવા સાથે કશોય સંબંધ નથી. નીતિના બોધની ખામીથી અને નઠારી સંગતિથી કુકર્મ થાય છે એ કહેવું ખરું છે. જે સ્વી નીતિની કેળવણી લેશો તે કુમાર્ગ જશે જ નહીં. લખવા વાંચવાથી કાળા કર્મ કરનારી સ્વી કંઈ કેળવણી પામેલી કહેવાશે જ નહીં. સ્વીઓને શીખવી તેમની પાસે પુરુષનાં કામ જરૂર જાણી કરાવવા એમ નથી, પણ અગર જરૂર પડે અથવા અનુકૂળ હોય તો કરી શકે પણ એટલા જ માટે તેમને શીખવવું એમ નથી - તેમને શીખવવું એટલા માટે કે તેઓ જ્ઞાન મેળવે - તેઓ પોતાનો સ્વી જતનો ધર્મ સમજે - ઘર રૂડી રીતે ચલાવે - છોકરાંને કેળવણી આપે.

સ્વી કેળવણીથી થતા લાભમાં સ્વીઓ પોતાનાં પુરુષને અંતઃકરણથી ચહાય છે ને જ્યાં પ્રીત છે ત્યાં બંને પોતાને સુખ થાય તેમ પોતાની આબરુ વધે ને પોતાના બાળકનું ભલું થાય તેમ કરવામાં હોંસથી કેમ ઉઘોગ નહીં કરે? કેળવણી પામેલી સ્વી પોતાના પિયુની લાડલી ઘારી, સાચવટથી હુંમેશ વળગી રહે તેવો દોસ્ત થઈ રહે છે. ભણેલી સ્વી સુખમાં ગમ્ભત અને દુઃખમાં દિલાસો આપે છે. પુરુષના ઉધ્યત જુસ્સાને નરમ પાડનાર અને દુખિયારા પુરુષના આંસુ લૂધનાર તેને પોતાની વહાલી ભણેલી સ્વી જેવું કોણ છે? સંકટમાં સગાવહાલાં - દોસ્ત સો આદા ખસી જાય છે - ફક્ત સ્વી જ તેની થઈ રહે છે. હાલમાં જે થાય છે તે લોકલાજથી, હવે જે થશે તે નિજ ઉમંગથી ને

પોતાની ફરજ સમજીને. કેળવણી પામેલું સ્વીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી - જેમજેમ તે વપરાય છે, તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે. દુનિયાનો છેડો પોતીનું ઘર ને ઘરનો છેડો પોતાની સ્વી એ કહેવું ખોતું નથી. જેમ સ્વી વિના સંસાર સૂનો છે તેમ કેળવણીરહિત સ્વીથી સંસાર સિંહવાધના વાસવાણું ભયંકર રાન છે અને ભણેલી સ્વીથી સંસાર એક રમણીય બાગ છે."

'શ્રી પવનતનનય', પ્લોટ નં. ૬૫ ડી/ઓ, વિમલ નગર,
શેરી નં.-૩, આલાપ સેન્ટર્સ પાછળ, યુનિવર્સિટી રોડ,
રાજકોટ-૩૬૦ ૦૦૪. • મો. ૮૮૭૪૦ ૦૬૦૪૮

સ્વી : સંસારની સ્નેહ સરિતા...!


(અનુસંધાન : પાના નં. - ૧૩ ઉપરથી ચાલુ)

પાસેથી આવા સંસ્કાર પામેલી આ દેશની દીકરીઓ એ જ શિખામણના ઉપકમે જીવનભર પતિના અત્યાચારો વેઠી લે છે. સાસરિયાનું શોષણ સંહિતા કરતાં કરતાં સંસારના અગિન્કુંડમાં સ્વાહા થઈ જવું એ આ દેશની સ્વીઓ માટે સાંસ્કૃતિક ગૌરવ લેખાય છે. સાસરિયાના સિતમો અસ્વય બનતાં તે સળગી જાય છે ત્યારે એ ગૌરવનો ગુણાકાર થાય છે. લોકો તેના કાળા મેશ થઈ ગમેલા મૃત્તદેહ પર સહાનુભૂતિની અંજલિ આપે છે : 'બિચારી બહુ ભલી બાઈ હતી. જિંદગીભર સૌના જુલ્બો વેઠ્યા પણ કોઈની આગળ એક હરફ ના ઉચ્ચાર્યો!'

પુરુષને બાલ્યાવસ્થામાં દૂધ માટે માતાની જરૂર પડે છે. યુવાવસ્થામાં પ્રેમ કરવા માટે પ્રેમિકાની જરૂર પડે છે. રાખડી માટે બહેનની જરૂર પડે છે. વારસદાર માટે તેની કૂખની જરૂર પડે છે. પત્નીથી ઊંઘા થાય ત્યારે કોઈ રૂપજવિનીની જરૂર પડે છે અને અંતે પોતાના મૃત્યુ પર બંગડી તોડીને પોક મૂકનાર એક વિધવાની પણ જરૂર પડે છે! આવું મહત્વ ધરાવતી સ્વી પર પુરુષ રીતે ત્યારે તે કહે છે : 'ઓરત મહાસતી હૈ...!' અને બિજાય ત્યારે કહે છે : 'તું પૈરકી જૂતી હૈ...!'

આપણી સાંસ્કૃતિક શરમ એ છે કે આપણે ફલાણી માતાની જય બોલાવીએ છીએ અને ઢીકણી માતાનું મંદિર બંધાવવા ફાળો ઉધરાવીએ છીએ. પણ પુરુષની લાત વાગતાં સીધી રોડ પર આવી પડતી કમનસીબ સ્વીઓ માટે આપણે કાંઈ કરી શક્યા નથી. અમેરિકામાં આવી તમામ ત્યક્તાઓનો ખર્ચ ત્યાંના ચર્ચો ઉપાડે છે. આપણે ત્યાં પથ્થરના ભગવાનની જેટલી કાળજી રખાય છે તેટલી જુવતા માણસોની નથી રખાતી.

સી-૧૨, મજૂર મહાજાન સોસાગટી,
ગાંધેવી રોડ, જમાતપેર,
નવસારી-૩૬૬ ૪૨૭ (ગુજરાત).
મો. ૮૪૨૮૧ ૬૦૫૦૮



નવલિકા

ચિત્રકાર



રમેશ પટેલ

નોંધ : લેખક-કવિશ્રી રમેશભાઈ પટેલની દરેક રચનાઓ ખૂબ જ દમદાર હોવાથી તે હંમેશાં લોકપ્રિય બને છે. તેમની કૃતિઓના કેટલાક અંશોનો ઉપયોગ કોઈ સ્થાને સંદર્ભમાં થતો હોય છે. આ જ સજ્જકની સજ્જન શક્તિની સાર્થકતા છે. રમેશભાઈએ B.Sc., M.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની ઘડી ગજલોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. જે તેમની સાહિત્ય જગત જેતની બંંદી સાધના અને મહેનતનું પરિણામ છે.

આકાશવાણી - અમદાવાદ અને વડોદરાના માન્ય કવિ - ગજલકાર રમેશભાઈએ અનેક વિષયોને આવરી લેતા લગભગ એકસોથી વધારે પુસ્તકોનું સજ્જન કર્યું છે, જે એક ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. સાચે ૧૯૭૮થી પ્રતિષ્ઠિત અનેક સામયિકોમાં તેમની કૃતિઓ પ્રકાશિત થતી રહી છે. નોંધનીય છે કે, તેમની ઉમદા સાહિત્ય સાધના અનેક સન્માન અને એંવોર્ડથી વિભૂષિત થઈ છે.

આવા એક લખ્યપ્રતિષ્ઠિત લેખક-કવિશ્રીનું એક વધુ 'ચિત્રકાર' નવલિકા સંગ્રહ પ્રગટ થવાના તબક્કામાં છે. તે રસપ્રદ સંગ્રહનો એક મણકો અત્રે પ્રસ્તુત છે.

- દાખી મંડળ

નિશાના કાજળાંથે રાંધકાર પછી સૂર્યદિવતાના આગમનની રાહ જોતો ચિત્રકાર એક હાથમાં કાગળ પીંછી લઈને ખુલ્લા મેદાનમાં બેઠો હતો.

થોડીવાર પછી સૂર્યદિવનું આગમન થતાં ચિત્રકારે નતમસ્તક વંદન કર્યું. પૂર્વકાશમાં પૃથ્વીના ગોળા જેવા સૂર્યએ ક્ષિતિજમાં લાલિમાં પ્રસરાવી દીધી. તે વખતે કલારસિક આ ચિત્રકારે આ દશ્યને પોતાના કાગળ ઉપર કંડારી દીધું. નદી અને પર્વતમાળામાંથી ડોકિયું કરતા સૂર્યનું તેણે કાગળ ઉપર આબેહૂલ ચિત્ર દોર્યું.

નાનપણથી એને ચિત્ર દોરવાનો ભારે શોખ. જબરી કલ્પનાશક્તિ અને અથાર મહેનતને કારણે સાંજે તો એ રંગ અને રેખાનો અમર આકાર બની ગયો હતો. એમનાં ચિત્રો જોતાં એમની ચિત્ર વિષયને આત્મસાત્ત કરવાની શક્તિનો પરિચય થાય છે. પરંપરાગત દશ્ય સંયોજનથી સાવ વેગળા રહીને નિજ શૈલી ઉપસાવવાનો ગર્વ અનુભવે છે.

નાના લેન્ડસ્કેપ અને ખડકોના અમૂર્ત તરફ જતાં ચિત્રોમાં રંગોની પારદર્શિતા એનું આકર્ષણ લક્ષ્ણ બની ગયું છે. નજરને દૂર દૂર લઈ જતી ધાસ કાપી કેડીઓ, ઢોળાવો પરથી સરકતી અને અંધારી ઝીણોમાં ખોવાઈ જતી લીલોતરી, વિવિધ રમણીય ધારાઓ પ્રગટ કરતાં નાનાં-મોટાં વૃક્ષો, અલપઅલપ રેખાઓમાં

આલેખાયેલા આવૃત્ત માનવ દેહની આસપાસ લગભગ એની અંદરથી જ ફૂટી નીકળી હોય એવી વૃક્ષરાજ અને ગામની સીમામાં ઢોર ચરાવતો ગોવાળિયો, કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારી કે ચલમ ફૂંકતો કોઈ વૃદ્ધ સૌરાષ્ટ્રવાસી વગેરે એની ચિત્રસૂચિના કેન્દ્રમાં રહ્યાં છે.

એણે કદી કોઈ પ્રદર્શનનું આયોજન કર્યું નથી કે નથી કોઈ વન-મેન શો નું. પ્રકૃતિ અને એમાં રંગોથી અનાવૃત્ત આકૃતિઓ દોરવાનો એને ખૂબ શોખ છે. પરંતુ એને ક્રાતિનો કે નામનો મોહ નથી, એટલે તો એ નાની સરખી ઓરડીમાં એ પડ્યો રહે છે. આજ સુધીમાં દરેક ચિત્ર - પ્રદર્શનોમાં હોય છે એટલાં ચિત્રો એણે દોર્યાં છે, તો મોટાં મોટાં શહેરોમાં ચિત્ર-પ્રદર્શનો યોજ ચિત્રકલાને ધબકતી રાખી શકે એમ છે.

નાનપણથી મા-બાપને ખોઈ બેઠેલો. માની મમતા અને બાપનો પ્રેમ મેળવવામાં અસમર્થ રહેલા આ ચિત્રકાર ભાગ્ય અજમાવવા કે મોહ-લાલચમાં પડવા કદી શહેરમાં ગયો નથી. કુદરતને ખોળે બેસી પ્રકૃતિનાં ભરપેટ દર્શન કરવામાં એને મજા પડતી અને તેનું ચિત્ર સહજવારમાં દોરી નાખતો.

એક દિવસ શહેરના મોટા ઉદ્ઘોગપતિની દીકરી સુનંદા એકાએક આ ચિત્રકારના આંગણે જઈ પહોંચી. ‘નમસ્કાર’ કરી એ કમરામાં દાખલ થઈ.

ચિત્રકારે આ યુવતીને આ પહેલાં કહી જોઈ ન હતી. જેથી તેને જિજ્ઞાસાથી જોઈ રહ્યો. એટલામાં તે સસ્પિત બોલી, ‘મારું નામ સુનંદા છે અને હું શહેરના જાણીતા ઉદ્ઘોગપતિ શેરથ માણેકલાલની પુત્રી છું.’ પછી તેણે ઉમેર્યું, ‘આપનું નામ અનિરુદ્ધ છે ને? મેં સાંભળ્યું છે કે, આપ ચિત્રો ખૂબ સુંદર દોરો છો.’

‘આપે ઠીક કહ્યું. મારું જ નામ અનિરુદ્ધ છે. હું ચિત્રો ખૂબ સુંદર દોરું છું એ હું કેમ કહી શકું? મતલબ કે મારા મુખથી મારી પ્રશંસા તો હું નહીં જ કરી શકું ને?’

‘આપનાં દોરેલાં ચિત્રો મને બતાવશો?’

‘બેશક ચાલો, બાજુના કમરામાં. ત્યાં મારા ચિત્રો છે.’ કહી ચિત્રકાર ઊઠ્યો. એની પાછળ પાછળ સુનંદા પણ જવા લાગી. આ આલબમમાં થોડાં ચિત્રો છે અને બીજાં આ ભીત પર ટાંગ્યા છે. આપ, આ ચિત્રોને મનને ગમે ત્યાં સુધી જોઈ શકો છો.’ ચિત્રકાર બોલ્યો.

સુનંદાને ચિત્રકારનું આ વાક્ય ધંનું જ ગમ્યું અને એ ભીત પર લટકાવેલાં ચિત્રો જોવામાં થોડીવાર સુધી તહ્લીન બની. પછી તેના મુખેથી પ્રશંસાના ઝરણાં વહેવા માંડયા.

‘અરે, આ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. એમની આંખોમાં સત્ય અને અહિસાના ગુણો પ્રદાન કરેલા દેખાય છે. એમના શરીર પર તદ્દન સાઢ્યાનાં લક્ષણો જોવાં મળે છે. એમના હાડમાંસ ઉપરથી જગતને જીતવાની અને જન સમૃદ્ધાયની ઉન્નતિ માટે પોતે નિયોવાઈ રહ્યા હોય તેવા ભાવો દેખાય છે.’

આ બીજું ચિત્ર કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું છે. શેત વાળ અને સર્ફેટ લાંબી દાઢીવાળા આ માનવીના ચહેરામાં કેટલું બધું અમીરસ છુપાયેલું છે. આપણા રાષ્ટ્રગીતના રચયિતા અને ગીતાંજલિ જેવા પુસ્તકના માટે નોબેલ પ્રાઇઝ મેળવતા આ કવિવરની આંખોમાં ચિત્રકારે દેશદાન અને સહિષ્ણુતાના કેવા અદ્ભુત ભાવો મૂક્યા છે. આ બાજુ કોસ પર લટકેલું આ કોણ છે? એ છે દુનિયાને સત્ય અને પ્રેમનો સંદેશો આપનાર અને કરુણાના સાગર જિસસ કાદિસ્ટ છે! આ છે અહિસા પરમો ધર્મનું સૂત્ર આપનાર મહાવીર સ્વામી! એમના ચહેરા પર જગતના માનવીનાં દુઃખો જાણીને વિષાદથી છવાયેલો દેખાય છે. અરે! આ તો શકુંતલા છે. હા, કાલીદાસની શકુંતલા! એની યાદીરીના પ્રસંગનું ચિત્ર કેવું આબેહૂબ બનાયું છે. ઋષિમુનિ, સાહેલીઓ અને વનનાં અનેક પ્રાણીઓના સહવાસથી વિભૂતિ પડનારી શકુંતલાના ચહેરાના હાવભાવ એવા સરસ દોર્યાં છે કે શકુંતલાની વિદાયથી આખા આશ્રમમાં કરુણતા છવાઈ ગઈ છે અને એ કરુણતા જોઈને આપણી આંખો પણ ભીની બની જાય છે. પછી... સુનંદા ધીમે પગલે ચિત્રો જોતી આગળ વધે છે.

બંસીધર કનૈયો, રથ હંકતો અર્જુન, બળબળતી રેતી પર દોડતું ઊંટ, જાડ નીચે નિરાંતે ઊંઘતો ફેરિયો, હાથલારીમાં માલ લઈ જતી વાગરી કોમની કોઈ ક્ષેત્ર કે ચલમ ફૂકતો કે કોઈ બજરિયો...! એ બધું નિજ શૈલીમાં ચિત્રકારે વિકસાયું છે. અહીં પ્રકૃતિ ખીલી છે અને સ્વીનું સૌંદર્ય લાલિત્ય ધારણ કરી રહ્યું છે. રક્ષ અને રેખા અને લયના કસબથી ચિત્રકારે ખરેખર તેની અદ્ભુત કલાનું પ્રદર્શન કર્યું છે. ચિત્રો જોઈ સુનંદા પ્રસંગતા અનુભવી રહી છે.

‘આપ કોઈ મોટા શહેરમાં જઈ આપની કલાની કિમત ઉપજાવો તો... આપના પ્રશંસની વધી નહીં પડે?’ સુનંદાએ ચિત્રકાર તરફ જોઈ લાગણીથી પૂછ્યું.

‘શહેરમાં? તમારા પ્રદૂષણથી ખદબદતા શહેરમાં? જ્યાં ચોખ્ખી હવા લેવાનાં ફાંફા પડે છે. જ્યાં માનવ મહેરામણ ઊભરાય છે ત્યાં મને ચિત્રો દોરવાની પ્રેરણા ક્યાંથી મળવાની હતી? જાણો છો? લેખક, કવિ કે ચિત્રકાર... પ્રેરણા સિવાય કોઈ રચના કરી શકતો નથી. પદાડ, નદી, હુંગરો, ક્ષિતિજો અને વસંતની ગેહુરાઓમાંથી અમને પ્રેરણા મળે છે. ધુઘવાતો સાગર અને ગાતાં ઝરણાંઓ અને વનની વનરાજીઓ જોઈને અમારામાં કલાની સરવાજીઓ ફૂટે છે! આ બધું તમારા શહેરમાં મળશે ખરું? બોલો... સુનંદા દેવી બોલો.’ ચિત્રકારે એકદમ ભારે અવાજે પૂછ્યું.

સુનંદા તો ચિત્રકારનો આ પ્રશ્ન સાંભળીને એકદમ ડવાઈ ગઈ. ચિત્રકાર ઠીક જ કહે છે, કુદરતનું સાચું સ્વરૂપ તો ગામડામાં જ જોવા મળે છે. શહેરની ઝકમજાળ જિંદગીમાં આ બધું ક્યાં છે? મેલેરિયા, કોલેરા, ટાઈફોઇઝ જોવા રોગોનું જ્યાં સંગ્રહસ્થાન છે એવી શહેરી વસ્તીમાં એમને પ્રેરણા ક્યાંથી મળવાની હતી? શેર-સર્વો, જુગાર અને દારુના અડાઓ જ્યાં બેરોકટોક ચાલતા હોય ત્યાં એમની કલા માટે કેવી પ્રેરણા મળે છે?’

સુનંદા... એકાએક વિચારે ચઢી ગઈ.

‘મારા પ્રશ્નનો ઉત્તર?’

થોડીવાર રહી નિદ્રામાંથી જગાડતાં ચિત્રકારે એકાએક સુનંદાને પ્રશ્ન કર્યો.

‘આપની પ્રેરણા હું થાઉં તો?’ સુનંદાના પ્રશ્નએ ચિત્રકારને ચોંકાવી દીધા.

‘તમે પ્રેરણા બનો તો સ્વીના દેહપ્રકૃતિના સૌંદર્ય સિવાય બીજું મને શું મળવાનું હતું?’ વળી, એ પણ જાણી લ્યો... પ્રેરણા અને કલાકાર એ બેનો નાજુક સંબંધ હોય છે. બંને સાંનિધ્યમાં હોય તોજ કલાનો ઉદ્ભબ થાય. કલાની સરવાજી ક્યારે ફૂટે તે નક્કી હોતું નથી. જ્યારે કોઈ તાલાવેલી જાગે છે ત્યારે કલાનો જન્મ થાય છે. બોલો, તમે મારા સાનિધ્યમાં ચોવીસ

કલાક રહી શકશો?

ચિત્રકારનો આ કેવો વિચિત્ર પ્રશ્ન હતો. સુનંદા એકદમ તાજજુબ થઈ ગઈ. તેણે ક્યાંય સુધી ચિત્રકારના ચહેરા તરફ જોયા કર્યું. પછી તેણે ખૂબ જ ઠાવકાઈથી કહ્યું, ‘તમો મારી સાથે ચાલો. હું તમારી રહેવા-ખાવાની બધી જ વ્યવસ્થા કરી આપીશ અને તમારી ચિત્ર અને કલાને ધબકતી રાખવા ટેર ટેર પ્રદર્શન યોજશ. પછી તો તમારાં ચિત્રોથી રસિકજનોનો પરિચય વધી જશે. લોકો તમારી પ્રશંસા કરશે. કીર્તિ, કલદાર અને નામ – એ બધું જ તમે થોડા સમયમાં કમાશો!’

‘મને એની પડી નથી. પૈસાની લાલયમાં હું ચિત્ર બનાવતો નથી. આ બધું જ મને તમો અપાવશો તો હું પૂર્ણ બની જઈશ. મારી ફિલોસોફી મુજબ તેની કલાનો અને તેના જીવનનો અંત આવે છે! આપને તો સુવિદિત છે કે દરેક માનવી કોઈ આકંક્ષા... કોઈ અરમાન, કોઈ આશા લઈને જીવતો હોય છે... જે પૂરી થતાં એને જીવવા માટે બીજી કોઈ આકંક્ષા બાકી રહેતી નથી.’ અને હા, માનવી પૂર્ણ બને છે ત્યારે એ જાગો સમય ટકી શકતો નથી. એનો જલ્દી અંત આવી જાય છે.’

ચિત્રકારનું આ તર્કશાસ્ત સુનંદા સમજ ન શકી.

પાછી જવા માટે એ ઉભી થઈ ત્યાં એની નજર એક અધૂરા ચિત્ર ઉપર પડી. કાગળો, રંગોની ડબ્બીઓ તથા રંગ-પીંછી અસ્તવ્યસ્ત પડ્યાં હતાં. બાજુમાં એક પુરાણું ટેબલ પડ્યું હતું. જેમાં બધા રંગો ઢોળાયેલા હતા. ટેબલનો મૂળ રંગ કયો હતો તે જાણી શકતું નો’તું!

કુતૂહલભાવે સુનંદાએ પૂછ્યું, ‘આ અધૂરું ચિત્ર આપ ક્યારે પૂરું કરશો?’

‘કુદરતની આ વિશાળ ધરતીમાંથી જ્યારે મને કોઈ પ્રેરણા મળશે, મારા હૈયામાં તે ચિત્ર પૂરું કરવાની તાલાવેલી જાગશે, મારી પાસેના બધા રંગો કોઈ સુંદર ચિત્રમાં ચાગવા એકદમ અધીરા બનશે ત્યારે હું આ અધૂરું ચિત્ર પૂરું કરીશ. જે ચિત્ર સર્વોત્તમ હશે એ ચિત્રમાં સજીવનતા લાવવા... હું ખૂબ મથામણ કરીશ. કદાચ એ ચિત્ર વિઘ્યાત મોનાલિસાના ચિત્ર કરતાંય સુંદર હશે!’

‘આપ એ ચિત્રને દુનિયાની હરીફાઈમાં મૂકુશો ખરા?’

‘મારી ફિલોસોફી મેં તમને જણાવી છે. માનવી બધાં સોપાનો સર કરે એ પડતીની નિશાની છે. પૂર્ણ માનવી વધુ લાંબું જીવતો નથી. મારે વધુ જીવવું હશે તો કદાચ હું એમ ન કરું.’

‘કલાકારની સાચી ઓળખ માટે આ જરૂરી નથી શું?’

‘પ્રશંસાની... કે ઓળખની મને કાંઈ પડી નથી.’

‘અને હું ઈચ્છું તો પણ?’

‘એનો જવાબ હું અત્યારે ન આપી શકું. મારું અધૂરું ચિત્ર

પૂરું થયા પછી એ નયનાકર્ષક બને તો કદાચ મારો ઈરાદો બદલાય પણ ખરો કેમકે માનવી સત્તા, ધનલાલસા અને કીર્તિના વધુ પડતા મોહમાં આદિકળાથી તણાતો આવ્યો છે. હું જો કે સિદ્ધાંતમાં માનું છું. ગમે ત્યારે મારો સિદ્ધાંત કદાચ બદલાઈ પણ જાય. આખરે હું પણ તમારા જેવો માનવી જ છું ને?’

‘વાહ! ચિત્રકાર... વાહ! આજે હું તમારી ઉપર અતિ પ્રસન્ન છું. મારા રોમેરોમ તમારી ઉપર પ્રસન્ન થઈ ગયા છે. તમો અત્યારે મારી પાસે જે માંગો તે આપવા હું તૈયાર છું! બોલો શું માંગો છો?’

‘તમારો પ્રેમ મળે એ જ મારે મન બહુ છે.’

‘પ્રેમ!’ કહેતા સુનંદાથી મીહું સ્મિત વેરાઈ ગયું.

‘મારો પ્રેમ તમને સદા મળતો રહેશે. અચા ત્યારે બાય... બાય...!’ એમ કહી સુનંદા જડપભેર કારમાં બેસીને ચાલી ગઈ.

આ વાતને ખાસ્સા બે મહિના વીતી ગયા. એક પૂર્ણિમાની રાત્રે એકાએક સુનંદા ચિત્રકારના ધરે આવી પહોંચ્યો. ચિત્રકાર ધરમાં ન હતા. જેથી તેને ખોળતાં ખોળતાં સરિતા કાંઠે પહોંચ્યો રહી હતી. તે...

ચાલતાં ચાલતાં સુનંદાનું હૃદય પ્રહૃદિલિત થઈ ગયું. નીલું આકાશ અને પીળાં પાંદાંઓથી લચી પડતાં ચેસ્ટનટનાં ધરાદાર વૃક્ષોનું પ્રતિબિંબ સરિતાનાં જલતરંગોમાં ર્યાતું હતું અને વિખરાઈ જતું હતું. લહેરાતા આકાશના પ્રતિબિંબ જેવી ભૂરાશ એની આંખોમાં દેખાતી હતી.

સ્થિગારેટનો દમ ખેંચી ચિત્રકાર ફરી ચિત્ર દોરવા લાગ્યો.

લાકડાના સ્ટેન્ડ ઉપર ચીપકાવેલા કાગળ ઉપર એની પીછી ફરવા લાગી હતી. કોઈ પ્રશ્ન મુજબ યુવતીનું ચિત્ર દોરાઈ રહ્યું હતું. એ ચિત્રની આસપાસ સુંદર બાગમાં ફૂલો હસી પડ્યાં હતાં. ચિત્રનો આખરી ઓપ આપવાનો હજી બાકી હતો. સુનંદા એકદમ ચિત્રકાર સમીપ પહોંચ્યો અને ચિત્રકારને નમસ્કાર કર્યા પછી દોરાયેલા ચિત્રને એ મુખ્યપણે જોઈ રહી.

ગુલછડી જેવું ગુલાબી બદન, કાજળાભરી અણિયારી આંખો, સુંદર ભરાવદાર ચહેરો, પાતળી કમર, કમરદંડ સરખા સુંવાળા હાથ, પગમાં નૂપુર... અને માથામાં ફૂલનો ગજરો... ચિત્રકારે આ મુખ્યતાના સૌંદર્યને ઓર ખીલવી હતી.

ઢળી રાતની ઢંડી હવાઓ... સુનંદાનો રોમે-રોમમાંથી જુવાનીના ઝંકારો ઊઠતા હતા. આ ચિત્ર કોનું હશે? દુષ્ટાંત્રી શરૂતલાનું કે... ચિત્રકારની કોઈ પ્રિયતમાનું! યૌવનજાતિ દેહવલ્લારી ઉપર સોહી રહેલી કંચૂકીની કસો તરફ જોઈ રહેલી સુનંદાને ઘડીભર વિચાર આવ્યો.

બદલાતી મોસમની નવી ગંધમાં પુરાણી મોસમની જરી જતી ગંધતલિકાની તરેણ... ઝતુ-રાણી ચારે ઓર ખીલી હતી.

‘કોણ હશે?’ વારેવારે એના હૈયામાં આ પ્રશ્ન ઉઠતો હતો.

ત્યાં મુખ પર પ્રસંગતાનો મલકાટ અને... આવકારનો ભાવ પ્રકટાવી ચિત્રકારે પૂછ્યું : ‘આપ... અત્યારે...? આટલી મોડી રાત્રે?’

‘તમારા દર્શનની અભિલાષામાં ઘેર ગઈ. પણ ત્યાં તમો ન મળ્યા. એટલે... તમને ખોળતી ખોળતી અહીં આવી પહોંચી.’ સુનંદાએ પોતાની મીઠી જબાનમાં જવાબ આપ્યો.

‘વેલ! એ તો સારું થયું.’

‘આ ચિત્ર કોનું દોરો છો? કેટલી સુંદર છે એ!’

‘એક ભારતીય નારીનું!’

‘આપ... એની સાચી ઓળખાણ ન આપશો?’

‘ભારતની પ્રત્યેક નારી સુંદર છે. એની ઓળખાણ શી આપવાની હોય?’

‘આપ... સાચો જવાબ મને આપતા નથી.’

‘એ તમારી ખોટી માન્યતા છે.’ બાકી ચિત્રકારો તો એનામાં રહેલી વેદના પ્રગટ કરવા જ ચિત્રની ભીની જમીન પર પીંછીનો લસરકો માર્યો. ચિત્રમાંની યુવતીના ભૂખરા વાળમાં સોનેરી ચમક આવી ગઈ અને તેના પાતળા હોઠો ગુલાબી બની ગયા.

‘વાહ! અદ્ભુતા!’ સુનંદા ચિત્રકારના વખાણ કરી રહી હતી. પરંતુ અત્યારે ચિત્રકારને પ્રશંસાની કાંઈ પડી નહોતી. થોડીવાર પછી ચિત્રકાર તેની સામગ્રી એકઠી કરી ઘરે જવા લાગ્યો ત્યારે સુનંદાને એકદમ આશ્રય થયું.

‘હું તમને મળવા આવી ને તમો આમ એકાએક?’

‘હા, સુનંદા દેવી! મારે હવે જવું જોઈએ. કેમકે રાત ઘડી વીતી ગઈ છે.’ એમ કહી ચિત્રકારે ચાલવા માંગ્યું.

‘અરે, જરા ઊભા તો રહો!’

‘મને મારા ચિત્રની રેખા મળી ગઈ છે. એટલે હું ઘેર જઈને પેલું અધૂરું ચિત્ર જલદી જલદી પૂરું કરવા માંગું છું.’ તે જ વખત સુનંદાને વિચાર આવ્યો તો શું ચિત્રકાર પૂર્ણ માનવી બનશે...’ માનવી પૂર્ણ બને છે ત્યારે એ! અને સુનંદા આગળ વિચારી ન શકી.’

ચિત્રકાર ચાલ્યો ગયો. સુનંદા સાવ નિરાશ થઈ ગઈ.

બીજે જ દિવસે સુનંદા ફરી એના ઘરે મળવા ગઈ. ત્યારે એના ઘરમાં ચિર ઠામ શાંતિ છવાયેલી હતી.

‘ચિત્રકાર! ચિત્રકાર!’ સુનંદાએ મોટેથી બૂમ પાડી પરંતુ અંદરથી કાંઈ જવાબ ન મળ્યો.

એ ઘણા ગભરાટથી આગળ વધી ત્યાં ચિત્રકારને ચિરશાંતિમાં પોઢેલો જોઈ, સુનંદા લાંબી ચીસ પાડી ઊઠી. ‘ચિત્રકાર! તમે આ શું કર્યું? ખરેખર માનવી પૂર્ણ બને છે

ત્યારે લાંબો સમય જુવતો નથી.’ તમારી આ વાણી તમે સાચી બનાવી દીધી. એમ કહેતાં સુનંદાની આંખો ભીની બની ગઈ. પછી... તેની નજર ચિત્રકારના નિર્જવ દેહ પાસે પેલું અધૂરું ચિત્ર પૂરું કરેલું હતું તે તરફ ગઈ.

મોનાલીસા કરતાં આ ચિત્ર ખૂબ સુંદર બન્યું હતું. ચિત્ર જોઈને સુનંદા એકદમ મુંધ બની ગઈ. ચિત્ર નીચે લખ્યું હતું : ‘પરિતોષ.’ એ કચાંચ સુધી ચિત્રકારની આ કલાકૃતિને નિહાળી રહી. પછી તેણે ચિત્રકારની પથારીમાં પડેલો એક પત્ર જોયો અને તેણે જડપથી ઊંચકી લીધો.

મ્રિય સુનંદા દેવી,

સાદર વંદન!

મારા કમરામાં મૂકેલું પેલું અધૂરું ચિત્ર પૂરું કરી પછી જ આ પત્ર લખવા બેઠો છું.

આ ચિત્ર મં મારી પૂરી લગનથી દોર્યું છે. એમાં મં મારા જીવનના બધા જ રંગો પૂર્યો છે. જેથી એ ચિત્ર કદાચ જગતનું સર્વોત્તમ ચિત્ર બની જાય તો નવાઈ પામવા જેવું નથી. આ ચિત્ર દોરતાં પહેલાં રાજી રવિવર્મા, પાલ્બો પિકાસો, લિયોનાડો-દ-વિન્ચી, અમૃતા શેરગીલ, નંદલાલ બોડ વગેરે અનેક ચિત્રો મારા મનમાં રમ્યા કરતાં હતાં. સરસ્વતીયંત્રની કુમુદ પણ મારા મનમાં રમતી હતી! અજન્ટા અને ખજુરાહોના ગુફા મંડપોની કલામાં ભારતની કેટલી બધી અલૌકિક સ્વખ સર્જનની શક્તિ ભરી પડી છે. રાજ્યપૂત કળા, મોગલ કળા અને કાંગડા પહાડી ચિત્રકળા સુંદરતા અને પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ છે. પરંતુ તેમાં અજન્ટાની સાદેશ્યતા અને ચૈતન્યનો સંચાર નથી પરંતુ એ ચિત્રમાં રહેલી સાદાઈ અને મોહકતા આજના પદ્ધિમી અનુકરણથી તદ્દન મુક્ત છે. યુરોપનાં અનેક ચિત્રો સાધના અને માનવતા માટે પ્રસિદ્ધ છે, પરંતુ ભારતના ચિત્રકારોને માટે તે ઘણા દૂર અને અલભ્ય છે.

તમોએ જોયું હશે કે ચિત્ર આલેખવાની મારી શક્તિ બળવાન હતી અને સર્જન કરવાની અભિલાષા અદ્ભુત હતી. મારે એક એવા ચિત્રનું સર્જન કરવું હતું જે કદી જોવા મળ્યું ન હોય! મં આ ચિત્ર માટે અથાગ પરિશ્રમ કર્યા છે અને તેમાં કલા, રંગ અને લયનો સમન્વય સાધ્યો છે. જેથી ચિત્રને મં સર્વોત્તમ ચિત્ર માન્યું છે.

ચિત્રકલા એ માનવીનો શોખ છે. પૈસા માટે હું ચિત્ર દોરતો નથી. તેમ છતાં તમારી ઈચ્છા જો હોય તો... આ ચિત્ર જગતની હરીકાઈમાં તમો મૂકી શકો છો. કિન્તુ મારી શરત એટલી છે કે... જો આ ચિત્રને પ્રથમ પારિતોષિક મળે તો તેની બધી જ રકમ કેન્સરની હોસ્પિટલમાં દાન તરીકે તમારે આપી દેવાની છે.

કેન્સર એક ભયાનક જીવલેણ રોગ છે. આ દેશમાં એના દર્દની સારવાર કરવા પૂરતાં સાધનો નથી. જેથી દર્દી રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે. મારી પત્ની પણ કેન્સરમાં આ રીતે જ મરી ગઈ હતી!

પ્રીતિની યાદમાં જ મેં આ ચિત્ર બનાવ્યું છે. જેથી એ પ્રથમ પારિતોષિક જીતે તો બધી જ રકમ ‘સંજીવની કેન્સર હોસ્પિટલ’માં દાન આપી દેશો.

મારી આ અંતિમ ઈચ્છા છે.

આશા છે, આપ મારી આ અંતિમ ઈચ્છા જરૂર પૂરી કરશો.

મેં એક વખત તમોને કહ્યું હતું કે કલાકાર કે માનવી પૂર્ણ બને તે પછી એ જાંઓ સમય ટકી શકતો નથી. મારી કલમ હવે ખૂબ ધૂળે છે. હવે વધુ એક પણ અક્ષર લખી શકું તેમ નથી. તમને રૂબરૂ મળવાની મારી ઈચ્છા હતી, પરંતુ રૂબરૂ મળી શકાયું નથી તે માટે મને માફ કરશો ને?’

પત્ર વાંચીને સુનંદાના હાથમાંથી નીચે સરી પડ્યો. ચિત્રકારની આવી એકાએક અણધારી વિદ્યાયથી સુનંદાને ભારે દુઃખ થયું અને ચિત્રકારના શબને પકડી, ચોધાર આંસુએ રડી પડી.

પછી તો ચિત્રકારે દોરેલા આ અંતિમ ચિત્રને જગતની હરીફાઈમાં મૂક્યું અને તેને પ્રથમ પારિતોષિક મળ્યું. ત્યારે હજારો પ્રશંસકો તરફથી અભિનંદનની જાણે વર્ષા થઈ. સુનંદાની ખુશીનો પાર ન રહ્યો.

ચિત્રકારના આ અંતિમ ચિત્ર ‘પરિતોષ’ને પ્રથમ પારિતોષિકની રકમ રૂપિયા બે લાખ મળ્યા. એમાં સુનંદાએ બીજા ત્રણ લાખ રૂપિયા ઉમેરી કુલ પાંચ લાખનો ચેક ‘સંજીવની કેન્સર હોસ્પિટલ’માં જમા કરાવ્યો ત્યારે ચિત્રકારના આ સ્તુત્ય પગલાં બદલ સૌએ તેના મોં ફાટ વખાણ કર્યા. આજે આ વાતને વર્ષો વીતી ગયા છે. છતાં માનવતાના મહેકની સૌરભ હજ એવી ને એવી આવે છે.

‘પ્રાંજલ’, ૩૦, આનંદ વાટીકા સોસાયટી,
સરદાર પુર પાસે, અકાજણ રોડ,
સુરત-૩૮૪ ૦૦૮. મો. ૯૮૨૫૧ ૦૦૨૫૪

ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણને ભરખી જશે

(અનુસંધાન : પાના નં. – ૨૧ ઉપરથી ચાલુ)

આ સપાટી લગભગ જ ફૂટ જેટલી વધતાં સાગર કિનારાના અસંખ્ય રહેવાસીઓ મૃત્યુના મુખમાં હોમાઈ જશે.

ઇ.સ. ૨૦૦૩માં ગરમીથી ૩૫,૦૦૦ મોત થયા હતા. જ્યારે ઇ.સ. ૨૦૦૪માં આ આંક વધીને ૫૦,૦૦૦ થયો હતો. ધ્રુવ પ્રદેશની ઠંડક ઘટવાથી, હવામાં તથા મહાસાગરોની ગરમી પણ વધવાથી બાપારી પવનોથી અનેક સ્થળે વિનાશક વાવાડોં સર્જાશે. આરોગ્ય સંશોધન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના મત મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે ફલુ, મેલેરિયા, ડંગ્યુ, ચીકન ગુનિયા જેવા ચેપી રોગોના વાયરસ વેગ પકડશે. અસંખ્ય લોકો આ વાયરસોથી સંકષિત થશે.

● ગ્લોબલ વોર્મિંગની ભારતને ગાસર :

આપણા દેશમાં ઐતીના પાકના ઉત્પાદન પર માઠી અસર પડી છે. ઉત્તર ભારતમાં અસાધારણ ગરમી અને અસાધારણ વરસાદ છેલ્લા પાંચ વર્ષથી જોવા મળ્યો છે. પૃથ્વીનું તાપમાન સતત વધતાં ઇ.સ. ૨૦૫૦ સુધીમાં ચોમાસાની પેટર્ન સાવ બદલાઈ જશે. ‘આઈલા’ અને ‘ફીઆન’ જેવા વાવાડોં સતત સર્જાતા રહેશે. બંગાળના અખાતમાં સમુદ્રની સપાટી વાર્ષિક ૩.૧૪ મિલિ મિટરના દરે વધી રહેલ છે. પૃથ્વીના તાપમાનમાં બે ટકાનો વધારો, વન સૃષ્ટિમાંથી ૧૫થી ૨૦ ટકા પ્રજાતિઓનું અસ્તિત્વ ભૂંસી નાખશે. આગામી ત૦ વર્ષમાં ભારતના પચાસ ટકા જંગલો નાશ પામશે.

● ઉકેલ :

ગ્લોબલ વોર્મિંગને દૂર કરવા પ્રદૂષણોને યુધ્યના ધોરણે તામવા, અવરોધવા, તેનો નાશ કરવાની આવશ્યકતા જણાય છે. વધુને વધુ વૃક્ષોના વાવેતરો અને વૃક્ષોના સુચારુ ઉછેર તથા વૃક્ષવૃદ્ધિની માવજતથી ગ્લોબલ વોર્મિંગથી રક્ષિત થઈ શકીશું.

“સહજનંદ”, દ/અ, લીમડા લેન,
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય રોડ, સંસ્કાર નગર,
મુજ, કર્ણ-૩૯૦ ૦૦૧. મો. ૯૮૨૫૨ ૩૪૩૪૬

શ્રી કર્ચી જૈન સેવા સમાજ - અમદાવાદના બેંક ખાતામાં રકમ જમા કરાવવા અંગો...

એકાઉન્ટ નામ : શ્રી કર્ચી જૈન સેવા સમાજ - અમદાવાદ

Account Name : Shri Kutchi Jain Seva Samaj - Ahmedabad


બેંકનું નામ : કેનેરા બેંક - પાલડી બ્રાંચ, અમદાવાદ

Bank Name : Canara Bank, Paldi Branch, Ahmedabad.

A/C No. : 70072010016032 • IFSC : CNRB0017007

જ્યારે પણ રકમ મોકલાવવામાં આવે ત્યારે તેની આણ મેનેજરને વોટ્સએપ નંબર : ૮૮૨૪૦ ૮૭૬૫૪ ૫૨ કરવી જરૂરી છે.

આ સંબંધી અગાઉની વિગત રદ્દભાતાલ થાય છે. તેના સ્થાને અગે નવી વિગત આપી છે. જેની નોંધ લેશો.



પર્યાવરણ

ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણને ભરખી જરૂર



પ્રા. સૂર્યકાંત ભક્ત

આજે છેલ્લા બરસો વર્ષથી પણ્યમાં થયેલા ઔદ્યોગિકિકરણને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ છોડવાની માગ્રા વિશેષ પ્રમાણમાં હેખા દે છે. આ એક એપો ગેસ છે કે જે બરસોથી અઢીસો વર્ષ સુધી સક્રિય રહી શકે છે. ૧૮મી સદીમાં સૌપ્રથમ સ્વાંતે ઓરેનિયસે ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે આવતા ત્રાણ હજાર વર્ષમાં કાર્બન ગેસનું પ્રમાણ વધશે તથા પ્રદૂષણ બમણું થઈ જરૂર. ઈ.સ. ૧૯૮૮માં બ્રિટીશ ઇંજેનેર ગાયકોલેન્ડરે ગ્લોબલ વોર્મિંગના ભય સ્થાનો વિશે ખાસ આગાહી કરેલી. જેને એ સમયે મજાક ગણવામાં આવેલી.

● પર્યાવરણ જળવણી :

પર્યાવરણ બાબતનું યુ.એન.નું પ્રથમ સંમેલન ઈ.સ. ૧૯૭૨માં સ્ટોકહોમમાં મળેલું. જેમાં નક્કી કરાયું કે કોઈપણ દેશ એવી પ્રવૃત્તિથી દૂર રહેશે કે જેથી પડોશી દેશોમાં પ્રદૂષણ ફેલાય. સામાન્ય રીતે ઓઝોનનું આવરણ એક સુરક્ષા કવચ છે. જે આપણને સૂર્યના અલ્ફાવાયોલેટ કિરણોથી રક્ષે છે. તેમાં ગાબડું પડ્યાનો જ્યાલ ઈ.સ. ૧૯૮૮માં વૈજ્ઞાનિકોએ આપેલો. પરિણામે અનેક દેશોમાં સ્વચ્છતા વિશે સભાનતા પ્રવેશી. મોન્ટ્રિયલ પ્રોટોકોલનો પ્રારંભ ઈ.સ. ૧૯૮૭માં મોન્ટ્રિયલ શહેરમાં ભરાયેલા સંમેલનથી થયેલો. પર્યાવરણની જળવણી પ્રત્યેક દેશે જળવવા પર ભાર મૂકાયો. એજન્ડા-૨૧ કે રિયો પ્રિન્સિપાલ તરીકે ઓળખાતા નિર્ણયો યુ.એન.ની દેખરેખ હેઠળ ઈ.સ. ૧૯૯૨માં રીઓડી જાનેરોમાં લેવાયા. જેમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના નિયમો અપાયા છે. ભારતે તેમાં સક્રિય ભૂમિકા ભજવી. ઈ.સ. ૧૯૯૭માં મોન્ટ્રિયલના અધિવેશન બાદ ક્વોટો પરિષદનું આયોજન થયું. ક્વોટો પ્રોટોકોલ પ્રદૂષણ સામેનું સીમાચિક્રિપ છે.

અમેરિકાના વિરોધને કારણે ક્વોટો પ્રોટોકોલ નિર્ણય ગયો. આજે જર્મની, ફાન્સ અને ઇંગ્લેન્ડ ક્વોટો પ્રોટોકોલના માપદંડને કારણે કાર્બન ગેસના પ્રમાણને અંકુશિત કરવા સફળ રહ્યા છે. તેન્માર્કની રાજ્યાની ક્રોપન હેગનમાં ઉમી ડિસેન્બર, ૧૯૯૨ના રોજ સંયુક્ત રાખ્ટની જળવાયું પરિવર્તન શિખર બેઠક મળેલી. ૧૯૯૨ દેશો સમ્ભિલિત થયા. ૧૫,૦૦૦ પ્રતિનિધિઓની હાજરીમાં પ્રદૂષણો ફેલાતા અવરોધવા નિર્ણયો લેવાયા.

કલાઈમેટ અંગેની પેનલના વડા આર.કે. પચૌરીએ ઉચ્ચાર્યુ

કે, ‘આ પ્રદૂષણોની સમસ્યા ભવિષ્યમાં વિશ્વના લાખો લોકોને લેકાર બનાવશે. તેથી પ્રદૂષણ અટકાવવા યુદ્ધના ઘોરણે કાર્યરત થવું એ જ સાચો માર્ગ છે.’

● શું છે ગ્લોબલ વોર્મિંગ?

ખાસ તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? એ સમજવું જ અતિ આવશ્યક છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારું ઉષ્ણતાનું મૂળ કારણ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણોની સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પણી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પણી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ.



● ગ્લોબલ વોર્મિંગના કારણો :

ઔદ્યોગિકિકરણ અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આજે અસંખ્યાત કારખાનાઓ ધમધમે છે. પેટ્રોલ - ડિઝલ, કેરોસીન, ખનિજતેલના વપરાશ થકી પાર વિનાનો કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં ઠલવાઈ રહ્યો છે. બીજી તરફ, આ ધરતી પર સિમેન્ટના જંગલો કહેવાય તેવા સિમેન્ટના બાંધકામો સૂર્યના કિરણોને વધુ ગરમી સાથે વાતાવરણમાં પરત ફેંકે છે. આ ગરમી વાતાવરણમાં ધુમરાતી જ રહે છે. વાતાવરણમાં ગરમીને કેદ કરી રાખનાર કે બંદી બનાવનાર બીજો વાયુ ‘મિથેન’ છે. તે વસ્તુઓને સડાવવાની પ્રવૃત્તિ કરે છે. આપણે જંગલોનું નિકંદન કાટતા ગયા. પરિણામે આ વાયુની વૃદ્ધિ ચોમેર થવા લાગી છે.

● ગ્લોબલ વોર્મિંગની વૈધિક અસરો - પરિણામો :

છેલ્લા પઠ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમાં ૧૦૦ ટકાનો વધારો નોંધાયેલો જોવા મળે છે. ઈ.સ. ૧૯૯૦થી સતત ૯૨ વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું જ રહે છે. ૨૦૦૫નું વર્ષ સદીનું વિશેષ ગરમ વર્ષ હતું. ગરમીને કારણે ઉત્તર ધ્રુવની હિમાચાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચાદિત મેદાનો ઓગળી રહ્યા છે. બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે. મહાસાગરોના આંતરપ્રવાહો પણ બદલાઈ રહ્યા છે. કેટલીક જળચાર સૂણિનો નાશ થઈ રહ્યો છે. મહાસાગરોની સપાટી હાલે ૬ હંચ જેટલી વધી છે. થોડા વર્ષો અર્થાત બે-ગ્રાન દાયકામાં

(અનુસંધાન : જુહો પાના નં. - ૨૦ ઉપર)



ડૉ. નટુભાઈ પંડ્યા “નટવર”
(ભાવનગર)
ફોન : (૦૨૭૮) ૨૫૬૦૧૨૧
મો. ૯૪૨૭૫ ૫૮૦૫૩

સર્જક - કવિ ડૉ. નટુભાઈનું પૂર્ણ નામ નટવરલાલ પ્રભાશંકર પંડ્યા છે. પોતાના નામને જ તખલુસ બનાવી “નટવર” નામે તેઓ કાવ્ય - ગઝલો લખે છે. આધુનિક યુગના નામી કવિ તરીકે ઓળખાતા આ ગઝલકાર ભાવનગરની ધરતીનું ઘરેણું છે. ભાવનગર મુકામે ૧૧ મી ઓગસ્ટ, ૧૯૪૦માં જન્મેલા નટુભાઈ પંડ્યા આયુર્વેદ વિશારદ છે. ૧૭ વર્ષની ઉંમરે તેમણે ગુજરાતી ભાષામાં કાવ્ય-ગીતો લખવાની શરૂઆત કરી છે. હિંદી ભાષામાં પણ તેમણે કવિતાઓ લખી છે અને “મેં માનતા હું” નામથી ગઝલ સંગ્રહ પ્રગત કર્યો છે. વલ્લભીપુર તાલુકાના ‘પચ્છેગામ’ને વતન બનાવનારા ડૉ. પંડ્યાજીએ ભાલ પંથકના ‘ધ્યાલો’ ગામે પ્રાથમિક શિક્ષણ, વલ્લભીપુર ખાતે માધ્યમિક શિક્ષણ અને ધોરણ-૧૧નું શિક્ષણ ભાવનગરની આંદ્રે હાઈસ્ક્વુલમાં લીધું છે. ત્યારબાદ ભાવનગરની આયુર્વેદ કોલેજમાંથી આયુર્વેદ વિશારદની પદવી પ્રाप્ત કરી છે.

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના ‘ભાંભણ’ નામના ગામે આયુર્વેદ દવાખાનામાં સને ૧૯૬૧થી વેદ્યકીય અધિકારી તરીકે સેવા આપવાનો આરંભ કર્યો હતો અને તણા તાલુકાના ‘પીથલપુર’ ગામ ખાતે ફરજ દરમિયાન સને ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યારબાદ તણા ખાતે પોતાનું દવાખાનું શરૂ કર્યું હતું અને ૧૯૮૧થી ભાવનગરમાં સ્થાયી થયા છે.

સને ૧૯૮૬થી જ સાહિત્ય તરફ રૂચિ ધરાવનાર આ સર્જકના સાહિત્ય સર્જનનો ગુજરાતના અનેક સામયિકોમાં વખતો વખત પ્રગત થતાં રહ્યા છે. સને ૨૦૦૭થી ભાવનગર શિશુ વિહાર સંચાલિત બુધ સભામાં નિયમિત જવાથી સાહિત્યની મંદ પડેલી ગતિમાં પ્રાપ્ત હુંકરા. સને ૨૦૦૬માં કવિશ્રી જયેશ ઠક્કર, કવિશ્રી નિર્ભયરામ વેષણ અને આ કવિ નટુભાઈ - એમ ત્રણે કવિઓ રચિત ગીત-ગઝલ સંયુક્ત સંગ્રહ ‘ત્રિવેણી’ પ્રકાશિત થયો છે. સને ૨૦૦૮માં ‘લખલૂટ લીલાશ’, ‘ક્યાં સુધી હવે?’ એમ બે ગીત - ગઝલ સંગ્રહ તથા એક હિંદી સંગ્રહ આ કવિના સંગ્રહો છે.

મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-૧૦ના પાઠ્ય પુસ્તકના અભ્યાસકમમાં ‘હા, આ હર છે’ ગીત ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી પસંદ થયું હતું. હિંદી ભાષાના ૨૦ જેટલાં સામયિકોમાં કવિની ૬૦ રચનાઓ પ્રગત થઈ છે તથા ગુજરાતી ભાષાના નામી - અનામી ૫૦ જેટલાં સામયિકોમાં ૪૦૦ જેટલી રચનાઓ પ્રગત થઈ ચૂકી છે અને હજુ પણ પ્રગત થઈ રહી છે. ડૉ. નટુભાઈ પંડ્યાને અત્યાર સુધીમાં સાહિત્યિક પ્રદાન બદલ ૨૫ કરતાં વધારે સન્માનો મળ્યાં છે.

- દંગી મંડળ

કવિતા એ મૂળે શું છે? ચમત્કારજનક અર્થવિશિષ્ટ પદ્સમૂહ તે કાવ્ય કે પછી આત્માની કલા કારીગરી? કે આત્માને પોષતો શબ્દરસ? સગુણ પદ્ધતી રસનિષ્પત્તિ થાય છે. રસ એ ગઝલ - કવિતાનો આત્મા છે. કવિતા એટલે હદ્યનો વેપાર અને તે આત્માને આવિભાવ કરે છે.

અલંકારિકો રસયુક્ત વાક્યને કવિતા કહે છે, ગઝલ કહે છે અને ગીત પણ કહે છે. કાવ્ય - ગઝલમાં અલંકાર

માત્ર ઉત્કર્ષ વિધાયક, એટલે શોભાકર્તા છે; કાવ્યમાં સાલંકારો પદની જરૂર નથી. એ પદ લક્ષણનો ઘટક અવયવ નથી. રસરહિત અલંકારયુક્ત પદને ચિત્ર કાવ્ય કહે છે. તેમાં કાવ્યપદનો વ્યવહાર મુખ્ય નથી, ગૌણ છે. જેમાં પ્રબળ મનોભાવ ઊભરાઈ આવે તે જ કવિતા છે.

આજની ગઝલ-કવિતાની સમગ્ર શૈલી સૌષ્ઠવભરી, કલાત્મક અને કલાન્વિત છે અને સર્વથા અનવદ છે. એટલે જ

તો તે સ્વકીય વિશિષ્ટતાઓથી એ ખાસ તરી આવતી દેખાય છે.

સર્વસાધારણમાં પવિત્રતા, કોમળતા અને ગંભીરતા એ ત્રણે ગુજરાતનો સ્વાભાવિક ઉદ્ય થઈ જાય તો સમજવું એ કવિ માનવ-સમાજ - માનવશ્રેષ્ઠીમાં પરમોન્ત પદ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

આધ્યાત્મિકતાને વરેલા અને લખ્યપ્રતિષ્ઠિત કવિ જવાહર ભક્તી કહે છે કે - શબ્દ શક્તિઓ અભિધા અને વંજના પૈકી ગજલમાં બંને હોય તો બહુ સારું પણ અભિધા તો હોવી જ જોઈએ. અર્થાતું દરેક શે'રનો વાચ્યાર્થ તો સ્પષ્ટ થવો જ જોઈએ. નટુભાઈની ગજલોમાં અભિધાની સાથે સાથે વંજના પણ છે. જોઈએ આવો એક શે'ર :

પાયા જ ખળમણ્યા, છે ઈમારત પું પું,
તો કંગરે ચળકાટ, કહો, ક્યાં સુધી હવે?

કવિનો ગજલ સંગ્રહ વાંચતા તેમાં વિવિધ પ્રયોગો, ઉઘા, તાજગી વગેરેની કાંતદર્શી ઝાંખી થાય છે. સ્વયમ કવિમાં પણ વિવિધતાલક્ષી ઝાંખી થાય છે તે અકાંગી નથી બનતા કે બન્યા. તેમની કેટલીક ગજલોમાં કાફિયા, રદીફની નવીનતા જોઈ શકાય છે. ઈશ્ક, હયાતી તેમની કેટલીક ગજલોમાં દેખા દે છે. જોઈએ ઈશ્ક-એ-મિજાજ શે'ર :

સાવ કાંઠે બ્રબઢબી મળવાનું શું? આનંદ શું?
ડૂબકી દેવા અકળ તકિયે, હવે તો આવ તું!
ચાલ, છોડીને અહું ને પૂર્વઘણના પંથને,
પ્રેમના મારગ પરત વળિયે, હવે તો આવ તું?

આ કવિની ગજલોમાં ભારોભાર ગજલિયત ભરી છે. તેમની અભિવ્યક્તિ શૈલી સરળ શબ્દો, સીધા શબ્દો, સાદા શબ્દોમાં આવેણિત થઈ છે. તેથી ભાવકો પર સારી અસર પાડી રહી છે. આવો જ સરળ ભાષાનો એક શે'ર આ રહ્યો :

માણસ ભેગા મળવાવાળા માણસ ક્યાં છે?
પોતાને ઓળખવાવાળા માણસ ક્યાં છે?
બાથ ભરે બહેરાશભરી ને ખોડું હસતાં,
હેઠે ભેટી મળવાવાળા માણસ ક્યાં છે?

આપણા પોતીકા એટલે પોતાની પાસેથી હંમેશાં સ્નેહ, લાગણી, પ્રેમ, વાત્સલ્ય અને સહકારની અપેક્ષા આપણે સેવતા હોઈએ છીએ. પણ જ્યારે પોતાના જ કષ પહોંચાડે છે ત્યારે વધારે દુઃખ થાય છે. વધારે ભાર લાગે છે. કવિ આવી જ વથા ઢાલવતાં લખે છે :

છેવટે કર્માની કાળપ ગઈ અડી,
હા, નકર તો દેહ રૂપાણો હતો.
આગ કેવળ કાં અડી મારા ઘરે?
ખાસ પોતીકા તણો ફાળો હતો.

કવિની ગજલોના શે'રો મોટેભાગે સાંકેતિક અર્થો જ પ્રગટ કરી રહ્યા છે અને ગજલનું એ જ ખરું સ્વરૂપ છે. તેમની આવી જ સાંકેતિક અર્થ નિષ્પત્ત કરતી ગજલનો એક શે'ર જોઈએ:

વૈદ્ય, કે ડોક્ટર કશુંયે ના કરી જેમાં શક્યા,
વ્યાધિનાં લક્ષણ વિશે મારે કશું કહેતું નથી.
આગ ના સળગો, ધુમાડો ના, છતાં બાળો ખરું,
કશું હશે બળતણ વિશે મારે કશું કહેતું નથી.

વાધિ એટલે દુઃખ, ચિંતા. આ એવો રોગ છે કે જેની સારવાર જગતનો કોઈ તલીબ કરી શક્યો નથી. સુખનો અનુભવ કરવા બાધ પદાર્થોની અનિવાર્યતા નથી. રાગ, દેશ, લાલસા, પરિગ્રહ અને અહંકારે જ માણસને વથિત બનાવ્યો છે. આ મારું અને હું તેનો માલિક છું એવો વિચાર પરિગ્રહમાંથી ઉત્પત્ત થાય છે. ઈચ્છિત વસ્તુ મેળવવા માણસ સીધી રીતે કે આડકતરી રીતે ખોટું તો કરતો જ હોય. માલિક બનવાની એષણા જ માણસને દોડાવે છે. પછી પેદા થાય છે વથા. આ વથા સળગો છે ત્યારે ધુમાડા નથી નીકળતા, છતાં તે ભીતરથી બાળી રહી હોય છે.

ફાઈલુન ચાર આવત્નો ગાલગામાં લખાયેલી મુતદારિક છંદની એક ગજલના શે'રમાં કવિ જુકવાની વાત કરે છે. **માણસ ભલે ખુમારીથી જુવતો હોય,** પણ સમય પ્રમાણે તેને જુકવું - નમવું પણ જોઈએ. પરંતુ માણસ જુકતા તો શીખ્યો જ નથી. ઈગો લઈને જ ફર્યા કરે છે. જો એકવાર માણસને જુકતા આવડી ગયું તો સમજો, અને અન્ય કોઈ ઊંચાઈની જરૂર નહીં રહે. કવિ લખે છે :

ગર્વથી જીવતું છે જ ઉત્ત શિરે,
તે છતાં કયાંક તો જુકવું જોઈએ.

આપણે આજે આપણી માતૃભાષા ભૂલી, અંગ્રેજ ભાષા તરફ દોડી રહ્યા છીએ. એ જોઈને કવિ વથિત થઈ ઉઠે છે :

માતુભાષાની ફજેતી એ જ કારણથી થતી,
અન્ય ભાષામાં ભડી, ત્યાંથી અમે આધા રહ્યા.

અહીં કવિએ વધતા જતા અંગ્રેજ ભાષાના અતિરેક તરફ નિશાન તાકયું છે. માતૃભાષાની ફજેતી આ અંગ્રેજ ભાષાએ જ કરી છે. આપણે ગુજરાતી ભાષા તરફથી મુખ ફેરવી રહ્યા છીએ અને ગુલામીસી સ્વિકારી રહ્યા છીએ. આપણે અંગ્રેજોની ગુલામીથી હજુ મુક્ત નથી થયા! તેની ભાષાની ઓંઠ ચાટી ચાટીને હાડને પોણી રહ્યા છીએ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ ‘ગજલ વિશુ’માં પ્રગટ કરેલી મારી એક ગજલ યાદ આવી ગઈ. તેના બે શે'ર જોઈએ :

હું ગયો છું આવી બીજાનાં ઘરે,
ને લટકતું દ્વારે તાળું છે ચકા.
કોણો કોણું દેશમાં ગોરા નથી?
થાળીમાં ઈંદ્રિયશર્નું વાળું છે ચકા!

કવિ નટુભાઈએ પ્રતીક ગજલો પણ લખી છે. પ્રતીક ગજલ હજુ સુધી કોઈને ફળી નથી કારણકે ભાવની સાથે પ્રતીકને બેસાડવું ખૂબ દુષ્કર થઈ પડતું હોય છે. એને કારણે પ્રતીક ગજલ સફળતાને પણ વરી નથી. આ કવિએ ટહુકો મોરનો, પતંગ, વસંત, રેતી, ફાગણ, જાઉવું, તાજમહેલ, મા, ઘડુલો, માણસ, પ્રેમ, મીરાં અને બાંકડો વગેરે પ્રતીક તરીકે લઈ ગજલો લખી છે.

રમલ છંદમાં લખાયેલી તેમની એક પ્રતીક ગજલ જોઈએ:

એકલો એકાંતમાં જ્યારે પડે છે બાંકડો,
તો સ્મરણ જૂનાં સ્મરી ત્યારે રૂઢ છે બાંકડો
આશરો ને આશાસન જેમના માટે હતા,
તેમને લાગી રહ્યું, આજે નડે છે બાંકડો.

અહીં ‘બાંકડો’ એ વૃદ્ધનું પ્રતીક છે. વૃદ્ધ માણસ નવા યુગના ચિત્રો, વિચારો, રીત-રિવાજો વગેરે જોઈને વીતિ જિંદગીને સંભારી આંસુ સારે છે. કોણુંબિક પ્રશ્નો, કલેશ, સંતાપ, સંધર્ષણ, મુંજવણ, ગમા અને અણગમા વગેરે પ્રશ્નો વૃદ્ધને ગ્રાહિત કરે છે.

કવિ પાસે અભિવ્યક્તિની મોટી સુજ છે. તેમની ગજલોના શે’રોમાં એક પ્રકારની ઉંડાઈ છે. ક્યાંક છીછરાપણું નથી દેખાતું.

આજે માણસ બરડ થએ ગયો છે. સંવેદનહીન થએ ગયો છે. પ્રત્યેક દિવસ માણસમાં રહેલી સંવેદનાઓનું બાખીભવન કરી રહ્યો છે. કવિ પંડ્યાજુ આ બધું જોઈ જોઈને બળાપો કાઢે છે. કવિ લખે છે :

ચાંદનીનાં હીબકાં ને રાતનાં આંસુ લઈ,
સંધર્યાં ઝાકળની છાંટે, કોઈને થાતું કશું?
લઈ લગાડયો રૂર છાંટાં, મમતાનું ઠેકાણું નથી,
બાળ જ્ઞાન દુખ્યાં જ ચાટે, કોઈને થાતું કશું?

કવિની ગજલોના ઘણા શે’રો હદ્યમાં રોકાઈ જાય તેવા છે અને તે હદ્યને તૃમ કરી રહ્યા છે. ગજલમાં પ્રતીકો અને કલ્પનોનું અનુભાવન ભાવક માટે નવું નથી. પણ અહીં કવિએ જે રીત રદીફ કાફિયામાં બેસાડીને વાત કરી છે તે નવીનતા બસ્તે છે.

ગજલ સર્જન સરળ અને છેતરામણું સર્જન છે. જો ગજલના ભાવ સમજાય તો જ તેને માણી શકાય. સાંકેતિક, વંગ્યાર્થ ગજલને હજુ સુધી હું અંગત રીતે માનું તો કોઈ સમજ શક્યું જ નથી. સાવ મામૂલી જેવો દેખાતો શે’ર પણ ભીતરથી વિસ્ફોટ કરતો હોય છે.

ભાવનગરના કવિ હિંમત ખાટસુરિયા અને હું મરીજને મળવા ગયા હતા ત્યારે મરીજ સાહેબે આવા બેદી ઘણા શે’રો વિશે વાત કરી હતી. એટલે કહી શકાય છે કે ગજલને ઓળખવી,

પચાવવી એ ઘણું અધૂરું કામ છે. જેને ગજલને માપતા આવડે તે જ તેને ઓળખી શકે, પચાવી શકે. માપદંડ વગર ગજલ મપાતી નથી.

વરસો પહેલાં હું ન ભૂલતો હોઉં તો નવનીત અથવા સમર્પણમાં મારી એક ગજલ પ્રગટ થઈ હતી અને કવિઓમાં તે વખણાઈ હતી. તેનો એક શે’ર ટાંકવાનું મન થઈ રહ્યું છે. જે આ પ્રમાણે છે :

મરેલાં હોય તો એને અમે સત્કારીએ હેતે,
મળે છે એ બધાં તો નીકળે છે જીવતાં જાઝા!

સાંકેતિક ભાષામાં લખાયેલી ગજલ છે. તેના પ્રત્યેક શે’રોમાં સાંકેતિક ભાવ પરોવી ગજલના મૂળ સ્વરૂપને તાદ્દય કર્યું છે.


કવિ નટુભાઈ પંડ્યાને અભિવ્યક્તિની કોઈ સીમાઓ બાંધી શકી નથી. તેઓ તમામ સીમાઓને ઉત્તલંઘીને પણ તથ્ય સુધી પહોંચતા એક કવિ છે. જે તેમની ગજલો વાંચતા દેખાઈ આવે છે. કવિ સાહિત્યક્ષેત્રે હજુ વધારે પ્રગતિ કરી નવા સર્જનો આપતા રહે એ હિંચનીય છે.

“સંસ્કૃતિ દશન” કાયાલિય,
સ્તરનપરા શેરી નં.-૧, નીલકંદ બંગલાની સામે,
બાગ દરવાજા, માણાવદ-૩૬૨ ફૃસો. (મિ. જૂનાગઢ)
મો. ૮૯૩૪૮ ૦૨૪૨૪

બધા હુઃખ દૂર થયા પછી મન પ્રસત્ર થશે એ ભમ છે,
હકીકત એ છે કે,
મન પ્રસત્ર રહેશે તો બધા હુઃખ દૂર થઈ જશે.

**સમય સમય કી બાત હૈ
કભી ઘર પર પડે રહ્યે વાલોં કો
નિકમ્મા' કહ્ય જાતા થા
ઔર આજ 'સમજાદાર'**





અનુભવ

એકાંતવાસના આ દિવસો



ડૉ. અલ્કા સુનિલ શાહ

૨૦૨૦ના વર્ષે જીવનની કિતાબમાં એવા પૃષ્ઠો ઉમેરી દીધા છે કે એને યાદ કરવા કરતાં ભૂલી જવાનું સૌ વિશેષ ઈચ્છે છે. કદાચ ૨૦૧૮ની વિદાય વેળાને કોઈએ કલાયું પણ નહીં હોય કે આવનારા વર્ષ ૨૦૨૦ માટે જે શુભ કામનાઓ આપણે હોંશે હોંશે પાઈવીએ છીએ એ બધી જ માત્ર શબ્દોના સાથિયા સરીખી બનીને રહી જશે, ને આવનારા વર્ષનું વાસ્તવિક રૂપ કંઈક અલગ અને અવનવું જ રહેશે!

આમ તો આવનારું દરેક નવલ વર્ષ અનેક નવી આશા, અરમાન, ઉમંગ અને બીજુંય કેટકેટલું સાથે લઈને આવતું હોય છે. નવા નવા સંકલ્પો લઈએ અને એને હાંસિલ કરવા કમર કસીને મંડી પણ પડીએ જ. પણ ગત વર્ષે આ બધું જ એકદમ અલગ રીતે આપણે અનુભવ્યું જેમાં સુખની ક્ષણો કરતાં દુઃખી લાગણી વિશેષ છે.

કોરોનાની આ મહામારીના સમયમાં આપણામાંના કેટલાય લોકોએ પોતાના વહાલસોયા સ્વજનોને ગુમાવ્યા. કાયમ બિલબિલાટ હાર્ય સાથેના ચહેરાઓ તસવીર બનીને દીવાલ પર માત્ર સ્મૃતિપતમાં જીવંત રહ્યા. તો સામે પક્ષે પરિવારનું મૂલ્ય મહિંત્ય ઘરનો દરેક સભ્ય સમજવા માટે શક્તિમાન બન્યો, એ આ સમયનું જમા પાસું પણ છે. સતત ભાગદોડભરી અને વ્યસ્ત જિંદગીમાં અટવાયેલા માનવીને લાંબા સમય સુધી કોઈપણ જાતની નાસભાગ વગરની પળો પરિવાર સાથે વ્યતીત કરવા મળી. કેટલીય ભૂલાયેલી રમતો – કેરમ, પતા, લ્યુડો, સાપસિડી કે સ્કેબલ અને અંતાક્ષરી જેવી ધર ધરમાં સૌ સાથે મળીને રમીને સમય વિતાવવા લાગ્યા.

સામા પક્ષે રસોડાની રાણી - ગૃહિણીનું કામ વધી ગયું. ધરમાં બધા જ હાજર. એટલે રોજ કોઈને કોઈ નવી નવી વાનગીની ફરમાયેશ પૂરી કરવા એણે સતત રસોડામાં મચ્યા રહેવું પડે. પણ આ સમયે સમજુ પતિદેવ કે બાળકોએ પણ ઘરનાં નાના મોટા કામ વહેંચી લીધા એટલું સારું હતું. આમ, સ્વાવલંબી જનવાનું શિક્ષણ જે ખરેખર ખૂબ જરૂરી હતું, તે આપોઆપ મળી ગયું! વળી ઘરના કામ કરનાર નોકરો-બાઈની કિમત પણ આજની પેઢીને સમજાઈ હશે. આ સમયમાં આ વર્ગ અને મધ્યમવર્ગીય પરિવારજનોએ ખૂબ આર્થિક સંકડામણ ભોગવવી

પડી. તો વળી દિલેર દાતાઓ પણ છુટે હાથે દાન આપી મુશ્કેલીના આ સમયમાં અનેક લોકોનો સહારો બન્યા.

મારી વાત કરું તો શરૂઆતમાં લાગતું હતું બધું સહજ અને સરળ. એમ થતું હતું એકમેકની સંગાથે કોરોના સામે લડી લેવાશે. સાવધાની રાખીશું તો આ સમય પણ વીતી જશે અને ખરેખર ૨૦૨૦ના અંત સુધી બધાનું સ્વાસ્થ્ય સારું રહ્યું અને જ્યારે ૨૦૨૧ની શરૂઆતે કોરોનાની રસી પણ આવી ગઈ, ને અમે પહેલો ડોઝ પણ લઈ લીધો, ત્યારે થયું વાહ! હવે જેંગ જતી જઈશું. પણ એ સમયે જ કોરોનાની થપાટ બરાબરની વાગી. આખું વરસ એકદમ જતનપૂર્વક સાચવી સાચવીને ડગલા ભર્યા, ને ખરબ નહીં આ સેકન્ડ વેવના દિવસોમાં ન જાણે ક્યાં ચૂક થઈ ગઈ કે કોવિડ-૧૯ની ઝપટમાં હું આવી ગઈ.

અત્યાર સુધી રોગ વિશે માત્ર લખાણો જ વાંચ્યા હતા એ બધું હવે હું સદેહ અનુભવવા લાગી. સામાન્ય તાવ છતાંય થાક તો જાણે વર્ષોનો ન ભરાઈ ગયો હોય એમ આંખો જ ન ખૂલે! બસ, સૂઈ જ રહેવાનું મન થતું હતું. પણ આમાં તો – “તારી હાક સુષ્પીને કોઈ ન આવે – એકલો જાને” જેવો તાલ. એટલે જાત મહેનત જિંદાબાદ કર્યે જ છુટકો!!

‘એગોહં નાથ્ય મે કોઈ’ ‘હું એકલો જ છું, મારું કોઈ નથી’ – એ વાત આ બીમારીમાં ડગલે ને પગલે ધ્યાનમાં રાખીને એકલા અટુલા જાતે જ જાતની સંભાળ રાખવાની હતી અને આ એકાંતવાસનો કપરો લાંબો સમયગાળો ૧૪ દિવસનો એકલા એકલા વિતાવવાનો હતો. કદાચ રામજીના વનવાસના ૧૪ વર્ષનો ગાળોય આવો કઠિન નહીં હોય!

કલ્યાના તો કરો કે માણસને ૧૨ x ૧૫ની એક રૂમમાં પૂરી રાખો ને પછી કહો “અમે તને બધું પહોંચાડીશું. તું આરામ કર, ને આનંદમાં રહેજો. ચિત્તા ન કરીશ.” શું ધૂળ આનંદમાં રહેવાય? એકબીજાનું મોં જેવાનું નહીં, મોં પર માસ્ક લગાવી રાખવાનું, ને તકલીફ જે પણ થાય તે તમારે એકલાએ જ સહેવાની. કોઈ તમારી મદદે ન આવી શકે. અને વળી ખાવાપીવાની સ્ટાઇલ પણ કેવી? રૂમ બહાર તમારા વાસણ મૂકી દેવાના ને જટ બારણું વાસી દેવાનું! ‘ભીક્ષાનું દેહી’ની જેમ ઘરવાળા એમાં તમારા ખપ પૂરતું ભોજન પીરસી જાય! એકબીજા

સાથે વાત કરવી હોય તો આ ટચુકડા મોબાઈલનો સહારો.
અત્યારે તો મને ટેકનોલોજી આશીર્વાદ સમાન લાગે છે!!

તાવ વધે કે ઘટે, તમે જ તમારું સંભાળો. ભવે ને ગમે
તેટલો પ્રેમ હોય તોય ન તો મા-દીકરાને કે દીકરીને કે પતિ-
પત્નીને કોઈ રીતે મદદરૂપ થઈ શકે. કેવી કરુણાતા!!

આખો દિવસ કેટકેટલું વાંચવું, સાંભળવું કે મોબાઈલ
ટી.વી. કે આઈપેડમાં જોયા કરવાનું? જાણો કોક સાથે રહેવા,
વાતો કરવા સતત તરસતા માણસને અફાટ રણમાં નિર્જન
જગ્યામાં છોડી આવ્યાની લાગણી અનુભવાય. વળી ઢગલો એક
ગોળીઓ ગળવાની ને ભૂલી ન જવાય અની ખાસ તકેદારી
રાખીને બધા ચાર્ટસ મેઠન્ટેઇન કરવાના. તાવ કેટલો?
ઓક્સિજન લેવલ બરાબર રહે છે ને? દવા ક્યારે, કઈ, કેટલી
લીધી? આ બધું જ યાદ રાખવાનું. ખરેખર તો જે માણસ એકલો
રહેવા ઈચ્છાતો હોય ને, એ પણ આવી પરિસ્થિતિમાં કંટાળી જ
જાય ને પાછો ૧૪-૧૪ દિવસનો લાંબો સમયગાળો!!!

આ સમયે આપણા જૈન ધર્મની ફિલોસોફી મનમાં શાંતિ
આપે કે મળેલા સમયને 'તારા' માટે ખર્ચ કર. શરીરમાં સ્વસ્થતા
હોય તો સામાયિક, જાપ વગેરે સરસ રીતે થાય પણ અંગેઅંગમાં
કળતર અને બેસાય એવું જ ન હોય ત્યારે સૂતા સૂતા પણ
મનગમતા સ્તોત્રો, સ્તવનો, પ્રવચનો સાંભળવામાં સમય
વિતાવવાનું ગમે એવું છે.

એક રીતે જોઈએ તો ભગવાને કહું છે કે મોટ,
માયા, પરિગ્રહ ને રાગદ્રોષ ઓછા કરો. એ બધું અત્યારે
આપોઆપ થાય જ જાય.

આ સમયમાં જેટલું વાપરો, અડકો એ બધું વારંવાર
સેનેટાઈઝ કરવું પડે. એટલે બને એટલી ઓછી ચીજવસ્તુઓ
વાપરવાની આદત પડી જાય. બે-ગ્રાન્ટ ડ્રેસમાં ૧૪ દિવસ
આરામથી નીકળી જાય. મોજશોખની કોઈ વસ્તુની જરૂર જ નહીં.
સંપર્ક રાખવા મોબાઈલ ફોન જોઈએ એ જ.

એ જ રીતે ગમનાગમનની કિયા જ નહિંવત્ત. ૧૨ x ૧૫ના
રૂમમાં બધું જ સીમિત. વળી જે બીજા પીરસે એ જ ખાવાનું.
એટલે સ્વાદન્નિય પર કાબૂ આપોઆપ આવી જાય. કોઈને હળવા
મળવાનું નહીં એટલા રાગદ્રોષ પણ ઓછા થાય. એક રીતે સારું
થતું જાય કે જાત સાથે જીવવાનો, એના વિશે વિચારવાનો મોકો
મળે. મને શું ગમશે? મારો રસ શેમાં છે, એ વાતની એકલા
રહેવાથી સમજ આવી. કોઈ સાથે બોલવાનું નહીં. તેથી આત્મિક
ઉદ્ઘાસ વધે, ને ધ્યાનના મારગ પર પા પા પગલી માંડી શકાય.

અને જ્યાં આપણે જ ખુદ કોઈ વિશે કશું કરવા અસમર્થ
છીએ ત્યારે આદુંઅવળું વિચારવાની જરૂર જ શી?

"મેં તો સુકાન સોંઘું હાથ હરિ
હરે ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે"

ની પંજિતાઓ મનમાં સતત ગણગણવાની મજા પડે.

શરૂઆતના સમયમાં જે ફરિયાદો આ એકાંતવાસના સંદર્ભે
હતી, ને એ બધી જ જાણે જેમ જેમ દિવસો વ્યતીત થતા રહ્યા
તેમ તેમ એ બધી આશીર્વાદમાં પલટાતી ગઈ. જાત સાથે
રહેવાનું, જીવવાનું ગમવા લાગ્યું. આટલા વર્ષેમાં જ્યારથી
સમજણી થઈ ત્યારથી આજ સુધી કદ્દી મેં મારી જાત સાથે વાતો
નથી કરી. પણ આ દિવસોમાં "હું જ મારો મિત્ર" બનીને
રહી. મેં મને ઓળખી. કોઈ પૂર્વગ્રહ વિના, કોઈ ફરિયાદ
વિના હવે જેટલો સમય મારી પાસે રહ્યો છે, એ સમયને હું
મનભાવન બનાવીને કઈ રીતે વિતાવી શકું તેવી સમજ મેં કેળવી
લીધી.

મારા એકાંતવાસનું આ જ તો જમા પાસું છે.

એ-૫, પિયા પાર્ક, બેંક ઓફ ઇન્ડિયાની પાછળ,
ચાલોરા પાર્ક, વડોદરા - ૩૬૦ ૦૨૩.
મો. ૯૪૨૯૩ ૨૩૪૬૭

એક મિનિટમાં જીવન બદલાતું નથી,
પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય
આખું જીવન બદલવાની ક્ષમતા રખે છે.


'બીજુ માળા' સ્વરૂપે શોભે સ્માર્ટ મોબાઈલ

(અનુસંધાન : પાના નં. - ૨૭ ઉપરથી ચાલુ)

હું તો એક પગલું આગળ વધીને કહીશ કે વૃદ્ધાશ્રમોનાં
વડીલોને પણ આ સુવિધા મળવી જોઈએ. ટી.વી., પંખા જેટલું
જ મોબાઈલ ફોન દ્વારા મનોરંજનનું મહત્વ છે. દાતાઓ પણ
આગળ આવી શકે. કેટલાક ધરોમાં નવો મોબાઈલ લોન્ચ થતાં
જ ખરીદી થઈ જાય છે. એમની પાસે સારી હાલતમાં વધારાના
મોબાઈલ ધૂળ ખાતા હોય છે. તેઓ પણ લાભ આપી શકે.

વરિષ્ઠોના હાથમાં માળા સાથે સ્માર્ટ મોબાઈલ હોવો જ
જોઈએ. વડીલોને સ્માર્ટ મોબાઈલથી વંચિત ન રાખવા એ
સાંપ્રત સમયની માંગ છે. વડીલોના હાથમાં મોબાઈલ આવતાં
જ વોટ્સઅપ, ફેસબુક જેવી નવી દુનિયા એમના હાથમાં આવી
જશે. મન એમાં પરોવાયેલું રહેશે. એમની માનસિક તંદુરસ્તી
સારી રહેશે. જેની સારી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડશે.
માળા ઉત્તમ, પણ હવે 'આધુનિક માળા' છે સ્માર્ટ મોબાઈલ,
જે વરિષ્ઠોના હાથની શોભા બની રહેવી જોઈએ.

E-mail : jagdishchandrachhaya@yahoo.in



શાણગાર

‘બીજુ માળા’ સ્વરૂપે શોભે ‘સ્માર્ટ મોબાઈલ’



જગાદીશચંદ્ર છાયા

આ તો મારો અંગત વિચાર છે. એ જરા હટકે લાગે તો ઠીક, નહિતર કોઈને અસ્વીકાર્ય પણ લાગે. દરેકને પોતાની રીતે વિચારવાની સ્વતંત્રતા છે પણ મને અનુભવની એરણે ઘડાઈને આ વિચાર મળ્યો છે.

બાળકોના કુમળા હાથમાં છે એમ વરિષ્ઠોના કરચલીવાળા હાથમાં માળા સાથે સ્માર્ટ મોબાઈલ પણ હોય. અલબત્ત, મોબાઈલનો સકારાત્મક અને વિવેકપૂર્ણ ઉપયોગ કેમ થાય એ પરોક્ષ રીતે વડીલો પાસેથી શીખવા મળશે.

વડીલો એમની મર્યાદા સમજતા હોઈ, આંખોને ફાવશે એટલો જ ઉપયોગ કરશે. અનેકને અનુભવ છે કે મનને સારા વિચારોમાં પ્રવૃત્ત રાખવાથી મન સ્વસ્થ રહે છે અને એ રીતે તનને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. મનોવૈજ્ઞાનિક દસ્તિએ પણ વડીલોને સ્માર્ટ મોબાઈલથી વંચિત રાખવા ઉચ્ચિત નથી. વડીલવર્ગને પણ દુનિયા સાથે જોડેલા રાખીએ, એમને ગમતાં ગીતો, સ્તોત્રો, ભજનો, કથાઓ - ડાયરાની મોજ હાથવગી કરી દઈએ. મનોરંજનના આ મહાસાગરમાં એમને પણ ‘દુનિયા મુદ્દીમાં’નો અનુભવ કહેતાં લહાવો લૂંટવા દઈએ. વૃદ્ધાવસ્થાનો ભાર હળવો કરવામાં સહાય કરીએ. ઘરમાં રહીને સ્વસ્થ રહેવા માટે સ્માર્ટ મોબાઈલ આશીર્વાદરૂપ નીવડી શકે છે.

જેમનાં ઘરમાં વડીલ ઉદાસ રહેતા હોય, સ્વભાવ ચીરિયો થઈ ગયો હોય, વાતે વાતે વાંકુ પડતું હોય ત્યાં તો એમની ફરિયાદ કરીને એમનું અપમાન કર્યા કરવું એ નિંદનીય કાર્ય છે. એવા વડીલો માટે તો તાત્કાલિક ધોરણે આ ‘મનોવૈજ્ઞાનિક ઉપાય’ અમલમાં મૂકવો જોઈએ. આ ઉપાય કરી તો જુઓ. અકલ્યનીય પરિણામો અનુભવી શક્ષો.

‘પાકે ઘડે કાંદા ચઢે?’

જવાબ છે, ‘હા, ચોક્કસ.’ બાળકોને શીખવતા હોઈએ એમ વડીલો પાસે બેસીને ઠંડા મગજે મોબાઈલ ઓપરેટ કરવાની તાલીમ આપવી પડશે. વડીલો કહે તો ખરા કે, ‘આ ઉમરે અમને નહીં આવડે’ ત્યારે ધૈર્યપૂર્વક કામ લેવું પડશે. જાણે શીખવનારને ગરજ હોય એમ જીદ કરવી પડશે. એમનામાં આત્મવિશ્વાસ કેળવવો પડશે. તો અભાસ વડીલો પણ મોબાઈલ ઓપરેટ કરતા થઈ જશે એવી મને પાકી શ્રદ્ધા છે. પછી જોજો, વડીલો પણ


સવારે ઉઠીને પહેલાં અપેટ જોતાં થઈ જશે. બાળકો અને વડીલો સરખા એમ કહેવામાં આવે છે, એમાં તથ્ય છે. વડીલોની પણ બાળકોની જેમ દરકાર લેવી જોઈએ. તો એમની ‘ગાડી’ પણ સડસડા દોડવા લાગશે અને વડીલોના મુંગા આશીર્વાદ મળશે. વડીલોની ઉપેક્ષા થતી હોય તો એને ‘પાપ’ ગણવું જોઈએ.

અલબત્ત, આજે ઘણા વડીલો મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા છે અને નવા યુગનું હાથવગું મનોરંજન ભરપૂર માણે છે. પણ જેઓ હજુ આ લાભથી વંચિત છે, એમની જીવન સંધ્યા પણ ખીલે એ જરૂરી છે એમ મારું માનવું છે. આ અભિપ્રાય સાથે ઘણા સંમત ન હોય એ સ્વાભાવિક છે.

એ પણ મુદ્દો છે કે ગરીબવર્ગનાં વડીલોને વ્યક્તિગત મોબાઈલ લેવો અને ઉપયોગ કરવો આર્થિક દસ્તિએ પોસાય નહીં એ હકીકિત સ્વીકારવી પડે. એ પણ એટલું સાચું છે કે ઘરનાં કોઈ એક સભ્ય પાસે તો સ્માર્ટ મોબાઈલ હશે જ. તો જ્યારે એ વ્યક્તિને મોબાઈલનું કામ ન હોય ત્યારે થોડા સમય માટે પણ ઘરના વડીલને મોબાઈલ આપે એ દ્વારા તેમને ગમતું મનોરંજન પૂરું પાડી ખુશ કરવા જોઈએ. પણ શક્ય એટલા વડીલો નવા યુગ સાથે કદમતાલ મિલાવે એ જરૂરી છે. વળી, હાલના કોરોના કાળમાં તો વડીલોએ ઘરમાં જ રહેવું હિતાવહ છે ત્યારે હાથમાં મોબાઈલ હોય તો સમય સરસ પસાર થવા સાથે એકલતા ન સાલે.

આજે તો ઘર ઘર મોબાઈલ, ટી.વી., હોમ થિયેટર હોઈ સૌને પૂરતું મનોરંજન મળી રહે છે. પણ એમાં ઘરના વડીલોની અવગણના ન થવી જોઈએ નહિતર એ વડીલો મુરજાઈ જશે. જો વડીલો માટે અલગ રૂમ હોય અને થોડો ખર્ચ કરી શકાય તેમ હોય તો એમના રૂમમાં ખાસ અલગ ટી.વી.ની સુવિધા આપવી જોઈએ. એમને ઘરનું જૂનું ટી.વી. આપશું તો પણ ખુશ થશે. આમ કરવાથી એમને ગમતા કાર્યક્રમો અનુકૂળતાએ જોઈ શકે. ઘરનાં અન્ય સભ્યોને પણ ખલેલ ન પહોંચે. સમજીએ તો આ પણ એક આધુનિક સમસ્યાનું સમાધાન છે. બાબત નાની લાગશે પણ છે મહત્વની. વડીલોને ઘણીવાર એકલતા સત્તાવતી હોય છે. એમને સ્માર્ટ મોબાઈલ આ સમસ્યાનું સમાધાન આપે છે. ડિજિટલ યુગનો લાભ સૌને મળવો જોઈએ.

(અનુસંધાન : જુહો પાના નં. - ૨૬ ઉપર)



ચિરંજુવી

“મારી અમૃત દીવડી – કિરણ”



રક્ષાબેન ચોટલિયા

નામ તો એનું કિરણ હતું પણ ગામ આખું તેને ‘કીડી’ના હુલામણા નામે જ બોલાવતું! નાનકડી બે ઓરડી, એક જ્ઞા માંડ સમાય તેટલું રસોડું અને ચાલ જેવી ઓસરી. નહીં ફળિયું કે ડેલી. આંગણામાં લીમડો અને ગુલમહોરના બે’ક ઝડપાં. દાદાદાઈ, મા-બાપ અને ચાર બહેનો, એમ આઠ માણસોનું કુટુંબ. કેમ સમાતા હશે? શહેરીજનોને તો જરૂર આશ્ર્ય થાય. કદાચ એટલે જ પરસ્પર આત્મીયતા વધુ ગાડ બનતી હશે?

કિરણ ચાર બહેનોમાં સૌથી નાની, પણ અંદર એની ઠાંસી ઠાંસીને જિજ્ઞાસા ભરેલી. એની આંખોમાં હંમેશાં અગાધ દરિયો પ્રશ્નાર્થ સ્વરૂપે ઘૂઘવતો હું વાંચી શકતી. વળી, જાણી લેવાની અજબ શક્તિ દસ્તિપાત થતી હતી. પગ તો જાણે પાંખ બની આસમાનમાં ઉંચી ઉડાન ભરવા જ ન નિર્માયા હોય? અને તેના નાના-નાના હાથ કામ કરે લાખ. નજર તો હંમેશાં મારા તરફ મંડાયેલી જ રહેતી, કોઈ આજ્ઞા જીવા આતુર બનીને.

મેં રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ૨૭ વર્ષ સેવા આપેલી. તેમાંનું પડધરી તાલુકાનું નાનું એવું તરધરી ગામ. જેમાં ૨૨ વર્ષ પર્યાત એક જ શાળામાં મેં સર્વિસ કરેલી. તે દરમિયાન ૮૦૦માંથી આશરે ૨૨૫૦ જેટલી વસ્તી થવા પામેલ. જેમાંના સહજ વિદ્યાર્થીઓની હું વર્ગશિક્ષિકા રહી ચૂકી છું. કેટલાક વિદ્યાર્થીઓના તો મમ્મી-પાપ્પા પણ મારી પાસે ભણી ગયેલા. જેમાંના આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગમતા વિદ્યાર્થીઓ આજે પણ મારી નજરે તરે છે. પરંતુ સૌથી અગ્રીમ સ્થાન જો કોઈ એક વિદ્યાર્થી નહીં – વિશિષ્ટ વિદ્યાર્થીને આપવાનું થાય તો તે કિરણ ઉઙ્ફ ‘કીડી’ને જ મળે.

કિરણ હતી તો માત્ર નવેક વર્ષની પરંતુ આઈક્યુ તેનો ઊંચો હતો. શીખવાની ભાબતમાં તેની ઉલ્કંઢા તીવ્ર કહી શકાય તેવી હતી. નિર્દેખ ભોગપણયુક્ત વાણી, ગ્રામીણ સામાજિકતામાં ઉદ્ઘરેલી હોવા છતાં લગભગ શુદ્ધ શબ્દોચ્ચાર અને પ્રશ્નોત્તરી દ્વારા મન સાથે સમાધાન કેળવી લેવાનું વલણ કેટલું સાહજિક ભાસતું!

કેટલીકવાર તો એવા સવાલો કરતી કે તત્કાલ તો આપણનેય વિમાસણમાં મૂકી દે, એવું વિચક્ષણ પણ સરળ વ્યક્તિત્વ એનું.

એમાંના કેટલાક વિચિત્ર સવાલો આજેય હું ભૂલવા પામેલ નથી. એક વખત તો એવું પૂછેલું કે : ‘ટીચર, આકાશમાં ભીત હોય?’

મેં કહ્યું : કેમ વળી, તારે કેમ આવું પૂછવું પડ્યું?

તો કહે : ભગવાન સૂરજ ઉગાડવાની ચાંપ (સ્વીચ) ક્યાં ઓડતા હશે?

ને ક્યારેક એવું પૂછી બેસે કે અવાક્ થઈ જવાય આપણાથીએ!

એકવાર કહે, ટીચર, મારે તમને એક વાત પૂછવી છે.

મેં કહ્યું : બોલ બેટા, શું પૂછવું છે?

તો કહે : ટીચર, તમે કહેતાં હતાં ને કે ભગવાન આપણા સૌમાં વસે છે, તો પછી કોઈ ખોટું બોલે કે ચોરી કરે તો તે ભગવાને કર્યું ન કહેવાય...?

ભગવાન કદી ખોટું કરે?

અને કરે! તો તેને સજી કોણ કરે?

આવા આવા પ્રશ્નો પૂછતાં તે ધરાતી નહીં. ને તેની સમજમાં આવે તેવા ઉત્તરો આપતાં હું પણ થાકતી નહીં. મને આવી બધી મગજની કસરત કરવી બહુ ગમે.

કિરણ હોંશિયાર હતી એટલે જ મને ગમતી એવું નથી પણ એની અન્યથી કંઈક અલગ પ્રકારની તર્કબદ્ધતાએ જ મારું દિલ જતી લીધું હતું.

ધોરણ ૧ થી માંડી પ સુધી એકના એક વિદ્યાર્થીઓનો વર્ગ મારી પાસે રહેલ. મારા સ્વભાવ મુજબ હું કોઈ પણ વિદ્યાર્થને ‘કીડી’, ‘મુંગી’, ‘બોરી’, ‘ગુર્જી’, ‘ભગો’, ‘મયલો’, ‘લાખો’, ‘સૂર્યો’ એવા બધા હુલામણા નામથી કદી ન સંબોધતી. આ પાંચ વર્ષ દરમિયાન કિરણ મારી સૌથી નજીક અને સૌથી વધુ સમય સાથે જ રહેલ. જેથી મારી દરેક ગતિવિધિ પર તેની નજર કાયમ રહેતી. જેને કારણે તેણે ગજબની આંતરસુજ કેળવી લીધી હતી. મારી પાણી પીવાની ઈચ્છા - ભાવના પ્રાગટ્યને સમજતા વાર ન લાગતી. દોડીને પ્યાલો ભરી લાવતી. ત્યારે એની આંખમાં મને ખુશી અને સંતોષના અનેરા ભાવ અંકિત થયેલા જોવા મળતા. મારું કામ બીજા વિદ્યાર્થી કરે તેને બદલે પોતે જ બધું

કામ કરે એમાં એને મજા પડતી. શિક્ષણના ભાગ રૂપે જે કંઈ વર્ગકાર્ય કરવામાં આવતું, તે સૌથી પહેલાં પૂરતા આત્મવિશ્વાસપૂર્વક કરી બતાવવું એ તો તેનો રોજનો કમ હતો. પરંતુ તેની પાછળ એક ઉમદા ભાવના ધૂપાયેલી હતી કે, વધારાનું કંઈ કામ હું તેને સોંપું!

કામ કરવાની સંનિષ્ઠતા તો મારે તેની પાસેથી શીખવા જેવી હતી. **કચારેક બાળક પાસેથી પણ આપણને પ્રેરણા મળતી હોય છે.** મેધધનુષના જા-ની-વા-લી-પી-ના-રા — એ જ સાત રંગો કેમ? એવા એના સવાલે મને તેના પ્રત્યુત્તર રૂપે એક કવિતા સૂજી આવેલી. એક ગુજરાતી કહેવત છે ને... ‘તેજુનો ટકોરો બસ છે.’ કિરણે તેને બખૂબી સાકાર કરી બતાવી. કા.પા. કાર્ય ભૂસવા હંમેશાં તત્પર રહેતી, એ સૂજ સાથે કે, ક્યારે, કેટલું, કેમ અને ક્યાંથી ભૂસવું; વગેરેની સમજ તેની ઊંમર કરતાં વધારે જણાતી હતી. તેનામાં વિશિષ્ટતા એ હતી કે ચતુર, ચબરાક અને પ્રવીણ હોવા છતાં ખોટી ચાલાકી, લુચ્યાઈ કે ઈઝ્ઝા – અદેખાઈ જેવી નકારાત્મકતા કે સ્વાર્થવૃત્તિ લેશમાત્ર ન હતી. અન્ય વિદ્યાર્થીઓને કંઈક અટપણું શીખવવાનું કે સૂચના સમજાવવાનું કહેવામાં આવે તો કિરણ જરાય આનાકાની વિના ખુશીથી તેમ કરી બતાવતી. ‘શિક્ષક દિને’ તેને શિક્ષક બનવું ખૂબ ગમતું. સ્વભાવ પણ એટલો જ શાંત, સૌઘ્ય અને નિખાલસ, કે કોઈપણ કારણવશ તેને ગુસ્સે થતાં મેં જોઈ નથી. કોઈ નવું કામ કરતાં પૂર્વે મારી સંમતિ લેવાનું કદી ચૂકતી નહીં. વડીલો પ્રત્યે આદરભાવ પણ ભરપૂર. **સદગુણોનો તો જાણો ભરચક ભંડાર.** અવગુણ એક પણ શોધ્યો જડે નહીં. મારી દરેક શિખામણને અચૂક અનુસરે. વારંવાર કહેતી, ‘મારેય તમારી જેમ ટીચર બનવું છે.’

શિક્ષક ઉપર અનહદ પ્રેમ અને વિશ્વાસ તો જાણે કિરણે જ જીતી જાણ્યો. વર્ગભંડમાં હું કે અન્ય શિક્ષક કે અધિકારી પ્રવેશે કે તરત જ ભૂલ્યા વગર ‘ગુડ મોર્નિંગ’ કહી, ઊભા થઈ માન આપવામાં તેનો અવાજ અચૂક પહેલો જ હોય. સાથે મહેમાન નવજીમાં પણ કહેવું ન પડે. લગભગ ૮૮% સરેરાશ હાજરી દર વર્ષ તેની હોય જ કારણકે મારાથી દૂર રહેવું તેને પસંદ નહોતું. બીમાર હોય તો પણ શાલ ઓફીનેય સ્કૂલે તો આવે જ. રજાના દિવસો કે રવિવારની રજા માટે એનો અણગમો બ્યક્ત થતો જોઈ શકાતો. મને જોઈને તેનો હસતી કળી જેવો ચહેરો ખીલી ઊઠતો. એક અનોખી તાજગીની લકીર ઉપસી આવતી તેના મૂઢુ મુખારવિદ્યાં. તેના મમ્મીએ તો હસતાં હસતાં એકવાર એમ પણ કહી દીધું કે, ‘કિરણને તમારે વેર લઈ જાઓ. આમેય મારે ચાર છોકરી છે. તમારે એક છે તો બેયને સથવારો થઈ જાય.’ સંજોગોવશાત્ર ક્યારેક શૈક્ષણિક કાર્ય બંધ હોય, તો પણ કિરણ તો શાળામાં જ હોય.

હવે એક વખત બન્યું એવું કે, કિરણના મામાના લગ્ન

પ્રસંગે આખાયે પરિવારને બહારગામ જવાનું થયું. તેના વાતીઓ રૂબરૂ આવી મારી પાસે બે દિવસની રજા મંજૂર કરાવી ગયા. ચાલુ શૈક્ષણિક કાર્ય છોડીને કોઈ પણ કારણસર, કિરણ ગેરહાજર રહેવા ઈચ્છતી જ ન હતી. ઘરે ગયેલ કિરણને સૌથે સમજાવી. તો પણ દફ્તર ખબે ભરાવી દોડતી દોડતી, ને રડતી રડતી વર્ગભંડમાં પાછી આવી બેસી ગઈ. તેની પાછળ જ તેની મોટી બહેન આવી મને કહેવા લાગી કે, ‘ટીચર, અમે બધા બહારગામ જઈ રહ્યા છીએ. કીડીને અહીં એકલી બે દિવસ રાખી શકાય તેમ નથી. ખૂબ કહેવા છતાં અમારી સાથે આવવા તૈયાર જ થતી નથી. એક જ રટણ કર્યા કરે છે કે ટીચર કાલે કંઈક નવું શીખવશે તો પોતાનો નંબર પાછળ જતો રહેશે. શાળાએ આવવાની જુદ કરીને તે રડચે જ રાખે છે. અમારે શું કરવું, સમજાતું નથી. મારા મમ્મીએ કહ્યું, જ ટીચરને કહે, એ જ કંઈક માર્ગ કાઢી સમજાવશે. તેનું કહ્યું કદી ટાજ્યું છે ખરું!

મને થોડી નવાઈ લાગી. આવા પ્રસંગોની તો સૌ વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે. અરે! કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે શાળામાંથી મુક્તિ મેળવવા ખોટા સારા-માઠા પ્રસંગો ઊભા કરી રજા મંજૂર કરાવવામાં આવતી હોય છે. **પણ હું કિરણની શાળા મિસ ન કરવાની જુદ કદાચ સમજુ શકી હતી.** તેથી મારે એમ કહેવું પડ્યું કે હું પણ બે દિવસ સ્કૂલે આવવાની નથી. ને જાણે ચમત્કાર થયો હોય તેમ તેની આંખોમાં ચમક ઉપસી આવી. પળવારમાં તેના રૂદ્ધના બ્રેક લાગી ગઈ. હોઠ પર આછેરી મુસ્કાન અને આંખોમાં આશ્રય મિશ્રિત પ્રશ્નાર્થ હું પામી શકી, કે ખરેખર, ટીચર તમેય રજા લીધી છે?....

મેં તુક્કો લગાવી હા તો પાડી દીધી પણ વેર જઈ રાત્રે વિચાર કરતાં હું એવા નિર્ણય પર આવી કે સાચે જ મારે શાળાએ જવું નથી. નહિતર કિરણ તો શું અન્ય વિદ્યાર્થીઓ પણ મારી વાતનો વિશ્વાસ કરશે નહીં. વિદ્યાર્થીઓનો વિશ્વાસ ગુમાવવો મને કોઈ હિસાબે પરવડે નહીં. તેથી મેં પણ હકીકતમાં સી.એલ. ભોગવી જ નાખી. ત્યારે મારી અંદર કિરણ પ્રત્યે વિશિષ્ટ ગણી શકાય તેવી અનન્ય લાગણી જન્મી ચૂકી હતી. શાળાકીય પ્રાસંગિક પ્રવચન દરમિયાન મેં કહેલું : ‘શાળા તો એવી હોવી જોઈએ ઘેરથી હસતા આવતા બાળ, શાળાએથી રડતા વેર જાય.’ કારણકે ઘેર જવું ગમે નહીં. કિરણ તે સાર્થક કરી બતાવ્યું.

પછી મારા અંતઃમનને ઠંડોળતાં તેના કારણનું તારણ કંઈક એવું જાણ્યું કે; જર્મન તત્ત્વજ્ઞાની ‘ઇમેન્યુઅલ કેન્ટ’ની વાતનું મેં અનુસરણ ન કર્યું હોય! તેમણે કહેલું કે, ‘તમારે તમારી જિંદગી એવી ચીતે જુવવી જોઈએ કે તમે કરેલું પ્રત્યેક કાર્ય વિશ્વમાનવ કાચદો બનવાનું હોય! આપણે કામયોરી કરીએ, જૂદું બોલીએ ત્યારે, એવું વર્તન કરતાં પહેલાં પોતાની જાતને પૂછ્યાનું કે; મારી જેમ લોકો દુર્ઘટાર આચરણે, તો એવી દુનિયા મારે

જીવવા લાયક રહેશે ખરી? તમે તમારી જાત તમારા સ્વજનો, સાથીઓ અને કર્મક્ષેત્ર પ્રત્યે જરૂર પ્રામાણિક રહો. આદર્શરૂપ ગુણોને જીવનભર અપનાવવાનું વ્રત લો અને એમ કરી જાણો.'

અગાઉ લીધેલા આ વ્રતનું પાલન હું હંમેશાં કરતી રહી છું. તો આવી નજીવી બાબતે તેનો ભંગ કેમ થવા દઉં! અને હું આમ કરી શકી તેથી હજવાશની લાગણી અનુભવી ખુશ છું. ખરેખર! આવા પ્રસંગો જ આપણને પ્રેરકબળ પૂરું પાડતા હોય છે.

પ્રેરણાસ્થોત્ર કચારેક નીચેથી પણ ઉપર જતો હોય છે ખરો!

આ શાળા રાજકોટથી ૧૮ કિ.મી. દૂર હોઈ, અમે બધા જ શિક્ષકો બસમાં અપાડાઉન કરતા. બરાબર યાદ છે મને... એ દિવસ શનિવારનો હતો અને સવારે પોણા આઠ વાગે અમે બસમાંથી ઉત્તર્યા કે મારી રાહ જોઈને ઊભેલી કિરણ દોડતી આવી. મારી પાસેનો થેલો લગભગ ઝુંટવતા જ કહે; ટીચર તમને પગ બહુ દુખતો નથી ને? મારો ખભો પકડી લ્યો.

મેં પૂછ્યું તને કોણે કહ્યું, મારો પગ દુઃખે છે?

ચિંતિત સ્વરે કિરણે કહ્યું : 'કાલે તમે સ્કૂલે નહોતા આવ્યા ને? એટલે મેં ચંદ્રિકા ટીચરને પૂછ્યું'તું, તેથી મને ખબર પડી કે પરમ દિવસે બસમાંથી ઊતરતા તમારો પગ મચકોડાઈ જ્યો'તો. એટલે આજે તમારી રાહ જોઈ, હું ક્યારની... પાદરે ઊભી'તી. એ પળે મને જે સહાનુભૂતિની તીવ્ર લાગણી સ્પર્શ ગઈ, તે આંખો ભીની કર્યા વિના ન રહી.

પછી કહે : 'ટીચર, તમે કીધું'તું ને પર્યાવરણમાં 'વગ્ફિકરણા'નો પાઠ છે ને એવું બધું આપણે કરશું...! આજે તો બહુ મજા પડી જશે! હું અ... મને ખબર પડી ગઈ... આ થેલામાં એવી બધી વસ્તુ જ છે ને! હું ઘરેથી પાઠ વાંચીને જ આવી છું.'

શનિવારે મારા વર્ગમાં ખાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી જેવી કે ખરબચું, લીસું, કઠણ, બરડ, નરમ, પારદર્શક, અપારદર્શક વગેરે પદાર્થોના ગુણવર્ધ્માં સમજાવવા, ઓળખ કરાવવા હું મૂર્ત વસ્તુઓ એકનિત કરી, બાળકોને અનુભવ કરાવતી. જે દ્વારા તેમને અભિપ્રેત શિક્ષણ પ્રાય બનતું. મારી શિક્ષણ પદ્ધતિ કંઈક અલગ પ્રકારની હતી. જેવી બાળકો આકર્ષિતાં અને સાચા અર્થમાં તેઓ પ્રવૃત્તિલક્ષી, આનંદમય અને ક્ષમતાકેન્દ્રી શિક્ષણ મેળવી શકતા. જેને કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થી પ્રત્યે, શિક્ષક-વિદ્યાર્થી પ્રત્યે આત્મિયતા વધુને વધુ ગાઢ બનતી જતી. ત્યારે મને એક તરફ સંતોષની લાગણી થતી તો બીજી તરફ હજુ વધારે ને વધારે અસરકારક શિક્ષણ બનાવવાના પ્રયોગો હાથ ધરવાની ભૂખ ઉઘડતી.

કક્ષા અને વિષયાનુસાર પ્રોજેક્ટ કાર્ય કરવા માટે બાળકો સાથે મારે ગામમાં જઈ જરૂરી માહિતી મેળવવાની હતી તે માટે નીકળ્યાં કે રસ્તાની એક તરફ ઝુંપડા પાસેથી પસાર થતા હતા, એવામાં કૂકડે... કૂકડે... કૂકડે... એવો અવાજ સંભળાયો

કે તરત જ કિરણ કહે : જુઓ ટીચર સવાર પડી!

મે કહ્યું : અત્યારે ૧૧ વાગે તું સવાર પડવાની વાત કરે છે? તો કહે, તમે સાંભળ્યું નહીં? હમણાં કૂકડો બોલ્યો... તે? અમે બધા હસી પડ્યા.

છતાં સહેજ શરમાતા શરમાતા કહે : 'ટીચર, તમે જ નહોતું કીધું? કવિતા સમજાવતા હતા ત્યારે એમાં લખ્યું'તું ને કે કૂકડો બોલે એટલે સવાર થાય?'

હું તો સત્ય જ રહી ગઈ. ખરેખર! તેણે મારી ભૂલ પકડી પાડી હોય, તેવા અપરાધભાવની અનુભૂતિ કરાવી દેતી તેની આવી કાલી-ઘેલી વાતો, બાળમેળો હોય, રમતોત્સવ હોય, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હોય કે કોઈ ખાસ દિવસ ઉજવવાનો હોય, કિરણનો ઉત્સાહ કંઈક નવી જ રંગત લાવી હે. જેને કારણે તે કાર્યક્રમની સફળતાનો પર્યાય બની રહી હતી. શાળાની રોનક ગણાતી એ. આજે પણ કોઈ બાળ કાર્યક્રમ જોતી હોઉં ત્યારે કિરણની ચિરંજીવી બની ગયેલી સ્મૃતિ કેમ વિસરાય!

૪/૬, શિવાજી પાર્ક, 'એન્ડ્રિયુલિયન' પાર્ક, રાજકોટ - ૩૬૦ ૦૦૭.

૧૯૯૦ના દશકામાં એલ.ઇ.ડી. લેખ વિકસાવનારા વિદ્યાની ઈસામુ આકાસાકીનું અવસાન

જાપાનના વિજ્ઞાની ઈસામુ આકાસાકીનું તાજેતરમાં ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે હિરોશી અમાનો અને સુજી નાકામુરા સાથે મળીને ૧૯૯૦ના દશકામાં જ્યુએલ.ઇ.ડી.ની શોધ કરી હતી. આ કાંતિકારી શોધ માટે ત્રણેય વિજ્ઞાનીઓને ૨૦૧૪માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક અપાનું હતું.


એ વખતે નોબેલ કમિટીએ કહ્યું હતું : 'જલોબલ વોર્મિંગની સમસ્યા વચ્ચે આ શોધ ખૂબ જ કાંતિકારી છે. ૨૦મી સદી બલ્બના નામે રહી, પરંતુ ૨૧મી સદી એલ.ઇ.ડી. લેખના નામે રહેશે. ૨૦મી સદીમાં ૨૧મી સદી અજવાળવાની મહેનત કરનારા વિજ્ઞાનીઓએ દુનિયાને નવા રંગની રોશની આપી છે.'

ઓનલાઈન દસ્તાવેજોની આપણે માટે પીડીએફનો વ્યાપક ઉપયોગ

પીડીએફના શોધક અને

ઓડોબના સહ-સ્થાપક ચાર્લ્સ ગેશ્કીનું નિધન

પીડીએફ (પોર્ટફલ ડોક્યુમેન્ટ ફિર્મેટ)ના શોધક ચાર્લ્સ ગેશ્કીનું ૮૧ વર્ષની વયે કેવિફોર્નિયામાં તાજેતરમાં નિધન થયું હતું. પીડીએફ અત્યારે ઓનલાઈન દસ્તાવેજોની હેરાફેરી માટે વ્યાપકપણે વપરાતું ફોર્મેટ છે. બાળકોની એકજામના પેપર હોય કે અન્ય કોઈ ફોર્મ હોય, એ બધું પીડીએફ સ્વરૂપે મોકલી - મેળવી શકાય છે. એ ચાર્લ્સને આભારી છે. ચાર્લ્સ જોન વાર્નોક સાથે મળીને ઓડોબ કંપનીની સ્થાપના કરી હતી.



કારકિર્દી

GPSC પરીક્ષાઓ

૧૦૦ દિવસના અભ્યાસમાં પાસ કરવી શક્ય છે?



હિરેન દવે

કોરોના મહામારીને કારણે અટવાયેલી ભરતી પ્રક્રિયાઓ ફરીથી શરૂ કરવા જી.પી.એસ.સી. દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને વર્ષ ૨૦૨૧ની ભરતી પ્રક્રિયાનું ટાઈમ ટેબલ જાહેર કરી અનેક પરીક્ષાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેનાથી સરકારી અધિકારી બનવાના સપના જોતા અને દિવસ-રાત તૈયારી કરતા યુવક-યુવતીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જયું છે. કોરોના મહામારી બાદ ખાનગી નોકરીઓ ગુમાવનાર યુવાધન સરકારી નોકરીઓ તરફ આકષ્યિં છે ત્યારે આ ભરતીઓ માટે સારો એવો માહોલ બનતો જોવા મળે છે. લગભગ ૧૦૦ દિવસના ટૂંકા સમયમાં કેવી રીતે તૈયારી કરવી તેની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પડાવ્યું છે.

● ટાઈમ મેનેજમેન્ટ :

જી.પી.એસ.સી.ની આ પરીક્ષાઓ ‘જનરાલિસ્ટ’ પ્રકારની કે નોન-ટેકનિકલ વર્જ ૧-૨ પ્રકારની ગણાય છે. જનરાલિસ્ટ સર્વિસ એટલે એવી સેવાઓ કે જે કોઈપણ ક્ષેત્રે સ્નાતક થયેલ ઉમેદવાર આપી શકે છે. આ સેવાઓમાં પસંદ થયેલા અધિકારીઓને જિલ્લા સ્તરે મેનેજરિયલ ભૂમિકા બજવવાની હોય છે. સારા મેનેજમેન્ટ / પ્રશાસનની ભૂમિકા એ હોય છે કે ઓછામાં ઓછા સંસાધનો (રિસોર્સીસ)નો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મહત્વમાં આઉટપુટ મેળવી શકે છે. જેમ કે જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર કે ડી.વાય.એસ.પી. તરીકે જુટી આપવામાં આવે તો પ્રત્યેક જિલ્લામાં હન્કાસ્ટ્રક્યર, મેનપાવર, ફંડ મર્યાદિત હોય છે. તેની સામે લોકોની જરૂરિયાતો કે આકાંક્ષાઓ અમર્યાદિત હોય છે. આમ, આ પરીક્ષાઓનો અભ્યાસક્રમ પણ આજ ડિલોસોફીને અનુસરે છે. પ્રિલીમ પરીક્ષાનો ખાલી અભ્યાસક્રમ હ પાનાનો છે. આટલો વિશાળ અભ્યાસક્રમ કિલ્યર કરવા સમય ખૂબ જ મર્યાદિત છે. જ્યારે એસ્પ્રીન્ટ પાસે સમય, યાદ રાખવાની શક્તિ વગેરે લિમિટેડ છે. આ લિમિટેડ રિસોર્સીસનો જે બેસ્ટ યુઝ કરી હાઈએસ્ટ આઉટપુટ આપે તે શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેટર.

● બેલેન્સ પ્રિપેરેશન :


જનરાલિસ્ટ અધિકારીઓની કામગીરી ખૂબ ડાયવર્સિફાઇડ હોય છે. જેમકે રેવન્યુ કેડરના ઓફિસર, લેન્ડ રેવન્યુ મેનેજમેન્ટ તો કરે જ. ઉપરાંત વિવિધ ચૂંટણીઓ યોજવાની, વસ્તી ગણતરી

કરવાની, વિવિધ સરકારી યોજનાઓનું અમલીકરણ કરવાનું, કોરોનાથી માંડી પૂર, ભૂકુંપ જેવા ડિઝાસ્ટર હેન્દલ કરવાના, જિલ્લાના મેડિકલ ઓફિસર, એન્જિનિયર, ઈકોનોમિસ્ટ, સેટેસ્ટિશિયન, એકેડેમિશિયન વગેરે એક્સપર્ટ્સ તેમના હાથ નીચે કામ કરે છે. આમ, આ કેડરના અધિકારીઓ માટે કોઈ એક કોગના નિષ્ઠાત હોવું ન ચાલે પણ અનેક કોગની પાચાની સમજ હોવી જરૂરી છે. ‘માસ્ટર ઓફ વન’ કરતાં ‘જેક ઓફ ઓલ’ની જરૂર છે. આથી આ પરીક્ષાઓનો સિલેબસ પણ અનેક ફન્ડામેન્ટલ ક્ષેત્રો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, રાજ્ય વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધો, મેન્ટલ એબિલિટી, અર્થવ્યવસ્થા, ભૂગોળ, વિજ્ઞાન અને ગ્રોઘોળી, કરન્ટ અફર્સ વગેરે બ્રોડ ટોપિક્સ કવર કરે છે. આમ કોઈપણ સ્ટ્રીમના એન્જિનિયરીં, મેડિસિન, કોમર્સ, આર્ટ્સ વગેરેના કેન્દ્રિયે ટૂંકા સમયમાં અનેક નવા વિષયો શીખવા / પચાવવા પડે છે અને જે વિવિધ વિષયો પર બેલેન્સ તૈયારી કરી શકે તે સિલેક્ટ થાય છે.

● સિલેબસ ફોકસ :

હાલમાં જે વિદ્યાર્થીઓ આ તૈયારી કરવા માંગતા હોય છે તેઓ બૂકસ્ટોલ પર એવો પ્રશ્ન પૂછતા હોય છે કે કયું પુસ્તક વાંચવું? પણ વધુ આઈ.એમ.પી. એ છે કે પુસ્તકમાંથી શું વાંચવું? તમારો હ પાનાનો અભ્યાસક્રમ તમારા સ્ટડી ટેબલની સામે ચીપકાવેલ ન હોવો જોઈએ અને કોઈ પણ પુસ્તક વાંચો, હંમેશાં એ જ મુદ્દા કવર કરો કે જે સિલેબસમાં હોય. સિલેબસ પ્રમાણે વિવિધ રેફરન્સ માટિરિયલનો ઉપયોગ કરો. ગવર્નમેન્ટ પબ્લિકેશનને વધુ મહત્વ આપો અને ત્યારબાદ જૂના વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરો. એના આધારે તમારી તૈયારીને સ્ટ્રીમલાઈન કરતા રહો. કેક્યુઅલ કરતાં એનાલિટિકલ એપ્રોચે કેળવો.

એવરી ડાક્ટર કલાઉડ હેલ્પ સિલ્વર લાઇનિંગ. હ પાનાનો અભ્યાસક્રમ જો ધીરજપૂર્વક વાંચી જાઓ તો એમ થાય કે આટલો વિસ્તૃત અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ થાય. પણ જી.પી.એસ.સી.ની જૂની પરીક્ષાઓનો સ્કોર જોતાં એવું કહી શકાય કે ૪૦૦ માર્કમાંથી લગભગ ૧૫૦ માર્ક પણ જો લાવી દો તો પ્રીલિમનો બેઠો પાર થઈ જાય છે. આમ, જો થોડી તૈયારી યોગ્ય રીતે કરશો તો કદાચ અધું છે પણ અશક્ય નથી!



નારી ગૌરવગાયા - ૨

કેન્સરગ્રસ્ત દર્દીઓને માનસિક રીતે તૈયાર કરતા : રોહિણીબેન દવે



મનોજ પંડ્યા

આજે કેમિકલયુક્ત આહાર દ્વારા માણસ અનેક જીવલેશ બીમારીનો ભોગ બની રહ્યો છે. એમાં સૌથી જીવલેશ બીમારી છે કેન્સર. આજે દેશની હોસ્પિટલો કેન્સરના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને મોતના મુખ તરફ માનવી ધરી રહ્યો છે. પ્રથમ તો કોઈપણ પ્રકારનું વ્યસન માણસને ન વળ્ગે તેની ખાસ તક્કેદારી રાખવાની જરૂર છે અને કદાચ કેન્સર નિદાન થાય, તો નાસીપાસ થયા વગર તેની હિંમતથી સારવાર કરવામાં આવે તો દર્દી જરૂર સાજો થઈ શકે છે.

આજે એક એવી જ કેન્સર વોરિયર મહિલાની વાત કરવી છે, જેણે બે-બે વખત કેન્સરને માત આપી છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. જેથી તેમના જીવનમાંથી અન્યને પ્રેરણા મળશે.

હું વાત કરીશ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવગર નગરમાં વસતા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રોહિણીબેન સુરેશભાઈ દવેની. (મનુભાઈ પંચોળી 'દર્શક'ના ભાષેજ.) જેમણે બે-બે વખત કેન્સર જીવી જીવલેશ બીમારી સામે આત્મબળથી લડીને તેને માત આપી, ફરી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા બજાવવા કટિબધ્ય થયા છે.

તેમની કેન્સર સામેની લડાઈ વિશે વાત કરું તો તેમને ૨૦૧૨માં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. પરિવારના સભ્યો આ સાંભળીને વિયલિટ થઈ ગયા. પણ રોહિણીબેને મનોબળ મજબૂત કરી, જાતે પરિવારના સભ્યોને હિંમત આપી કે કોઈ ચિંતા કરશો નહીં. આપણે નિયમિત સારવાર કરાવીશું એટલે સાજી થઈ જઈશ. તેમની આવી હિંમત જોઈને પરિવારના સભ્યોમાં પણ હિંમત આવી ગઈ અને થઈ સારવારની શરૂઆત.

પ્રથમ, તા. ૨૭-૨-૨૦૧૨ના રોજ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી ગાંઠ કાઢી નાખવામાં આવી અને તેને બાયોપ્સી માટે અમદાવાદ ખાતે મોકલી આપી. રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આથી તરત જ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરી. ત્યાં ફરીથી તા. ૧૫-૩-૨૦૧૨ના રોજ ઓપરેશન કરીને વધેલી ગાંઠ કાઢી નાખવામાં આવી. પછી થઈ રેઝ્યુલર સારવારની શરૂઆત. દ કેમોથેરાપી, ૩૦ રેફિયેશનની સારવાર લઈ લીધા પછી તા. ૩-૧૦-૨૦૧૨ના રોજ સારવારની સાઈકલ પૂરી થતાં ફરી નોકરી પર હાજર થઈ ગયા.



રોહિણીબેન સુરેશભાઈ દવે
(શિક્ષિકા)

આ સમય દરમિયાન તેઓ યોગાસનો, પ્રાણાયામ પણ નિયમિત કરતા અને ચાલવા પણ જતા. પૂજા પણ કરતા. જેથી તેમનામાં અજબ પ્રકારની સુર્ખૃતિ રહેતી. જે આવા રોગ સામે લડવાની શક્તિ આપે છે.

આ સમય દરમિયાન તેમના પતિ, કે જે પોતે પણ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, તેમણે અલગ અલગ સમાચાર પત્રોમાં આવતા કેન્સરનું નિદાન અને સારવારની માહિતીના લેખોનું કટિંગ કરીને એક ફાઈલ તૈયાર કરી હતી. તે વિગતો અન્ય આવા રોગથી પીડાતા દર્દીઓને ઉપયોગી થવાના હેતુસર પોતાની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી, કેન્સર જગૃતિ અભિયાન શરૂ કર્યું.


જે હાલ પણ ચાલુ જ છે. તેમાં સાથ મળ્યો છે રોહિણીબેનનો.

જ્યાંથી કોઈને કેન્સરની બીમારી થયાના સમાચાર મળે, તો બંને દંપતી તેમની પાસે રૂબરૂ જઈને દર્દીને સાંત્વન આપે, હિંમત આપે અને જરૂર જણાય તો તેમના પતિ અમદાવાદ સુધી દર્દીની સાથે પોતાના ખર્ચ જઈને યોગ્ય સારવાર ચાલુ કરાવે છે. રોહિણીબેન કહે, જુઓ મને પણ કેન્સર થયું હતું ને સારવાર કરાવી તો મટી ગયું. તમે પણ હિંમતથી સારવાર કરાવો.

દર્દીને સારવાર માટે માનસિક રીતે તૈયાર કરવો, એ જ આ રોગ માટે મહત્વનું છે. અત્યાર સુધીમાં આશરે પચીસથી પણ વધુ દર્દીઓને તેમની હિંમતથી સારવાર કરાવવામાં ફાયદો થયો છે, ને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. ફરી રોહિણીબેનને તા. ૨-૫-૨૦૧૮ના રોજ નિદાન કરાવતા લીવર, સાયનસ અને અન્યત્ર — એમ ચાર જગ્યાએ કેન્સરે દેખા દીધી.. ફરી હિંમતથી સામનો કરીને સારવાર કરાવી હતી. આ રીતે કેન્સરને માત આપીને તા. ૭-૭-૨૦૨૦થી ફરી શિક્ષિકા તરીકેની પોતાની સેવા બજાવવા તત્પર બન્યા અને એટલી જ ત્વરાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે.


ટૂંકમાં, તેમની હિંમતથી, બીમારગ્રસ્ત કોઈપણ માણસને પ્રેરણા મળશે એ જ શુદ્ધ હેતુ સાથે આ લેખ પ્રસિદ્ધ કરવાનો આશય છે. હિંમત હાર્યા વગર કોઈ વ્યક્તિ આ પ્રકારના દર્દીની સારવાર કરાવે તો જરૂર તેમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ આ માટે દર્દીને પરિવારની હુંફું પણ એટલી જ જરૂરી છે.

'શિવાલય', મહાત્મા ગાંધી રોડ, શેરી નં.-૪, જોરાવર નગર, તા. વાણીયા, નિ. સુરેન્દ્રનગર-૩૬૩ ૦૨૦. મો. ૮૮૬૬૧ ૫૩૨૪૩



યાદગીરી

સુભિરે.... બલભીરા (સ્મૃતિપટ પર સંભારણાં)



સંપાદન :
બલભીરસિંહ જાડેજા

(કોઈપણ વાચક પોતાના જીવનના સંભારણાંની વિગત
આ વિભાગમાં મોકલાવી શકે છે.)

“હા, પસ્તાવો વિપુલ ઝરણું...
.... પુષ્ટયથાળી બને છે.”

- કવિ કલાપી

કવિ કલાપીની આ કવિતા તો પાછળથી ભણવામાં આવેલી, પરંતુ જ્યારે અર્થ સમજાયો ત્યારે, બાળપણમાં બેનેલા પ્રસંગ થકી, મનમાં કાયમ રહેતો ચચરાટ કે ગુનાની લાગણીમાંથી કાયમ મુજિત મળી. સાથે સાથે જીવનનો એક નવો પાઠ શીજવા મણ્યો કે બીજા સાથે કઇ રીતે વર્તન કરું જોઈએ. ભલે પછી સામેની વ્યક્તિ કોઈ પણ હોય, નાની કે મોટી, ઉચ્ચ કે નીચ, આપણાથી ઉત્તરતી કક્ષાની કે ઉચ્ચ હોદ્દો ધરાવનાર, આ નવા પાઠ થકી હું મારી કારકિર્દીમાં લોકપ્રિયતાના શિખરો સર કરી શક્યો, એની વાત છે.

વાત છે ૧૯૮૮ના વરસની, જ્યારે હું પાળિયાદની બુનિયાદી શાળામાં ચોથા ધોરણમાં ભણતો હતો. અમે ત્રણ ચાર મિત્રો એક જ લાઈનમાં બેસતા. એમાં એક બાવાજ પોસ્ટમેનનો દીકરો ગરીબદાસ પણ હતો. હું જન્મે રાજગોર બ્રાબિશા, ને મારા પિતાશ્રી, એ વખતે ઊંચો કહી શકાય એવો તલાટીનો મોભાદાર હોદ્દો ધરાવે. એટલે કદાચ, ના સમજથી કે દેખાદેખીથી, મારા મનમાં ગુરુત્વાત્મકિના ભાવ રોપાઈ ગયા હશે. એ વખતે પાટી-પેનનું ચલણ અને ચિત્રો પણ પાટીમાં જ દોરવાના. તેમજ રંગપૂરણી પણ રંગીન ચોકથી પાટીમાં કરવાની રહેતી. પિતાશ્રીએ રંગીન ચોકનું બોક્સ મને લઈ આપેલું એટલે હું અહોભાવથી બાકીના મિત્રોને રંગકામ કરવા મારા ચોકનું બોક્સ આપ્તો. પરંતુ કોણ જાણો કેમ ગરીબદાસને ના પાડતો, કે હું ઉચ્ચ કુળનો અને મારા પિતાશ્રી મોભાદાર હોદ્દો પર અને ગરીબદાસ મારાથી નીચા કુળનો અને એના બાપુજી એક સામાન્ય પોસ્ટમેન! ઇતાં પણ મારા ચોકનું બોક્સ નહીં આપવા બાબતે, ગરીબદાસના ચહેરા પર કદી અભાવ કે નારાજગીના ભાવ, ક્યારેય દેખાતા નહીં, એ તેની મોટાઈ હતી.

થવાકાળ છ માસિક પરીક્ષામાં હું રંગપૂરણી માટે રંગીન ચોકનું બોક્સ ભૂલી ગયો હતો અને યોગાનુયોગ મારો અને

ગરીબદાસનો નંબર બાજુબાજુમાં આવ્યો. ગરીબદાસને ઘણા વખત પછી પરીક્ષા નિમિત્તે એના બાપુજીએ નવા રંગીન ચોકનું બોક્સ અપાવેલ.


પરીક્ષા શરૂ થઈ, ને મને યાદ આવ્યું કે હું રંગીન ચોકનો બોક્સ ભૂલી ગયો છું. હવે? હું વારંવાર ગરીબદાસ સામે ને એના ચોકના બોક્સ સામે જોયા કરું. પરંતુ મારી હિંમત કઈ રીતે ચાલે કે હું મારા માટે રંગીન બોક્સ માંગી શકું! મને મારો ભૂતકાળનો વ્યવહાર યાદ આવતો હતો. ગરીબદાસને મારી મૂંજવણનો ઘ્યાલ આવી જતાં એણે મને ધીમેથી નિસ્પૃહભાવે કહ્યું, ‘મારા કલર લેવા હોય તો લે, હું ના નહીં પાડું.’ મારાથી આંખ ઊંચી કરીને, એની સામે જોવાયું પણ નહીં એટલી શરમ આવી. ક્યાં હું, ને ક્યાં ગરીબદાસ! મનોમન હું અમારી સરખામણી કરવા લાગ્યો. મેં અચકાતા અચકાતા, ગુનાહિત લાગણી અનુભવી, ને એના કલર તો લીધા, પણ એ વખતથી મારા મનમાં ગુનાની લાગણી ઘર કરી ગઈ. જો કે એ પછી અમે બને પાકા મિત્રો બની ગયા હતા અને હજુ સુધી અમારી મિત્રતા અકબંધ છે. પરંતુ મારા મનમાં ઉઠેલી ગુનાની લાગણી ત્યાં સુધી રહી, જ્યાં સુધી કવિ કલાપીની કવિતા, ‘હા, પસ્તાવો....’ સમજ્યો ને ખૂબ પસ્તાવો થયો. મેં ગરીબદાસ પાસે દિલ ખોલીને આ વાત કરી ને એની માફી માંગી. ને એણે મને માફ કર્યો ત્યારે મારા મનમાંથી, પસ્તાવા થકી ગુનાની લાગણી દૂર થઈ અને શાંતિ થઈ.

એ પછી મારા વ્યસ્ત જીવનમાં, સરકારી અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન, મારા બાળપણના ઉપરના અનુભવે, લોકો સાથે વ્યવહાર કરવાની દંદિ બદલાઈ ગઈ અને મારા સરળ - સૌજન્યપૂર્ણ વ્યવહારે મને લોકપ્રિય બનાવ્યો, એ આ બાળપણની યાદગીરીની ફલશ્રુતિ.

(Gujarati Book Online – ‘પરમ તેજ’

Free download : http://www.archive.org/details/Param_Teje)

ભાગુભાઈ શિલુ, નિતું આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર
દર્બારી, પંચવારી સોસાયટી,
'સવિતા' કાલ્યક્યુન્ઝ બ્રાબિશ બોર્ડિંગ પાસે,
જમનગર-૩૬૧ ૦૦૨. મો. ૯૮૨૬૨ ૫૭૮૬૬



જીણાં બંધન

જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે... મા



પારુલ દેસાઈ

બા, મમ્મી, મમા, મોમ, મા એટલે મનની ઈચ્છા, વ્યથા, દુઃખ, ઝુશી એમ કંઈપણ વગર કહે જ સમજ જનાર વ્યક્તિ.

જગતના તમામ સ્નેહ સંબંધમાં માનો પ્રેમ સર્વોચ્ચ છે. ઉંમરથી વડીલ હોવા છતાં ‘તુ’કારે બોલાવવાનો હક્ક તેણે પોતાના સંતાનને આપે. જેના પર ગુસ્સે થયા હોઈએ, જઘડયા હોઈએ, પછી ૧૦મી મિનિટે તેના જ હાથની સ્વાદિષ્ટ રસોઈ પ્રેમથી જમાડે તે મા. મનની નાની મોટી કોઈ પણ વાતો વ્યક્ત કરવાનો મોક્કો આપે એ મા.

એક જ ઝાટકે એક સાથે શરીરના ૨૦ હાડકા તૂટે અને જે પીડા થાય તેટલી પીડા બાળકને જન્મ આપે તે સમયે માતા ભોગવે છે. પરંતુ બાળકના રડવાનો અવાજ સાંભળતા જ તેણીની આંખમાંથી હર્ષના આંસુ વહે છે. આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે બાળક રડે છે અને મા સ્પિન્ટ કરે છે. ભક્ત જેમ પ્રભુને શાશ્વત સજ્જાવે, ભોગ ધરાવે, તે જ ભાવથી મા બાળકને નવડાવે, તૈયાર કરે, જમાડે, સુવડાવે. ૧૦-૧૨ વર્ષની ઉંમર સુધી બાળક માટે પોતાની મા એટલે જરૂરિયાત પૂરી કરનારી, વહાલ કરી પ્રોત્સાહિત કરનારી, તો ક્યારેક નાની-નાની વાતમાં બિજાતી, રોકની-ટોકતી, માર્કસ ઓછા આવે તો લાંબુ લેક્યુર આપતી વ્યક્તિ, ટીનેજર્સ પર તીખી નજર રાખતી, મોબાઇલ પર શું કરે છે તેનું ધ્યાન રાખતી વ્યક્તિ. **પરંતુ સમય જતાં સમજણા આવે કે આ વ્યક્તિ માત્ર જન્મદાત્રી જ નહીં પણ શ્રેષ્ઠ માર્ગદર્શક, હિતેચ્છુ અને સંસ્કારદાત્રી છે.** આ એ છે જેનું ઋણ સો જન્મ લીધા પછી પણ ચૂકવી શકાતું નથી. તે જ સારી ખરાબ બાબતોથી વાકેફ કરી, થયેલી ભૂલોને સુધારવા પ્રેમથી સમજાવી સંતાનનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રેરણા પૂરી પાડે છે. માતાની લાગણી જ સંતાનને આત્મવિશ્વાસી બનાવે. ઈશ્વર જેમ કોઈ પણ બેદભાવ વગર ભક્તને શરણું આપે તે જ રીતે માતા સંતાનની ભૂલોને માફ કરી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. ટૂંકમાં Mother ને વર્ણવવી હોય તો —

M = Merciful, O = Obliging, T = Tolerance,

H = Hard working, E = Eager, R = Righteous

મા એ દ્યાનું જરણું છે. નિઃસ્વાર્થ સેવિકા બની હંમેશાં પરગજુ બની રહેનારી હોય. પોતાના સંતાનના ઉછેર માટે


સહિષ્ણુ બની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી તેના સુખ માટે પરિશ્રમ કરી હંમેશાં સફળ સમૃદ્ધ બનાવવા આતુર રહે છે. માતૃપ્રેમ અતુલ્ય છે. માટે જ તો કહેવાયું છે કે — “નાસ્તિ માતૃસમા છાયા, નાસ્તિ માતૃસમા ગતિ: નાસ્તિ માતૃસમ ત્રાણ નાસ્તિ માતૃસમા પ્રિયા” અર્થાત્ **માતા સમાન કોઈ છાંચડો નથી.** માતા તુલ્ય કોઈ આશરો નથી. માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી.

House is not Home without Mom. જ હા, મા વિના સુનો સંસાર, મા વગરનું ધર ન હોઈ શકે, એ માત્ર મકાન હોઈ શકે. મા એ કુટુંબના સભ્યોને, તમામ સંતાનોને જોડતી કરી છે. તેની માટે બધા સરખા. બધા વર્ષે સંપ રહે તેવું શીખવે. કોઈ અન્યાય કે લેદ નહીં. દીકરી, એ મા ની પરછાઈ છે, તો દીકરો તો હોય જ મા નો. ગમે તે ઉંમરે મા ના ખોળામાં માણું રાખી વાતો કરતા રહેવાનું. ક્યારેક આંખો બંધ કરી પોતાના સુખ-દુઃખના સ્મરણો વાગોળવાનું એને ગમે છે. મા ના પાલવથી મોહું લૂછવામાં જ્યાથી વધુ લહેજત એને મળે. જો કે આજકાલ જ્ઞસ પહેરતી મમ્મીઓ દીકરાને આ સંતોષ આપી શકતી નથી.

માત્ર બાળકને જન્મ આપવાથી જ ‘મા’ નથી બની જવાતું, જવાબદારી લઈ તેની માટે સમય આપવો, બાળકની ખરાબ આદતોથી વાકેફ થઈ સાચું માર્ગદર્શન આપવું, પોતાની વાણી - વર્તનથી સત્ય, સહનશીલતાના, ધીરજના ગુણો ખીલવે તે મા. પોતે હકારાત્મક વલણ રાખશે તો અન્યને પણ એ જ આપી શકશે. સાંપ્રત સમયમાં યુવતીઓ લગ્ન કરી બાળકને જન્મ તો આપે છે પરંતુ આ આધુનિક પોતાના બાળક કરતા કારકિર્દી અને મોજશોખને વધુ મહત્વ આપે છે ત્યારે તેણી ‘બેબી સીટિંગ’ અથવા ‘આયા’ના ભરોસે બાળકને છોડતા અચકાતી નથી. ચીજાસ્તુઅનોના ટગલા દ્વારા એશોઆરામ આપી પોતાની ફરજ ભજવનારી સ્ત્રી ને ‘મા’ કેમ કહી શકાય? બાળપણાથી જ મોબાઇલ અને ટી.વી.ની આદત પાડે અને પછી ફરિયાદ કરવી એ કયાંથી ચાલે?

માતાના ખરા સદ્ગુણો સભર એજનીસ ગોન્હા કે જેઓને આપણે ‘મધર ટેરેસા’ના નામથી સુપેરે જાણીએ છીએ, તેમણે

(અનુસંધાન : જુહો પાના નં. - ૩૮ ઉપર)



જીવનનાવ

ભાભી-મા



એમ. ડી. સોલંકી

‘અજવાળી, હાથ્ય ઉભી થા. હવે આપણે વાળું કરી લઈએ.’

‘તમે બાપ-દીકરો બેય જમી લ્યો. આજે મને જરાય ભૂખ નથી.’

‘પણ એમ કાંઈ ખાધા વગર ચાલશે ખરું? સવારમાંય તે ખાધું નથી.’ અરજણ બોલ્યો.

‘અરજણ, કેમ કરીને ધાનનો કોળિયો ગળે ઉતરે? પંદર-પંદર વરહ લગી જેને પેટના જણ્ણા કરતાંય અદકા વહાલથી લાલન-પાલન કરીને ઊછેર્યો અને સમય આવતા જેના હાથ પણ પીળા કરી દીધા એ જ અરવિંદ આવતીકાલથી અલગ મકાનમાં રહેવા જશે. અંશના બાપા, તમે તો રહ્યા પુરુષ! વખતે તમે તમારા મનમાંથી લાગણીઓના તારને ઘડીભર વિસારેય મૂકી શકો, પણ અમે? અમે તો કાચાં-પોચાં કાળજાવાળી અસતરીની જાત! પરમાત્માએ અમારા કાળજામાં લાગણીઓના અમીકુંભ ઢાલવી દીધા હોય એટલે અમારા અંતરમાં હેતની સરવાણીઓ અવિરત રહ્યા જ કરતી હોય છે. સગા દીકરાથી પણ વધારે વહાલથી જેનું જતન કર્યું હોય એવો અરવિંદ દીકરો એની મા થી અલગ રહેવા જવાનું વિચારે એ વાત મારાથી કેમ કરીને સહન થાય?’ અજવાળીએ એના મનની વેદના રજૂ કરી.

‘અજવાળી, ઘટાદાર વૃક્ષ ઉપર બાંધેલા માળામાં હડા મૂક્યા પછી એમાંથી બચ્ચા થાય ત્યારે પંખી એના બચ્ચાઓનું પાલન-પોષણ કરે છે. પોતે ભૂખ્યા રહીનેય પંખીજાત એના બચ્ચાઓની ચાંચમાં ખાવાનું મૂકે છે. સમય વિતતા, એ બચ્ચાઓને પાંખો ફૂટે અને પછી તો એક દિવસ એ બચ્ચાઓ એમના જન્મદાતા અને ઊછેરીને મોટા કરનાર મા-બાપ અને એમના આશ્રય સ્થાન એવા માળાઓની માયા છોડીને અનંત આકાશમાં ખોવાઈ જાય છે. કુદરતનો આ કમ જાણો કે માનવજાતનેય લાગુ પડે છે. એટલે અફસોસ કરવો સાવ નકામો જ ગણાય.’

‘વાત તો અરજણ તમારી સાવ સાચી છે. સમાજ કે કુટુંબમાં લાંબા સમય સુધી કોઈનુંય ભેગું ચાલતું નથી. પ...ણ...’

‘પ...ણ... શું?’

‘એકબીજાના મન ખાટાં કરીને અલગ રહેવું એ તો જરાય બાજબી ના ગણાય.’

‘અજવાળી, આપણા આ મનખાવતારમાં ક્યારેક એવો સમય પણ આવ્યો છે કે કોઈ વાત આપણાં મનને બાજબી લાગતી ના હોય તો પણ મન મજબૂત કરીને એવી વાતને પણ સ્વીકારી લેવી પડે છે. લે ઊઠ, હવે આ અંશ પણ ભૂખ્યો થયો છે. વાળું કર્યો પછી મારેય રજકામાં પાણી લેવા જવાનું છે.’

વાળું કરીને અરજણ રજકામાં પાણી લેવા બેતરે ગયો. થોડીવારમાં ઢાણેલા ખાટલામાં અંશ પણ ઊંધી ગયો. ઠામ - વાસણથી પરવાર્યા પછી ઢાંકોઢૂંબો કરીને અજવાળી પણ અંશ પાસે ખાટલામાં આડી પડી. પણ આજે એની આંખોમાં નિંદર નહોતી. શૂન્ય મનસ્કભાવે મકાનની છત સામે તાકી રહેલી અજવાળીની નજર સામે ભૂતકાળના એ દિવસો કોઈ ચિત્રપટની જેમ સઞ્ચબન થવા લાગ્યા.

...ત્યારે અજવાળી લગ્ન પછી પહેલાં આણો અમરાપર સાસરે આવી હતી. અજવાળી હતીય શરદ પૂનમની ચાંદની જેવી. નરવાઈ અને નમણાઈ અભિયાતી રાખીને બેઠેલી અજવાળીના રૂપ જગારા મારતા હતા. નવોઢા બનીને એણે અરજણના આંગણે પગ મૂક્યો ત્યારે અરજણનું આંગણુંય હરખથી હરખાઈ ઊઠ્યું હતું. મિલનસાર અને હસમુખા સ્વભાવથી ઘર-કુટુંબ અને આખાય ફળિયામાં અજવાળી દૂધમાં સાકરની જેમ સૌની સાથે ભળી ગઈ હતી. સાસુ જીવીમાનો પડ્યો બોલ જીલી લેનારી અજવાળીને જોઈને એમના કાળજે પણ ટાઢક થઈ ગઈ હતી.

ઘરમાં સસરા તો હતા નહીં. સાસુ જીવીમાની તબિયત પણ નરમ-ગરમ રહ્યા કરતી હતી. છ-એક મહિના પછી જીવીમાની તબિયત વધારે કથળી. હવે એમનો ખોરાક પણ સાવ ઓછો થઈ ગયો હતો. અરજણ - અજવાળી ખડે પગે ઊભા રહીને એમની સેવા ચાકરી કરતા હતા. પૂનમની રાતે જીવીમાની માંદળી એકએક વધી પડી. એમણે ખાટલે બેઠેલા અરજણને ઈશારો કરીને નાના ભાઈ અરવિંદને બોલાવવા સૂચયું. સાતેક વર્ષનો અરવિંદ આવીને જીવીમાના ખાટલે સૂનમૂન થઈને ઊભો રહ્યો. ઘડીભર અરજણ અને અજવાળી સામે જોયા પછી નાના અરવિંદનો હાથ પકડીને પડ્યે ઊભેલી અજવાળીના હાથમાં મૂક્યા તૂટક તૂટક શબ્દોમાં જીવીમા બોલ્યા, ‘વઉ અજવાળી,

હ...વે... હું થો..ડા... સમય...ની મે'માન...સુ..., મા...રી... સે...લ્લી વા...ત હાંભળ!' જીવીમા બોલતા બોલતા થોડીવાર અટક્યા. એમની ઊરી ઉત્તરી ગયેલી આંખોમાં આંસુ તગતગી આવ્યા. ધીમા અવાજે એમણે કહ્યું, 'વઉ, આમ... તો... તું એની ભા...ભી સો, પ...ણ મારા મ...ર્યા પ...સી તું એની મા બન...જે. અ...ર...વિ...દને તારા... હાથમાં મૂ...કુ...સું. તું એ...ની હં...ભા...ળ રાખજે...' અને પછી તો પળવારમાં જીવીમાનો આતમરામ હરિના ધામમાં જવા નીકળી ગયો. સગી જનેતાના અવસાન પાછળ અરજણ - અજવાળી ચોધાર આંસુએ રડી પડ્યા. હિબકે ચડી ગયેલા અરવિંદને અજવાળીએ એના ખોળામાં લઈ લીધો. નાના અરવિંદના માથેથી આજે માનું છતર જતું રહ્યું હતું.

જીવીમાનું કારત પૂરું કરી અરજણ - અજવાળી કામ-ધ્યે વળજ્યા. એમની પાસે પોતાની બેડવાલાયક જમીન નહોતી એટલે ભાગે-લાગે જમીન રાખીને અરજણ ખેતી કરતો હતો. અજવાળીએ ગામની દૂધ મંડળીમાંથી લોન લઈને બે ગાયો બાંધી હતી.

જીવીમાના અવસાન પછી નાનો અરવિંદ નોંધારો પડી ન જાય એટલે અજવાળી એની ખાસ ખબર રાખતી હતી. સવારે જમાઈને સમયસર નિશાળ મોકલતી. અરજણ પડ્યેના શહેરમાં હટાણું કરવા જતો ત્યારે અજવાળી આગ્રહ કરીને અરવિંદ માટે સારા કપડાં, બુટ-મોઝાં અને એના ભણતરમાં જોઈતી વસ્તુઓ મંગાવતી. એટલું જ નહીં, ઘરના કામકાજમાંથી સમય કાઢીને અજવાળી નિશાળમાં જઈ અરવિંદને ભણાવનાર શિક્ષક - શિક્ષિકા બહેનોને મળી એના અભ્યાસ બાબતની પૂછ્યપરછ પણ કરી લેતી. રમવા ગયેલો અરવિંદ વેર આવે ત્યારે એના હાથ-પગ ધોવડાવીને જમવા બેસાડતી. પોતે પણ એની પાસે જ જમવા બેસતી. ક્યારેક ખાટલામાં સૂર્ય ગયેલા અરવિંદના વાંકડિયા વાળમાં હેતથી હાથ ફેરવતી. આમ નાના અરવિંદને અણોવાના કરી અજવાળી એને જીવીમાની ખોટ પડવા દેતી નહીં.

એકવાર ફળિયામાં કોઈના મરણ પ્રસંગે દૂરના શહેરમાં રહેતા અજવાળીના મામી અમરાપરમાં ખરખરે આવેલા. અજવાળી એમને વેર લઈ આવેલી. ચા-પાણી માટે ઓસરીમાં બેઠેલા માભીની નજર ઓસરીના બારમાની ઉપર ટીંગાતા ફોટા પર પડેલી અને એમણે પૂછી નાંખ્યુ'તું, 'અલી અજવાળી બુન, આ અમારા ભાણેજ તો ખાસ્સા મોટા થઈ ગયા છે ને?' ત્યારે મરક મરક હસતા અજવાળીએ કહેલું : 'આશા મામી, ફોટામાં મારા ખોળામાં બેઠેલા દેખાય છે એ તમારા ભાણેજ નથી.'

'એટલે?' આશા મામીએ ઉતાવળા થઈને પૂછેલું.

'મામી, મારા ખોળામાં બેઠેલા વાંકડિયા વાળ વાળા તો

મારા દિયર અરવિંદ છે.'

'એમ? તમારા દિયર અરવિંદ છે? પણ તમે બંને ચહેરે-મહોરે તો એક સરખા જ લાગો છો. તમારા બંનેની મોં કળામાં પણ જરાય ફેર નથી. અદલ જાણે તમે મા-દીકરો જ ના હોય! તો પછી અમારા ભાણેજ?'

'તમારા ભાણેજ તો જુઓ, પાછલે બારણે ઘોડિયામાં સૂતા છે.'

આશા મામીના ગયા પછી ઓસરીમાં દીવાલ પર ટીંગાતા અરવિંદ અને તમારા ફોટાને જોઈને અજવાળી મનોમન બોલી ગયેલી, 'ફોટામાં મારા ખોળામાં બેઠેલો અરવિંદ મારો જ દીકરો છે અને હું એની મા છું. એમાં જરાય ખોટું નથી.'

અને પછી તો અજવાળી ભૂતકાળના એ હિવસોમાં પહોંચી ગઈ.

તે હિવસોમાં અમરાપર ગામથી પાંચેક કિલોમીટરના અંતરે કારતક મહિનાની પૂનમે મેળો ભરાયો હતો. અમરાપરની આજુભાજુના ગામોમાં આ મેળાનું જાણું મહત્ત્વ હતું. બેદૂત, મજૂર અને સામાન્ય વર્ગના લોકો એમના કામ-ધંધા બંધ રાખીનેય આ મેળામાં જતા. નાના બાળકોને તો આ મેળાનું ખાસ આકર્ષણ રહેતું. જેતીના કામમાંથી અરજણને નવરાશ ન હોવાથી અજવાળી જાતે જ અરવિંદને લઈને મેળામાં ગયેલી. જાતજાતના રમકડાં, ગેસથી ભરેલા રંગીન કુંગા, જુદા જુદા પ્રકારની મીઠાઈ, ખંભાતની સુતરફેણી, ફેજેત ફાળકા, નાના-મોટા ચગડોળ જોઈને ખુશ થઈ ગયેલા અરવિંદ મેળામાં ફોટા પડાવવાની કામચલાઉ દુકાન આવતા, ફોટો પડાવવાની વાત કરી. અજવાળીએ અરવિંદને તેનો એકલો ફોટો પડાવવા કહ્યું પણ અરવિંદ માન્યો નહીં. એણે કહ્યું, 'ના, મારે તો તમારા ખોળામાં બેસીને જ ફોટો પડાવવો છે.' આખરે અરવિંદની જીદ આગળ અજવાળીએ નમતું જોખવું પડ્યું. તૈયાર થયેલા ફોટાને જોઈને અરવિંદ - અજવાળી ખુશ થઈ ગયેલા. મેળામાંથી વેર આવ્યા પછી અરવિંદ એ ફોટો લઈને આખાય ફળિયામાં એના દોસ્તારોને બતાવી આવેલો. ગુલાબી રંગની ડિઝાઇનવાળી સાડીમાં અજવાળી અને ખાસ મેળા માટે જ અરજણ પાસે મંગાવેલા કપડામાં વાંકડિયા વાળવાળો અરવિંદ હસુ હસુ થઈ રહ્યો હતો. આ ફોટાને જોઈને અજાજ્યા માણસો તો એમ જ માની બેસે કે - આ તો અદલ મા-દીકરો જ છે.

પાણીના વહેતા વહેણની જેમ સમય સરકતો ચાલ્યો. ઋતુચુક બદલાતા ગયા. અરવિંદ બારમા ધોરણ પછી આઈ.ટી.આઈ. કરીને તાલુકા મથકની જી.આઈ.ડી.સી.માં સારી કંપનીમાં ગોડવાઈ ગયો. અરવિંદના મન એના અજવાળી ભાભી જ સર્વેસર્વા હતા. નાની-મોટી વાતમાં હજુય એ અજવાળીને જ પૂછતો. ક્યારેક અજવાળી આવી બાબતોને લઈને અરવિંદને ટોકતી. 'હવે તો તમે મોટા થઈ ગયા છો. ભણીગણીને નોકરી

કરો છો. એટલે હવે તો મને પૂછવાનું બંધ કરો!’

સમાજમાં સારું ઠેકાણું જોઈને આરતી સાથે અરવિંદના હાથ પીળા કર્યા. અરવિંદ - આરતીની સરબે સરખી જોડી જોઈને અરજણ - અજવાળીના હૈયે હળવાશ થઈ. અજવાળી દીકરીની જેમ આરતીને સાચવતી. છ એક મહિના બધું બરાબર ચાલ્યું. પણ પછી અજવાળી ભાલી પ્રત્યેની અરવિંદની લાગણી આરતીને આંખમાં કણીની માફક ખૂંચવા લાગી. આ શું વળી? વાતવાતમાં બસ ભાભીને જ પૂછવાનું? હવે આવું કેમ ચાલે? આપણે આપણી રીતે જીવવાનું હોય! એમ કંઈ દરેક વાતમાં ભાભીને જ પૂછવાનું ન હોય. આરતીની આવી દલીલો સામે અરવિંદ એની રીતે આરતીને સમજાવવાનો પ્રયત્ન કરતો. પણ આરતી જેનું નામ! કોઈ વાતે એ સમજતી જ નહોતી. આરતીની અકળામણ હવે એના વાણી, વ્યવહાર અને વર્તનમાં પણ દેખાવા લાગી હતી. અજવાળી પ્રત્યે આરતીનું વલણ શુષ્ણ, તોછું અને વહેમીલું બની ગયું. ઘરમાં સામાન્ય બાબતે પણ ચડભડ થવા લાગી. નાના-ખોટા ઝઘડાથી અરજણ - અજવાળી મનોમન હુંખી થવા લાગ્યા.

રોજની આવી નકામી હરકતોથી કંટાળી જઈને એક સાંજે એકલા બેઠેલા અરજણને ધીમા અવાજે નાનાભાઈ અરવિંદ કહ્યું, ‘મોટાભાઈ, આપણા ઘરમાં નજીવી બાબતે કજિયા કંકાસ થયા કરે છે. આરતીના સ્વત્ત્માવથી આપણા સૌના મન ઊચા રહે છે. એટલે જો તમે હા પાડો તો અમે બંને અલગ મકાનમાં રહેવા જઈએ. અમે અલગ રહેવા જઈશું તો તમારું અને ભાભી-માનું સ્વત્ત્માન જળવાશે અને રોજની માથાકૂટમાંથી છુટકારો મળી જશે.’

અરવિંદની અલગ રહેવાની વાત સાંભળીને અરજણની આંખની પાંપણો ભીની થઈ ગઈ. આમ છતાંય એણે મન મક્કમ કરીને કહ્યું, ‘અરવિંદ, તારી વાત બરાબર છે. તમે બંને શાંતિથી રહેશો એટલે અમારા મનમાં પણ બીજો કોઈ ઉચાટ રહેશે નહીં. આ ઘરમાંથી તમારે જે જે વસ્તુઓ જોઈતી હોય તે લઈ જાઓ. ખૂટટી વસ્તુઓ બે દિવસ પછી લાવી દઈશ.’

ચૈત્ર વદ નોમની આજની મધ્યરાત દબે પગે વહી રહી હતી. જીવમાત્ર નિંદર દેવીના ખોળે નંચિત થઈને પોઢી ગયા હતા. પણ આજે અંતરના અજંપાએ અજવાળીની આંખમાંથી ઊંઘ ગાયબ કરી દીધી હતી. રજકામાં પાણી વાળવા એતરે ગયેલો અરજણ ઘેર આવ્યો ત્યારે હુસેનચાચાના કૂકડાએ કૂકડે... કૂ...કની બાંગ પોકારી હતી. અજવાળીને જાગતી જોઈને અરજણે પૂછી નાખ્યું, ‘અજવાળી, આટલી વહેલી કેમ જાગી ગઈ?’

‘ના, અરજણ, આજે રાતે હજુ સુધી મને ઊંઘ આવી જ નથી. અરજણ, સાચ્યે જ અરવિંદ અને આરતી આપણાથી અલગ રહેવા જશે?’

‘ઉંમરલાયક નાનો ભાઈ એના ભાઈ-ભાભીથી અલગ

રહેવા જાય એ કંઈ અજુગતું ન કહેવાય.’

‘પ...ણ...’

‘બસ હવે એવા ખોટા વિચારોને મનમાં લાવીને નકામી હુંખી ના થઈશ. ગઈ પૂનમની રાતે હું ભજન મંડળમાં ગયો ત્યારે ભગતકાકાએ કહ્યું હતું : આમરે તો આપણે સૌ પરલબના ભાકી રહી ગયેલા કોઈ અણાનુંબંધના કારણે જ માનવ જીવનમાં એકબીજાને મળીએ છીએ. પતિ-પત્ની, મા-બાપ, પિતા-પુત્ર, ભાઈ-ભાભી, પુત્ર-પુત્રી આ બધાય બસ કોઈને કોઈ ઋણાનુંબંધથી જ જોડાયેલા છીએ. આવા લેણદેણના સંબંધો પૂરા થતા જ એકમેકથી અલગ થઈ જઈએ છીએ. માનવ જીવનમાં આવા ઋણાનુંબંધનું આગમન એકદમ આકસ્મિક હોય છે. તો એની વિદાય પણ એટલી જ અણધારી હોય છે. એટલે આવી વાતોનો હરબ-શોક કરવાનો ન હોય. સમય સમયનું કામ કર્યે જાય છે. આવા સમયે આપણે આપણા હૈયાને સાબૂત રાખવું પડે. ભાકી તારી જેમ મારું અંતર પણ ફાટી પડે છે. ગળગળા થઈને અરજણે કહ્યું.

સવારે દસેક વાગે અરવિંદ અને આરતીએ એમને જોઈતી ઘરવખરીનો સામાન આંગણામાં લાવીને મૂક્યો. અરજણ - અજવાળી ઓસરીની બહાર એક બાજુએ ઉદાસ મનથી બેઢા હતા. આરતીના હૈયે આજે એદકેરો આનંદ હતો. એના મનમાં થતું હતું : બસ, હવે અમે અલગ રહીશું એટલે અમને ફાવે એટલી સ્વતંત્રતા મળી જશે. અને પછી તો અમારે અમારી રીતે જ જીવવાનું ને?

અરવિંદ ઓસરીની દીવાલ પર મૂકેલો ભાભીમાં સાથેનો ફોટો ધીમેથી ઉતારીને અરજણ - અજવાળી પાસે જઈને કહ્યું, ‘મોટાભાઈ અને ભાભી-મા, આ ફોટાને હું મારી સાથે લઈ જવા માગું છું. લઈ જાઉં? અજવાળીએ અશ્વુભીની આંખે હકારમાં માથુનમાંથી. એવામાં જડપથી આવીને આરતીએ અરવિંદના હાથમાંથી ફોટો લુંટવી લીધો. ‘કોઈપણ હિસાબે મારે આ ફોટો જોઈતો નથી. આ ફોટાએ જ બધી રામાયણ સર્જી છે.’ એમ બોલીને આરતીએ જોરથી આર.સી.સી.ના રસ્તા ઉપર ફોટાનો ઘા કર્યો. ફોટાની ફેમનો કાચ તૂટી ગયો અને એની કરચો રસ્તામાં વેરવિભેર થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલા પળવારમાં જ આવું બની ગયું. સૌ સત્ય થઈ ગયા. ફળિયાના માણસો પણ ભેગા થઈ ગયા. અરવિંદ દોડીને ભાભી-મા પાસે પહોંચી ગયો. એમના ખલે માથુન મૂકીને એ ચોધાર આંસુએ રડી પડ્યો. રડતા અરવિંદના માથે હાથ ફેરવીને અને સાંત્વન આપી અજવાળી ઊભી થઈને રસ્તા પરની કાચ્યા વીજાવા લાગી. આંસુભરી આંખે ટૂટેલા ફોટાને છાતી સરસો દબાવીને ઉભેલા અરવિંદે કહ્યું, ‘આરતી, થોડા સમયમાં જ આપણી છૂટાછેણીની ફાઈલ તૈયાર થઈ જશે. હું તારી તમામ શરતોને સ્વિકારીને પણ તારાથી છુટો થવા માગું છું. આજ સુધી તારી ખોટી હરકતોને ય મેં સહન

કરી લીધી હતી, પણ હવે નહીં! કારડાકે આજે તે તમામ મર્યાદાઓની લક્ષ્મણ રેખા ઓળંગી નાખી છે. મારી હાજરીમાં તે દેવ જેવા મારા મોટાભાઈ અને ભાબી-મા નું અપમાન કર્યું છે, જે કોઈપણ સંજોગોમાં હું સહન કરી શકું તેમ નથી....'

‘અરવિંદભાઈ, બસ હવે તમે....’

‘ના, ભાબી-મા, આજે તો મને કહેવા દો. આરતી, મારી માના અવસાન પછી મોટાભાઈ માથે તો ઘરની જવાબદારી હતી. આવા સમયે હું નોંધારો પડી ન જાઉ એટલે અજવાળી ભાત્પી મારા ભાબી મટીને મારી મા બની ગયા! મારી જેટલી સારસંભાળ અને કાળજુ ભાબી-મા એ રાખી છે એટલી તો એમના પેટના જણાની ય રાખી નથી. જે વાતનો હું પોતે સાક્ષી છું. આજે હું જે કંઈ છું એ મારા ભાબી-મા ના કારણે જ છું. આવા પરગજુ અને પરોપકારી ભાબી-મા ના આશીર્વાદ લેવાને બદલે તેં તો એમની સાથે બાખડી બાંધી? આરતી, મારા ભાબી અને દીકરાના પવિત્ર સંબંધની સાચી પરખ કરતાં જ તને આવક્યું નહીં.’

‘અરવિંદભાઈ, હવે તમે આરતીને એક શર્ષ પણ કહેશો નહીં. આજે જે કંઈ બન્યું એમાં આરતીનો દોષ નથી. કંઈક દોષ હોય તો એની સમજણનો છે. કયારેક સાચી વાત પણ એનો ચોગ્ય સમય આવે ત્યારે જ સમજાય છે. હા, પરિવારનો માળો વિખરાય ત્યારે એ પરિવારનું અજવાંજું ઓછું થઈ જાય છે. આરતીના મનમાં સમજણનો સૂરજ ઉગશે ત્યારે એના પાવનકારી પ્રકાશમાં એના મનમાં રહેલા શંકા-

જેના પ્રેમને કોઈ પાનખર ન નકે તે..... મા

(અનુસંધાન : પાના નં. - ૩૪ ઉપરથી ચાલુ)

માત્ર ૧૮ વર્ષની વયે જ ઈશુની સેવિકા બનવાનો નિર્ધાર કરેલ. દીન-હૃદ્ભીઓની સેવા કરવાના કાર્યમાં જોડાઈને સમસ્ત દુનિયાના ‘મા’ બની ગયા. મા હોવું એટલે દેશના ભાવિના ઘદયેયા હોવું. બાળઉછેર એ એક લાંબી પ્રક્રિયા છે. માતાએ સંતાન માટે જીવન સોંપવું પડે છે. જો શિવાજી, વિવેકાનંદ કે ગાંધીજી, કલામ જેવા સંતાન બનાવવા હોય તો જુઝાબાઈ અને પૂતળીબાઈ જેવી માતાઓ જોઈશે. બાળકને દુનિયામાં લાવતા પહેલા જ તેની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર થવું પડે. બાળક મા ના ઉદ્દરમાંથી સંસ્કાર મેળવવાનું શરૂ કરે છે. માટે ગર્ભવસ્થાના સમયથી જ ખાન-પાન સાથે સારા પુસ્તકોનું વાંચન તેમજ ધર્મગ્રંથનું વાંચન જરૂરી છે. જેના આચાર, આહાર અને વિચારની અસર આવનાર બાળક પર પડે. મા ની જવાબદારી તેનામાં પ્રામાણિકતા, નિષા, સેવાભાવ જેવા અનેક ગુણોનું સિંચન કરી એક સંસ્કારી વ્યક્તિ તરીકે દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરવાની છે. માટે જ તો કહેવાય છે કે સો શિક્ષક બરાબર એક માતા.

કુંશકાના તમામ વહેમિલા વાટળો આપોઆપ અદૃશ્ય થઈ જશે અને સાચી વાત એને સમજજર્ઝ જશે. તમે થોડી ધીરજ રાખો અને આરતીને માફ કરો.’

આખાય ફળિયામાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. થોડીવાર પછી આરતી ધીમા પગલે અજવાળી પાસે ગઈ અને આંખમાં તગતગતા આંસુ સાથે એ અજવાળાને પગે પડી ગઈ. રડતા રડતા એણે કહ્યું, ‘ભાભી-મા, મને માફ કરો. હું તમને સૌને ઓળખવામાં ઉણી ઉતરી. બધીય ભૂલ તો મારી જ છે, જેનો હું સ્વીકાર કરું છું. મારા કારણે જ એક હર્યુભર્યુ કુટુંબ વિભરાઈ જવાનું હતું. મારી જ અણસમજના કારણે હું ભાભી-મા અને દીકરાના પવિત્ર સંબંધની પરખ ના કરી શકી. આપણે સૌ એક જ પરિવારમાં સાથે રહીશું. હું મોટાભાઈ તથા અરવિંદની પણ માફી માગું છું.’

અજવાળી ઊભી થઈને આરતીને બેટી પડી. એનો હાથ
પોતાના હાથમાં લઈને અજવાળી બોલી, ‘આરતી, તું તો અમારી
દીકરી છો. આપણે સૌ સમયની કસોટીની મેરણ પર ખરા ઉત્ત્યા
છીએ. હાલક-હોલક થતી આપણા સૌની જીવનનૌકા હેમખેમ
કિનારે પહોંચ્યો છે. સૌ સારા વાના થયા છે. એટલે ચાલો, આપણે
બને રસોડામાં જઈને લાપસીના આંધણ મુકીએ.’


ફળિયાના એકઠા થયેલા લોકો પણ આવા સુખદ
સમાધાનથી રાજુ થઈ વિભરાયા.

૩/૨૮, ઇન્ડ્રપ્રસ્થ સોસાયટી, મુ. કલિક્કં,
તા. ઘોળકા, જી. અમદાવાદ.
મો. ૧૦૦૦૦ ૪૧૨૪૦

પાનના ગલ્યે સિગારેટના કસ લેતા કે મોઢામાં તમાકુભરેલા માંદીયલ યુવાનોને જોઈને દુઃખ થાય. કોઈ નિઃસહાય યુવતી પર અત્યાચાર, છેડતી, બળાત્કાર કરતા યુવાનો, પ્રગતિ સાધવા ટૂંકા રસ્તા અપનાવતા યુવક-યુવતીઓ, ભષાચાર, દાશચોરી અને અપ્રામાણિકતાથી કમાણી કરતા લોકો પોતાની મા ની કુખ્યને લજવી રહ્યા છે. અહીં એક પ્રશ્ન સહજ થાય કે માતાએ શું આ સંતાનોનું ધ્યાન રાખી તેની કેળવણી કરવામાં ઉશ્રાપ રાખી દીધી હશે કે અતિ લાડકોડમાં તેની બાળપદ્ધતિ જ નાની નાની ભૂલોને સુધારવાના પ્રયત્નો નહીં કર્યું હોય?

વર્ષે એક જ વાર ‘મહર્સ તે’ની ભેટ સોગાદો આપી દઈને ઉજવવાનો ન હોય. આજીવન તેનું નામ રોશન રહે, તેણીની લાગડીઓને ડેસ ન પહોંચે તેવા કાર્યોની ભેટ તેના ચરણો ધરવાની તૈયારી દરેક સંતાને રાખવી જોઈએ. પછી ભવે તે સંતાન ૧૦ વર્ષનું હોય કે પચાસ વર્ષનું. માતાનું ઝાણ ચૂકવી શકતં નથી પરંતુ આવી ભેટ તો ચોક્કસ આપી જ શકીએ.

“નીતિયમ”, સંકાર નગર મેળન રોડ, મહિલા કોલેજ પાછળ,
એસ.બી.એસ. સોસાયટી, ગાજુકોટ. મો. ૦૭૫૮૫ ૦૨૧૫૦



જીવન નાવ

“સાસુ – વહુ” એક કટુ પણ અનિવાર્ય સંબંધ



દિનેશ ઓન. વૈશનવ

આ લેખની વિગત લગભગ બધા કુટુંબોને લાગુ પડે છે અને એટલે જ કોઈ પણને જણાશે કે આ બધું તો મારા કુટુંબને લાગુ પડે છે. કારણકે સાંપ્રદાય સમયમાં ૮૮% પરિવારમાં સાસુ-વહુના સંબંધો એટલા કડવાશભર્યા અને દુઃખદ હોય છે કે સૌને આ પોતાના ઘરનો જ પ્રશ્ન હોય એમ લાગે છે.

પુત્રના લગ્ન પહેલા માતા-પિતાને પુત્રના લગ્નનો બહુ જ ઉમંગ હોય છે પરંતુ પુત્રના લગ્નનાં થોડા જ સમયમાં પરિવર્તન આવવા લાગે છે. એક નાની અમસ્તી વાતમાં સાસુ-વહુ વચ્ચે થોડી કડવાશ ઉત્પન્ન થાય છે, તે સમય જતાં વધતી જ જાય છે. જેમાં અહું મુખ્ય ભાગ ભજવે છે.

સાસુ જ્યારે વહુને કોઈ ભૂલ બાબતે ઠપકો આપે છે ત્યારે વહુને આ વસ્તુ જરા પણ ગમતી નથી. કારણકે તે જ્યાં સુધી પોતાનો અહું ન છોડે ત્યાં સુધી સાસુને પોતાના સમજી શકતી નથી. જો તે સાસુને પોતાના સમજી શકે તો તેને જ્યાલ આવશે કે પોતાના પીયરમાં ક્યારેક તેની માતાએ તેને આના કરતાં પણ વહુ ઠપકો આપ્યો હશે. પણ તેણીએ આ ઠપકો સાંભળી લીધો હશે કારણકે એ ઠપકો તેની માતાએ આપેલ હતો. સ્વજને આપેલ ઠપકાનું એટલું બધું લાગી આવતું નથી અને તે આપણે જતું કરતા હોઈએ છીએ. એ જ રીતે સાસુને પણ પોતાની દીકરીએ આનાથી પણ મોટી ભૂલ કરી હોય તો પણ એટલી બધી ખટકતી નથી અને તે આવી ભૂલ માફ કરવા તૈયાર પણ હોય છે. આમ ‘માતા જેવું હોવું અને માતા હોવું’ માં જેમ ફરક છે, તેમ ‘પુત્રી જેવી અને પુત્રી’માં પણ એટલો જ ફરક છે. કુટુંબ જીવનની આ મોટી કમનસીબી છે કે પુત્રવધૂ પોતાની સાસુને માતા તો નહીં પણ માતા સમાન પણ માની શકતી નથી અને સાસુ પોતાની પુત્રવધૂને પુત્રી તો નહીં પણ પુત્રી સમાન સમજી શકતી નથી. અને તેથી જ તે પુત્રવધૂની સાથે જ પોતાના વહાલસોયા પુત્રને પણ ક્યારેય અન્યાય કરી બેસે છે.

પુત્રને ખબર પણ હોતી નથી કે માતા દ્વારા પુત્ર તથા પુત્રવધૂના દરેક વ્યવહારની નોંધ લેવાતી હોય છે અને પુત્રવધૂ દ્વારા માતા-પુત્રના દરેક વ્યવહારની નોંધ લેવાતી હોય છે. પુત્ર માટે તો માતા પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ હોય છે જેટલો પોતાની પત્ની પ્રત્યે હોય છે. પરંતુ તેની મુશ્કેલી એ છે કે માતાનો આગ્રહ

હોય છે કે હું કહું તે પુત્ર સાંભળે અને પત્ની ઈચ્છે છે કે હું કહું તે પત્તિ સાંભળે. આમ, સાસુ-વહુના ધર્મજીમાં પુત્રની દશા કર્ણોડી થઈ જાય છે. તે નથી માતાનો પક્ષ લઈ શકતો, કે નથી પત્નીનો પક્ષ લઈ શકતો.

સાસુએ પોતાની પુત્રવધૂને થોડી સ્વતંત્રતા પણ આપવી જોઈએ. જે ઘરમાં વહુ આવી હોય તે ઘર તો સાસુનું જ હોય છે. છતાં પુત્ર-પુત્રવધૂના સુખ માટે પોતાની પુત્રવધૂને થોડોઘણો અધિકાર પણ આપવો જોઈએ. કારણકે તે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, સગાવહાલાનો સંગાથ છોડી તમારા પુત્ર તથા સમગ્ર કુટુંબને પોતાના કરવા માટે તમારા ઘરમાં આવી છે અને તમે પણ તેને ઘણા ઉમંગથી તમારા ઘરમાં લાવ્યા છો. સાસુને પણ યાદ હશે કે તેઓ જ્યારે પરણીને સાસરે આવ્યા હતા ત્યારે તેમને પણ સાસરામાં કેવા કેવા અનુભવ થયા હતા. તેમના સમયમાં અને અત્યારના સમયના તેઓ સાક્ષી છે કે તે સમય કરતાં અત્યારે સમય કેટલો બદલાઈ ગયો છે. તો તેમણે જૂના સમયમાં ભોગવેલ તકલીફોને યાદ કરી, પુત્રવધૂ પ્રત્યે થોડું જતું કરવાની ભાવના, લાગણી રાખવી જોઈએ અને પોતાને પડેલી મુશ્કેલી પુત્રવધૂને ન પડે તેવો ગ્રયાસ કરવો જોઈએ.

આ બધી મુશ્કેલીઓના સમયે પુત્ર પોતાની માતા અને પત્ની વચ્ચે સમાધાનનો એક સેતુ રચવાની સતત કોશિશ કરે છે. પુત્રએ સતત એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે પોતાની માતા તથા પત્ની વચ્ચે કોઈ પણ વાતમાં ધર્મજી ન થાય. દા.ત. પત્નીથી કાંઈ ભૂલ થાય તો તે પોતાની પત્નીનું ધ્યાન દોરી તેની ભૂલ સુધારવા સમજાવી શકે છે અને પત્નીને પણ પોતાના પત્તિ દ્વારા કહેવાતી વાતનું એટલું માટું નથી લાગતું. તે પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરે છે પણ આ વાત જે સાસુ દ્વારા કહેવામાં આવે તો તેનું પરિણામ ઉલટું જ આવે છે.

પુત્રવધૂએ સાસરામાં સૌને અનુકૂળ થઈને રહેવું પડે છે. પોતાના પિયરમાં જે રીતે રહેવા ટેવાયેલ હોય તે ટેવો ભૂલી પોતાના વર્તનમાં ફેરફાર કરવો પડે છે. તેણે એ પણ વિચારવું જોઈએ કે સાસુને અનુકૂળ થઈને કેવી રીતે રહેવું. છતાં જો પુત્રવધૂને સાસરીયામાં ન ફાવે તો દરરોજના કલેશ અને કુટુંબ કલાહ કરતાં અલગ થવું એ જ અંતિમ ઉપાય છે. કુટુંબથી અલગ

રહેવા જવાનો પ્રશ્ન આવે ત્યારે પુત્રની સ્થિતિ ઘણી કફોડી થાય છે. તે પોતાના માતા-પિતા પ્રત્યેના પ્રેમ અને ફરજના કારણે તેમનાથી અલગ રહેવાનું વિચારી શકતો નથી અને પત્નીના મનના સમાધાન માટે માતા-પિતાથી અલગ રહેવા જાય છે. પણ અલગ થવાથી માતા-પિતા કે પોતાના કુટુંબ સાથેનો સંબંધ પૂરો થઈ જતો નથી. વાર-તહેવારે, અવારનવાર માતા-પિતાને ત્યાં જતા રહેવું જરૂરી છે. તેઓ પણ સાથે રહેતા પુત્ર-પુત્રવધૂને કારણે દરરોજના કંકાસથી સંબંધોમાં આવેલી કડવાશ કરતા પુત્રના અલગ રહેવાથી રાજી હોય છે. આ રીતે, સંબંધોમાં સરળતા જળવાઈ રહે છે.

દરેક પુરુષે લગ્ન પહેલાં સ્વનિર્ભર થઈ જવું જરૂરી છે. માતા-પિતાની છત્રછાયામાં તેને ઘરની કંઈ ચિંતા હોતી નથી પરંતુ તમે વિચારો કે કદાચ માતા-પિતાથી અલગ રહેવાનું મન થાય તો શું તે પોતાનું તથા પત્નીનું ભરણ-પોષણ કરી શકે તેમ છે? ભવિષ્યમાં થનારા બાળકો સાથે પોતાના કુટુંબનું શું? તેના માટે તેની તૈયારી છે? જ્યારે કોઈ પણ પુરુષને પોતાના ઘર તથા કુટુંબથી દૂર અલગ રહેવાનું થાય છે ત્યારે તે ઘણો જ એકલો પડી જાય છે. આવા સંજોગોમાં તેણે પોતાના સ્વભાવને અનુકૂળ એવા સજજન માણસોના કુટુંબ સાથે સંબંધો કેળવવા પડે છે. સંબંધો કેળવતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. કારણકે

લઘુકથા : કોળિયા

- જન્મના દેસાઈ 'દ્વારા'

વિનય અકળાઈ જતો હતો. તેની મા માંદી પડી હતી. હા, આમ તો ઉમર ૭૫ વર્ષથી થોડીક મોટી ખરી. મા માંદી પડી. કંઈ ખાય નહીં. વિનયને ચિંતા થાય કે મા નહીં ખાય તો વધુ માંદી પડશે.


હવે પોતાના સ્ટેટ્સ મુજબ મોટા મોટા ડોક્ટરોની ફોજ ઘરમાં માને ખાતી કરવા ઊભી કરી. તે સહુને કહેતો, માને ખાતી કરો, માને ખાતી કરો, નહીં તો મરી જશે. માને ખાતી કરો, માને ખાતી કરો.... એ રીતે પડતો. એને એવી દવા આપો કે ખાતી થાય. એ કરગરતો. એને મા વિશેષ વહાલી હતી.

એવામાં વિનયને લાગ્યું કે માની પાસે કોઈ આખો દિવસ બેસે. માને ખાવા કહે, વાતચીત કરે તો માને ગમે. પરંતુ ઘરમાં સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. એટલે કોણ આમ બેસી શકે?

વિનય આ વિશે વિચારતો હતો ત્યાં તેને તેના કાકી યાદ આવ્યા. કાકી તેની મા કરતા મોટા. એ ગામડે એકલા રહેતા હતા. સુખી હતા. વિનયને થયું કે કાકીને અહીં મા પાસે બોલાવી

જેમ સમાજમાં બધા માણસો ખરાબ નથી હોતા તેમ બધા માણસો સારા પણ નથી હોતા. એટલે સમજી વિચારી સંબંધોમાં આગળ વધવું પડે છે. પરંતુ એકવાર આવા સજજન માણસના કુટુંબ સાથે સંબંધ બંધાઈ ગયા પછી તેમના ઘર આવવા જવાથી મન આનંદમાં રહે છે અને કુટુંબ - પરિવારથી દૂર રહેવાનું દુઃખ પણ ઓછું થાય છે.

"આકૃતિ", વિદ્યાનગર સોસાયટી, ટ્લોક નં.-૩૨,
ટોનિયાવાડી, જૂનાગઢ. • મો. ૯૮૭૭૨ ૬૬૪૮૨



લાવું તો માને મજા આવશે અને કાકીને પણ મજા આવશે. બંને આનંદથી રહેશે અને માને ખાતી પણ કરશે.

આ વિચારે, એક દિવસ વિનયની વૈભવી કાર તેની કાકીને ઘેર ગામડે પહોંચ્યો. વિનયે કાકીને ઘરની તેલી ખખડાવી.

બારણું ખૂલ્યું અને વિનયને નિહાળીને કાકી આનંદ અને અચંબામાં પડી ગયા. 'ઓહ વિનુ, અરે, આવ... આવ... બધું સારું છે ને ઘરે?' વિનુ ખાંટ ઉપર બેઠો અને મૂળ વાતની શરૂઆત કરી. 'કાકી, માને ઠીક રહેતું નથી. કંઈ ખાતી નથી. હું કહી કહી થાકી ગયો. મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું પણ ખાતી નથી. હું મુંજાઈ ગયો. એ નહીં ખાય તો વધુ માંદી પડશે. તમે આવો અને એને સમજાવો. એને કંપની આપો, વાતચીત કરો અને ખાતી કરો... માને ખાતી કરો... ખાતી કરો...' આંખો ભીની થઈ. કાકી ટહુકી ઉઠ્યા, 'અરે, મુંજાઈ શું ગયો? ચાલ, મારે ક્યાં ધરાર ઉલાણ છે. ચાલ, મારું પોટલું બાંધી લઉ.' અને કાકી વિનય સાથે નીકળી પડ્યા.

વિનય અને તેની કાકી વિનયના ઘેર પહોંચ્યા. વિનયની મા કાકીને જોઈને સત્ય થઈ ગયા. સાથે આનંદમાં આવી ગયા કારણકે વિનયે કાકીને બોલાવી લાવવાની વાત કોઈને કરી નહોતી. વિનયે મીઠી ફરિયાદ કરી, જુઓને, મા કેટલાય

દિવસોથી કંઈ ખાતી નથી. કેટલીય દવા કરી, મોઢામાં એક કોળિયોય મૂક્યો નથી.

આ સાંભળી કાકી ટહુકો કરતા કહેવા લાગ્યા, ‘તારી મા ક્યાંથી મોઢામાં કોળિયો મૂકે? તું નાનકડો હતો ત્યારે તું પણ ક્યાં મોઢામાં કોળિયો મૂકતો હતો. આ તારી મા કોળિયો હાથમાં લઈને તારા મોઢામાં મૂકવા તારી પાછળ પાછળ દોડતી તને ફોસલાવતી. કાગડો, બિલાડી બતાવતી, રાજરાણીની વાતો કરતી અને છેવટે એમ કરતાં કરતાં પોતાના ખોળામાં તને બેસાડીને કોળિયા તારા મોઢામાં મૂકતી, ત્યારે તું ખાતો. તો હવે આજે તારો વારો છે. તેં કદી એને તેના મોઢામાં કોળિયા મૂક્યા? તેં એને સમજાવી, કે નહીં ખાય તો માંદી પડશે? એ બિચારી દોડી શકશે નહીં પણ તું એના મોઢામાં કોળિયા મૂક. પછી જો, તારી મા ખાય છે કે નહીં. બસ, આજે હવે તારો વારો છે. જો તારી મા પછી ખાય છે કે નહીં તે મને કહેજે.’ આ સાંભળી વિનય કાકીના મુખ સામે જોઈ રહ્યો. પોતાના ચહેરા ઉપર અવનવા પ્રેમભાવ ઉભરી આવ્યા. એ ગદગદ થયો અને પોતાના અતિ કિંમતી સુટ્ટની પરવા કર્યા વિના પલાંઠી વાળીને બેસી ગયો અને માનું માણું પોતાના ખોળામાં લઈને તેના માથા, કપાળ ઉપર હેતથી હાથ ફેરવતાં ગળગળો થઈને કહેવા લાગ્યો, ‘મા, લે કોળિયા ખા... મા કોળિયા ખા... માએ વિનય સામે જોયું. એ મલકી અને એ કોળિયા ખાવા માંડી અને અમણે વિનયનો હાથ પકડી લીધો. વિનયના નયનો ભીના થયા. એ કાકી સામે અહોભાવે જોઈ રહ્યો. આ માયાળું, અદ્ભુત દ્રશ્ય સૌ નિહાળી રહ્યા.

રાજકોટ

મો. ૯૮૨૮૩ ૮૮૮૧૨

નોંધ કથાઓ

— હસમુખ રામદેપુન્ના, શિક્ષકશ્રી

ઇનામ

એક રાજાએ પોતાની પ્રજા કેવી છે તે જોવા માટે રસ્તામાં એક મોટો પથર મૂકીને તેઓ એક જાડ પાછળ ધૂપાઈ ગયા.

રસ્તા પરથી ઘણા લોકો પસાર થયા. તેઓ ગુસ્સે થઈ આગળ વધતાં, તો કોઈ વળી રસ્તામાં પથર મૂકનાર વ્યક્તિને ખરાબ શબ્દો સંભળાવી આગળ ચાલ્યા જતા. રસ્તા વચ્ચેના પથરને ઉપાડીને કોઈ તેને એક બાજુ મૂકવાનો પ્રયત્ન પણ કરતા નહીં. પથર મૂકનારનો વાંક કાઢી આગળ ચાલ્યા જતા.

થોડા સમય પછી એક બેદૂત પોતાના માથા પર વજન ઉંચકી તે રસ્તા પરથી પસાર થયો. તેણે જોયું તો રસ્તા વચ્ચે મોટો પથર પડ્યો છે.

તે બેદૂતે તરત જ પોતાના માથા ઉપરથી વજન નીચે મૂકીને પથરને રસ્તા વચ્ચેથી લઈ એક બાજુ મૂક્યો. પથર નીચેથી તે બેદૂતને એક થેલી મળી. તેમાં કેટલુંક ધન હતું. સાથે એક ચિંહી હતી. બેદૂતે ચિંહી વાંચી તો તેમાં લખ્યું હતું : “પથર ઉઠાવનારને રાજી તરફથી આ ધનનું ઈનામ...”

બેદૂત પોતાનું ઈનામ લઈ ચાલતો થયો.

રસ્તામાં જે મુશ્કેલી આવે છે તે આપણને પ્રગતિ, સફળતાના રસ્તા પર લઈ જાય છે.

સોનાનો હાર

એક નગર હતું. તેમાં એક સમયે નગરના રાજીની રાણી પોતાની દાસીઓ સાથે નદીએ સ્નાન કરવા ગઈ.

રાણી, પોતાનો કિંમતી સોનાનો હાર કાઢીને નદી ડિનારે એક પથર પર મૂકીને નદીમાં નાહવાનો આનંદ લઈ રહી હતી ત્યારે એક પક્ષીએ આવી તે સોનાના હારને પોતાની ચાંચમાં ઉપાડી, ઉડવા લાગ્યું. થોડીવારમાં તે પક્ષી અદશ્ય થઈ ગયું.

રાણીએ રાજીને જઈને કહ્યું કે એક પક્ષી મારો હાર લઈ ઉડી ગયું છે.

રાજીએ સૈનિકોને હારની તપાસ કરવા નદી ડિનારે મોકલ્યા. થોડે દૂર જઈને જોયું તો નદીના પાણીમાં હાર દેખાતો હતો. સૈનિકો નદીમાં કૂદી પડ્યા. પરંતુ હાર હાથમાં આવ્યો નહીં.

ત્યાંથી એક સંત પસાર થતા હતા. તેણે વિગત જાણી. સંતે આસપાસ જોયું. નદી ડિનારાના મોટા જાડ તરફ જોયું. થોડીવાર પછી સંત હસવા લાગ્યા.

સૈનિકોએ હસવાનું કારણ પૂછ્યું : ‘સંત મહાત્માજી, હસવું કેમ આવે છે?’

સંતે કહ્યું : ‘તમે જાડની ઉપર જોયું? જાડની ડાળીએ એ સોનાનો હાર લટકે! તમે પાણીમાં જે જુઓ છો, એ તો એનો પડછાયો છે.’

એક સૈનિકે જાડ પર ચડી, ડાળીએ લટકતા સોનાના હારને લઈ રાજીને આપ્યો. રાજીએ તે હાર રાણીને આપ્યો. રાણી ખુશ થઈ ગઈ.

સુખ, શાંતિ અને આનંદરૂપી સોનાના હારને મેળવવા માટે આપણે બહારની દુનિયામાં શોધીએ છીએ, વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ પરંતુ તે આપણા શરીરની અંદરથી જ પ્રામ થાય છે.

‘અવધ’, ન્યુ કેદારનાય સોસાગ્રી, કોઠારિયા રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૨.

મો. ૯૮૭૮૪ ૮૫૬૬૭

SOME GOLDEN THOUGHTS....

"Travelling is changing your opinions and your prejudices."

"People who never make mistakes are those who do nothing."

"The more actively you pursue ideas as they arise, the more you encourage your subconscious mind to throw up more good ideas in the future."

"Consider the postage stamp: its usefulness consists in the ability to stick to one thing till it gets there."

"Wherever we look upon this earth, the opportunities take shape within the problems."

"Nothing worthwhile is ever achieved without deep thought and hard work."

"The only true pleasure is the pleasure of creative activity."

"Human beings are at their best when the challenge of life encourages the use of their physical and mental faculties."

"Even after the greatest defeats, the depressing thought of being a failure is best combated by taking stock of all your past achievements."

"Put purpose in your life. Take the tools at hand and carve your own best life."

"Leadership – is acting when you see the need, without waiting for someone else to suggest it."

"Success occurs when opportunity meets preparation."

Presentation : Dinesh R. Mehta

PUNCTUALITY

A Gujarati Company Owner was asked a Question : "How do you motivate your employees to be so much Punctual?"

He smiled and replied : "It's simple. I have 30 employees and 29 free parking spaces & 1 is PAID parking!"

મહત્વની માહિતી

વિશ્વનો અલભ્ય ગણાતરી ચંગ્ર

(ગતાંકથી ચાલુ)

- સાત છંદ : ગાયત્રી, ઉષ્ણિક, અનુષૃપ, વૃથતી, પંક્તિ, ત્રિષૃપ, જગતી.
- સાત સ્વર : સા, રૈ, ગ, મ, પ, ધ, નિ.
- સાત સૂર : ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈરત, નિખાદ.
- સાત ચક્ર : સહસ્રાર, આજ્ઞા, વિશુદ્ધ, અનાહત, મહિપુર, સ્વાવિજાન, મૂલાધાર.
- સાત વાર : રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ.
- સાત માટી : ગૌશાળા, ઘુડસાલ, હાથીસાલ, રાજદ્વાર, બાબ્ધીની માટી, નદી સંગમ, તળાવ.
- સાત મહાદ્વિપ : જંબુદ્વિપ (એશિયા), પ્લક્ષદ્વિપ, શાલ્મલીદ્વિપ, કુશદ્વિપ, કૌંચદ્વિપ, શાકદ્વિપ, પુજ્જરદ્વિપ.
- સાત ઋષિ : વશીષ, વિશ્વામિત્ર, કષ્ટ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ, શૌનક.
- સાત ઋષિ : વશીષ, કષ્યપ, અત્રિ, જમદારિન, ગૌતમ, વિશ્વામિત્ર, ભારદ્વાજ.
- સાત ધાતુ (શારીરિક) : રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા, વીર્ય.
- સાત રંગ : રીંગણી, જંબુડી, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ.
- સાત પાતાળ : અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ.
- સાત પૂરી : મથુરા, હરિદ્વાર, કાશી, અયોધ્યા, ઉજ્જ્વેન, દ્વારકા, કાંચી.
- સાત ધાન્ય : અડં, ધઉં, ચણા, ચોખા, જવ, મગ, બાજરી.

- આઠ માતૃકા : બ્રાહ્મી, વૈષ્ણવી, મહેશરી, કૌમારી, અન્ની, વારાહી, નારસિંહી, ચામુંડા.
- આઠ લક્ષ્મી : આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વીરલક્ષ્મી, વિજય લક્ષ્મી, વિદ્યાલક્ષ્મી.
- આઠ વસુ : અપ (અહઃ/અયજ), ધ્રુવ, સોમ, ધર, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાસ.
- આઠ સિદ્ધિ : અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રામિ, પ્રાકાભ્ય, ઈશિત્વ, વશિત્વ.
- આઠ ધાતુ : સોના, ચાંદી, તાંબુ, સીસુ, જસત, ટીન, લોંડ, પારો.
- નવ દુર્ગા : શૈલપુરી, બ્રહ્મચારીણી, ચંદ્રધરા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી.
- નવ ગ્રહ : સૂર્ય, ચંદ્રમા, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ.
- નવરત્ન : હીરા, પચા, મોતી, માણેક, મૂંગા, પુખરાજ, નીલમ, ગોમેદ, લહસુનિયા.
- નવ નિધિ : પદ્મનિધિ, મહાપદ્મનિધિ, નીલનિધિ, મુહુંદનિધિ, નંદનિધિ, મકરનિધિ, કચ્છપનિધિ, શંખનિધિ, ખર્વ/મિશ નિધિ.
- દસ મહાવિદ્યા : કાલી, તારા, ઘોડશી, ભુવનેશ્વરી, બૈરવી, છિન્નમસ્તિકા, ધૂમાવતી, બગલામુખી, માતંગી, કમલા.
- દસ દિશા : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અજિન, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, ઉપર, નીચે.
- દસ દિક્કુપાલ : ઈન્દ્ર, અજિન, યમરાજ, નૈઋતિ, વરુણ, વાયુદેવ, કુબેર, ઈશાન, બ્રહ્મા, અનંત.
- દસ અવતાર : મત્સ્ય, કચ્છપ, વારાહ, નૃસિંહ, વામન, (વિષ્ણુજી) પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્યા.
- દસ સતી : સાવિત્રી, અનસુયા, મંદોદરી, તુલસી, દ્રૌપદી, ગાંધારી, સીતા, દમયંતી, સુલક્ષ્ણા, અરુંધતી.

અથાણાનું એડજસ્ટમેન્ટ

અથાણામાં ખરેખર ગજબનું એડજસ્ટમેન્ટ છે. અથાણામાં વપરાતી કેરીનો સ્વભાવ ખટાશનો છે. તેમાં વપરાતા ગોળનો સ્વભાવ ગળપણ - મીઠાશનો છે. મેથીનો સ્વભાવ કડવાશનો છે, મરચાનો સ્વભાવ તીખાશનો છે, મીઠાનો સ્વભાવ ખારાશનો છે અને ધાણાજીરાનો સ્વભાવ તુરાશ...

પણ અથાણાએ રૂંડું એડજસ્ટમેન્ટ કરી લીધું છે. સૌને એનો સ્વભાવ રૂડો લાગે છે અને ગમે પણ છે.

જો અથાણાને સમજીને આપણે પણ આ જિંદગીમાં બધા સાથે જ અને દરેકના સ્વભાવ સાથે એડજસ્ટમેન્ટ કરતા શીખી જઈએ તો સૌને ગમતા થઈ જઈએ. અકારું જવન જવવા જેવું મધુરું બની જાય **ગુલાબસંદ ધારણી રાંભિયા - અમાવાસ્ય**

તા. ૧-૪-૨૦૨૧થી જી.એસ.ટી. કાયદા હેઠળ નવા સુધારાઓ અમલમાં આવ્યા...

સરકાર દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ સતત સુધારાઓ થતા રહ્યા છે. તે પ્રમાણે તા. ૧-૪-૨૦૨૧થી કેટલાક નવા સુધારાઓ અમલમાં આવ્યા છે. હકીકતમાં જી.એસ.ટી. પત્રકો ભરવાનું તથા શીર્ફ લેવાની રકમની કાર્યવાહી સરળ થાય તેમ સૌ ઈચ્છી રહ્યા છે. તા. ૧-૪-૨૦૨૧થી અમલમાં આવતા નવા સુધારાઓ...

● સપ્લાયર્સના બીલ નંબર :

જી.એસ.ટી. કાયદાની જોગવાઈના નિયમ-૪૪(બી) પ્રમાણે નવા નાણાંકીય વર્ષ માટે બીલની બુક શ્રેષ્ઠી નવી કરવાનું જરૂરી છે, જેથી બીલ નંબરનું બેવડાવવાનું ટાળી શકાય.

● એચ.એસ.એન. કોડ :

જ્યારે માલ સપ્લાય કરવામાં આવે તે સમયે બીલમાં એચ.એસ.એન. કોડ જણાવવા માટે અગાઉ છુટછાટ આપવામાં આવી હતી. હવે નવા નિયમ મુજબ અગર સપ્લાયર્સનું ટર્નઓવર પાંચ કરોડથી ઓછું છે તેમણે નોંધાયેલા વેપારી સાથેના વ્યવહાર માટે સપ્લાયર્સના બીલમાં ચાર અક્ષરનો એચ.એસ.એન. કોડ લખવો ફરજિયાત છે. આવા સપ્લાયર્સ જ્યારે બિન નોંધાયેલા વેપારી સાથે ધંધો કરે, ત્યારે ચાર અક્ષરનો એચ.એસ.એન. કોડ લખવો ફરજિયાત રહેશે નહીં. જે સપ્લાયર્સનું ટર્નઓવર પાંચ કરોડ કે તેથી વધુ છે, તેમણે તમામ બીલમાં છ અક્ષરનો એચ.એસ.એન. કોડ લખવો ફરજિયાત છે. તે ઉપરાંત, હવેથી પત્રક જી.એસ.ટી.આર.-૧ માં પણ એચ.એસ.એન. કોડની વિગત આપવી ફરજિયાત કરવામાં આવી છે.

● ક્યુ.આર.એમ.પી. સ્કીમ હેઠળ પત્રક

નાના વેપારીઓને આ નિયમ હેઠળના પત્રક ભરવામાં થતી તકલીફને દૂર કરવા જાન્યુઆરી ૨૦૨૧થી ક્યુ.આર.એમ.પી. સ્કીમ અમલમાં મૂકી છે. આ સ્કીમ મુજબ જે માસિક રૂપિયા પચાસ લાખથી વધુ રકમના બીલથી સપ્લાય કરવામાં આવે તો દરેક બીલની રકમ બતાવવાનું પત્રક આઈ.એફ. ભરાતું ન હતું. હવે જે સપ્લાયર્સને આ સ્કીમનો લાભ લેવો ન હોય પરંતુ તા. ૧-૪-૨૦૨૧થી માસિક પત્રક ભરવા હોય, તો તે માટેનો વિકલ્પ લેવાની સુવિધા જી.એસ.ટી. પોર્ટલ પર હવે આપવામાં આવી છે. આ જોગવાઈ પ્રમાણે જે લોકો ક્યુ.આર.એમ.પી. સ્કીમ છોડે છે તેમણે માસિક જી.એસ.ટી.આર.-૧ મહિનો પૂરો થતાં, ૧૧ તારીખ સુધીમાં ભરી દેવું જરૂરી છે. તે ઉપરાંત, જી.એસ.ટી.આર.-૩બી માસિક ૨૦ તારીખ સુધીમાં ભરી દેવું અનિવાર્ય છે.

● ઈ-ઇન્વોઇસ :

જે સપ્લાયર્સની ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે બાધ્ય સપ્લાયની રકમ થાય, તો એ કિસ્સામાં બિન નોંધાયેલ વ્યક્તિ સાથેના વ્યવહારમાં ક્યુ.આર. કોડ છાપવો તા. ૧-૪-૨૦૨૧થી

ફરજિયાત થયું છે. તાજેતરમાં સરકારે એમ જાહેર કર્યું છે કે આ જોગવાઈનું પાલન તા. ૩૦-૬-૨૦૨૧ સુધી કોઈપણ દંડ વગર થઈ શકશે. તા. ૧-૭-૨૦૨૧થી આમ કરવું અનિવાર્ય રહેશે. ખાસ વાત એ છે કે ઈ-ઇન્વોઇસ સિવાયનું બીલ આપવામાં આવશે તો એ કિસ્સામાં તે બીલ માન્ય થશે નહીં અને વેપારીને દંડ ભરવો પડશે.


તા. ૧-૪-૨૦૨૧થી ઈ-ઇન્વોઇસની જોગવાઈ લાગુ પાડવા માટેની લિમિટ રૂ. ૫૦ કરોડ કરી નાખવામાં આવી છે. બાધ્ય સપ્લાયરને લગતા તમામ બીલ, કેટિ નોટ અથવા ડેબીટ નોટ માટે ઈ-ઇન્વોઇસ કરવો ફરજિયાત રહેશે. વધુમાં, ઈ-વી બીલ પણ ઈ-ઇન્વોઇસ પોર્ટલથી બનાવવાના રહેશે.

● વેરા શાખ :


તા. ૧-૪-૨૦૨૧ બાદ જે રકમ સપ્લાયર્સના જી.એસ.ટી.આર.-૨બી માં દેખાશે તેટલી જ રકમ વેરાશાખ તરીકે ભોગવી શકશે. જી.એસ.ટી. કાયદાની કલમ-૧૬ પ્રમાણે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કોઈ વેરાશાખ માંગવાની રહી ગઈ હશે તે સપેટેભર ૨૦૨૧ સુધી મેળવી શકશે.

(સંકલન : દિનશ આર. મહેતા)

'ગોમ્સ ગોતેરી'માં આપેલ પણલોના જવાબ



10x10 પુછું



ડેણ્ટલ

સમાચાર સંક્ષિપ્તમાં

જાહુના સખાટ

જુનિયર કે.લાલનું કોરોનાથી અવસાન

વિશ્વપ્રસિદ્ધ જાહુગર કે.લાલના સુપુત્ર જુનિયર કે.લાલ (હર્ષદરાય વોરા)નું તા. ૪-૪-૨૦૨૧ના રોજ મોડી રાતે અમદાવાદ ખાતે કોરોનાથી અવસાન થયું હતું. જુનિયર કે.લાલ કોરોનાથી સંકષિત થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શાસ લીધા હતા. તેમના નિધનથી જાહુરી કલાના જગતમાં શોક વ્યાપી ગયો છે.

વરિષ્ઠ અભિનેત્રી શશીકલાનું મુંબઈમાં નિધન

બોલીવુડની વરિષ્ઠ અભિનેત્રી તેમજ હિંદી ફિલ્મોમાં ખલનાયિકાની ઓળખ કરાવનારી પ્રથમ અભિનેત્રી શશીકલાનું ૮૮ વર્ષની વધે તા. ૪-૪-૨૦૨૧ના રોજ મુંબઈમાં મૃત્યુ થયું હતું. તેમણે ૭૦ના દાયકામાં બોલીવુડની ફિલ્મોમાં હિરોઈન તેમજ વિલન એમ બંને પ્રકારના પાત્રો ભજ્યા હતા.

બોલીવુડમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ શશીકલાનું પૂરું નામ શશીકલા જાવલકર હતું.

તેમનો જન્મ ૪થી ઓગસ્ટ, ૧૯૮૨ના સોલાપુરમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં અનેક ચઢાવ ઉતાર જોયા હતા. તેમનું બાળપણ ખુશહાલીમાં વિત્યું હતું.

શશીકલાની પ્રથમ ફિલ્મ જીનત, નૂરજહાંના પતિ શૌકત રીજીવીએ બનાવી હતી. તે ઉપરાંત તેમણે ચાર રસ્તા, નૌ દો જ્યારહ, હમજોલી, સરગમ, ચોરીચોરી, નીલકમલ, અનુપમા જેવા હીટ ચિત્રપટો પણ આપ્યા હતા.

દિલીપકુમારથી માંડી સલમાન ખાન સુધીના કલાકારો સાથે તેમણે કામ કર્યું હતું. છેલ્લે તેમણે ‘કબી ખુશી કબી ગમ’માં કામ કર્યું હતું.

તેમને ઉત્તમ સહાયક અભિનેત્રી માટે ગ્રાન્ડ ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ અને જીવનપર્યત ઉપલબ્ધ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૦૭માં શશીકલાને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરી હતી.

મુશાયરાના બાદશાહ

ખલીલ ધનતેજવી જન્મતનશીન

“ખીંચ લે જાઓ ન ચાદર હી સમજકર કોઈ,
મેં ખલીલ, આજ કફન ઓટકે સો જાતા હું.”



“હું ખલીલ આજે મયો હું, એ પ્રથમ ઘટના નથી, જિંદગી
પર હમે હમે રોજ ચુકવાયો હતો...”



ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શાસ પર, મોતને
વાતોમાં વળગાડીને હું સરકી ગયો.”



‘અબ મેં રાશન કી કતારો મેં નજર આતા હું, અપને ખેંતોસે
બિછડને કી સજા પાતા હું.’

વિઘ્યાત ગુજરાતી તથા ઉર્દુ ગજલકાર, કવિ, લેખક,
પત્રકાર તથા જિંદાદિલ ઈન્સાન જનાબ ખલીલ ધનતેજવી ૮૨
વર્ષની વધે વડોદરામાં તા. ૪-૪-૨૦૨૧ના રોજ જન્મતનશીન
થયા છે.

તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ થયો હતો.

વડોદરા નજીક આવેલા ધનતેજ ગામના તેઓ વતની હતા.
આ ગામના નામ પરથી તેમણે પોતાના નામની પાછળ ધનતેજવી
અટક લગાવી હતી. આમ તો તેમનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ
મકરાણી હતું. તેમણે માત્ર ધોરણ-૪ સુધીનું જ શિક્ષાણ મેળવ્યું
હતું, પણ તેમનામાં સર્જન શક્તિનો આગવો સ્વોત કુદરતે
વહાવ્યો હતો.


મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેઓ દાદ મેળવતા હતા,
તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં ખલીલ ધનતેજવીનું નામ અચ્યુક
લેવાતું હતું. માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાં પણ તેમની
ગજલો સાંભળવા લોકો ઉમટી પડતા હતા.

સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે
પણ તેઓ સંકળાયેલા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ
ખલીલભાઈના નિધન બદલ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે
ગુજરાતી ગજલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશાં
યાદગાર રહેશે. ખલીલભાઈને વર્ષ ૨૦૦૪માં કવિ કલાપી
પુરસ્કાર, વર્ષ ૨૦૧૩માં વલી ગુજરાતી ગજલ પુરસ્કાર,
૨૦૧૮માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને
સયાજરતન એવોઈ પણ મળ્યો હતો.

મુરજી ગનશી ગડા

(૨ સપ્ટેમ્બર, ૧૯૪૪થી ૨૪ માર્ચ, ૨૦૨૧)

એક લેખક, શિક્ષકની અવિસમરણીય જીવનયાત્રા તેમની પુત્રીના જ શબ્દોમાં....



તેઓશી એક લેખક, શિક્ષકની સાથે સાથે પ્રેમાળ પતિ, પિતાશી, ભાઈ, પુત્ર પણ હતા.

ઘણા લોકો તેમને એક મહાન વ્યક્તિ, માયાળું તથા સજજન વ્યક્તિ તરીકે જાણતા હતા. હકીકતમાં તેઓ આનાથી પણ કંઈક વિશેષ હતા. તેમના જીવન કવનની બધી જ બાબતો એક કાગળના ટુકડા

પર અંકિત કરવી લગભગ અશક્ય છે. પરંતુ તેમના જીવનની સારદૃપ બાબતો કોઈ ખાસ પ્રકારના કમ વગર અહીં પ્રસ્તુત છે.

મહાન જીવન કથની : તેઓએ જે કંઈ પણ તેમના જીવનમાં પ્રામ કર્યું છે તે ઉપર દિચ્ચિપાત કરતાં ધ્યાનમાં આવે છે કે, માત્ર આઠ ડોલર જિસ્સામાં લઈને વિદેશની ધરતી પર જવું, એટલું જ નહીં વિદેશમાં ગયા પછી જાત મહેનતથી કમાણી કરી, પોતાના જીવનની દિશા બદલીને પોતાના પરિવારને ક્યાંય તકલીફ ન પડે તેમ દરેકના જીવનને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. તેઓએ જીવનના પ્રત્યેક તબક્કે ઘણા લોકોને મદદ કરી છે. શિક્ષણ તથા વ્યવસાય ક્ષેત્રે પગભર થવા ઘણાને આર્થિક મદદ કરી છે. ખૂબ જ મુસીબતો વેઠીને પોતાની શક્તિ અને સામર્થ્ય દાખલ્યું છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેઓએ યુવા અવસ્થામાં જ પોતાની માતાને ગુમાવી દીધા હતા. તેમનું જીવન હંમેશાં કરુણામય રહ્યું હતું. મક્કમતા સાથે આગળ વધી જગતને સમજવાના અભિગમવાળું તેમનું જીવન હતું.

ઉદાર, કરુણામય અને એક સાચા સજજન વ્યક્તિ : તેઓશી હંમેશાં પોતાની ગમે તેવી નબળી પરિસ્થિતિમાં પણ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર રહ્યા હતા. તેઓએ પોતાની અંગત સમસ્યાઓ, પરિવાર સુધી ન પહોંચે તેનું સતત ધ્યાન રાખ્યું હતું. બીજી તરફ, પરિવારની સમસ્યાઓને હંમેશાં દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા. જો કે ભૌગોલિક રીતે હું ઘણા વર્ષોથી તેમનાથી દૂર રહી છું પરંતુ તેમનો ઉલ્લાસસભર અવાજ, મારા જીવનના આરંભેલ પ્રવાસના પ્રત્યેક પગથિયે હંમેશાં મારી સાથે હતો.

એક પ્રાકૃતિક શિક્ષક : ઉચ્ચ કક્ષાના ઈજનેર તરીકે બે

દાયક જેટલો સમય અમેરિકામાં વ્યતીત કર્યા બાદ અનાયાસે એક બીજી કારકિર્દિને પોતાના નિવૃત્તિના સમયમાં એક સફળ લેખક તરીકે કંડારી હતી. તેઓના પુરસ્કૃત પ્રકાશિત લેખોની હારમાણા અને પુસ્તકો દ્વારા – ખગોળશાસ્ક અને તત્ત્વજ્ઞાનને મુખ્ય વિષય બનાવી અનેક લોકોના દિલો-દિમાગ સુધી પહોંચ્યા છે અને તેઓને વિચારતા કર્યા છે. તેમની આ અન્યોન્ય સિદ્ધિ હતી. તેમનું સૌથી મોટું કૌશલ્ય કોઈ હોય તો એ હતું કે તેઓ ગમે તેવા અટપટા વિષયોનું તાર્કિક, સુપાચ્ય લેખન દ્વારા બહોળા વગને ઉપયોગી બને તેવી રીતે અનુસંધાન કરી શકતા હતા. તેઓ સમસ્યા નિવારક અને સાચા સલાહકાર તરીકે સમુદ્દર્યના ઘણા લોકો માટે ઉપલબ્ધ રહેતા હતા અને તેથી જ અનેક લોકોની કૌટુંબિક સમસ્યાઓના સમાધાન માટે તથા દિશા નિર્દેશ કરવામાં માધ્યમ બન્યા છે. વસિયતનામું તૈયાર કરવામાં કે આર્થિક રોકાણનું આયોજન કરવામાં આવતી અનેક સમસ્યાઓના નિવારક માટે હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. ભૌતિકશાસ્કના વિષયમાં તેઓ પ્રવીણતા ધરાવતા હતા. હું નાપાસ ન થાડું તે માટે મને ભૌતિકશાસ્ક શિખવાડીને તેઓએ આબાદ બચાવી છે. આખા વર્ષનું જ્ઞાન મને એક માસમાં શીખવ્યું હતું. તેમજે શીખવેલ વિષયવસ્તુ જ, મને એક મજબૂત પરિણામ તરફ લઈ ગયું અને સાથે સાથે મારો ઉચ્ચ શિક્ષણનો પાયો પણ મજબૂત રીતે સ્થપાયો. જેના કારણે મેં ઉચ્ચ શિક્ષણ સરળતાથી પ્રાપ્ત કર્યું. તેમની અનેક સ્મૃતિઓ સાથે આ સ્મૃતિ હંમેશાને માટે મારા માનસ પટલ પર અંકાઈને રહેશે.

● એક બહોળ વિચારક : સમાજમાં સાચા બુધ્યનિષ્ઠ પૈકી તેઓ એક હતા. તેઓ પોતાની આખી જિંદગી દરમિયાન જીનવાણી વિચારધારા કે પ્રવર્તમાન ડહાપણ સામે સતત પ્રશ્નો ઊભા કરતા રહ્યા. તેઓની આ પડકારજનક તાર્કિક દલીલો નવા મૌલિક વિચાર વિકસાવવામાં સમાજને પુરસ્કૃત કરતી રહી. તેમની આ બૌદ્ધિક વિશેષતાઓ જ સમગ્ર પરિવારજનોના જીવનની સફળતા માટે પ્રેરણારૂપ રહી છે.

● સંપૂર્ણ વિશ્વાસને પાત્ર વ્યક્તિ : તેઓ દ્રઢતા સાથે માનતા કે બીજાઓમાં શ્રેષ્ઠતા રહેલી જ છે અને તેના ઉપર વિશ્વાસ રાખી, કંઈક કરવાની તક તેમને મળવી જોઈએ અને આપવી જોઈએ!


તેમના દરેક સામાજિક કાર્યો માટે અને વિવિધ વિષયોની ઉંડી સમજ પરત્યે દરેકને માન ઉપરે તે સ્વાભાવિક છે.

- કોણ ગડા (દીકરી)

માણસને બોલતા શીખતા બે વર્ષ લાગે છે.

પણ શું બોલવું, ક્યારે બોલવું,

કંઈકું બોલવું શીખવામાં આખી જિંદગી નીકળી જાય છે.




ગોમસ ગેલેરી

પત્રસ



પત્રસ-૧ : ચક્કવ્યૂહ

આપેલ કલુની મદદથી પાંચમો અક્ષર “જ” હોય તેવા શબ્દો વડે ચક્કવ્યૂહની રચનામાં જવાબ ભરો.




- | | |
|---------------------------------------|--------------------------|
| ૧. સમજફેર | ૧૧. અસંસ્કારી |
| ૨. ફૂલમાંની રજ. | ૧૨. શહેનશાહ |
| ૩. આનંદી સ્વભાવ | ૧૩. બહાદુર |
| ૪. પગની ધૂળ | ૧૪. લક્ષ્ય તાકવામાં કુશળ |
| ૫. દરરોજ | ૧૫. બે સરખી ભુજાવાણું |
| ૬. શૃંગારિક ચેષ્ટાઓ કરનાર | ૧૬. ફિલેહનો વાવટો |
| ૭. સમજનો અભાવ | ૧૭. દીકરીનો પતિ |
| ૮. આ પ્રકારની વિવિધી પણ વિવાહ થાય છે! | ૧૮. કામદેવ |
| ૯. મુસ્લિમ - બાય બાય! | |
| ૧૦. ગરમ સ્વભાવનું. | |


પત્રસ-૨ : ફિલ્મી તોરણ

આ પત્રસમાં આપેલ કલુની મદદથી બોલીવુડને અનુરૂપ જવાબો શોધી ફિલ્મી તોરણની રચનામાં જવાબો ભરો.

૨. ‘કરીબ’ ફિલ્મમાં દેઓલની માશૂકી.
 ૩. શ્રોફ-દેઓલ-શાહનો ઝંગાવાત.
 ૪. એક સંગીતકાર કે જેની અટક વીતેલા જમાનાના સુપરસ્ટાર સાથે સામ્યતા ધરાવે છે.
 ૫. ‘એક દૂજે કે લિયે’માં રતિના લગ્નનો ઉમેદવાર.
 ૬. ‘પરીદા’માં આગથી ડરતો ખલનાયક.
 ૭. એક કિકેટર પત્ની - અભિનેત્રી.
 ૮. આશા ભૌસલેના સ્વ. પતિ.
 ૯. ‘લગાન’ ફિલ્મનો નિર્દેશક.
-
૧૦. ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મના ટાઈટલ સોંગના ગાયક
 ૧૧. શાહરૂહ અભિનીત કરણ જોહરની એક ફિલ્મ
 ૧૨. ‘હેરાફેરી’નો બાબુરાવ
 ૧૩. ‘ગદર’નો તારાસિંહ
 ૧૪. મૈં કોઈ ગીત ગાઉં... ગીતનો ગાયક.
 ૧૫. શ્રીદેવી, અનિલ કપૂર અને ઉર્ભિલાની ખેંચતાણ.
 ૧૬. ‘નવરંગ’ ફિલ્મની અભિનેત્રી.



(પત્રસના જવાબો)
આ જ અંકમાં અન્યત્ર આપવામાં આવેલ છ.)



ગોમસ ગેલેરી

કેપિટલ અક્ષર પરથી વાક્યની રચના



ભાવના એ. જીવેરી

અંક આપેલ છે. સ્પેલિંગના કેપિટલ અક્ષર પરથી વાક્ય બનાવો.

ઉદાહરણ :

કૃતુ : 7 W of the W

જવાબ : 7 વર્જર ઓફ દ વર્ડ્સ.

રમનાર બધાને પેપર અને પેન આપો. જે સૌથી વધારે સાચા જવાબ આપે તેને અનુકૂળ ગ્રંથ વિનર જાહેર કરવા.

કૃતુ

૧. 24 H in a D
૨. 26 L of the A
૩. 7 D of the W
૪. 7 W of the W
૫. 12 S of the Z
૬. 66 B of the B
૭. 52 C in a P (WJs)
૮. 13 S in the USF
૯. 18 H on a G C
૧૦. 39 B of the O T
૧૧. 5 T on a F
૧૨. 90 D in a R A
૧૩. 3 B M (S H T R)
૧૪. 32 is the T in D F at which W F
૧૫. 15 P in R T
૧૬. 3 W on a T
૧૭. 100 C in a R
૧૮. 11 P in a F (S) T
૧૯. 12 M in a Y
૨૦. 13 UFS
૨૧. 8 T on a O

૨૨. 29 D in F in a L Y

૨૩. 27 B in the N T

૨૪. 365 D in a Y

૨૫. 13 L in a B D

૨૬. 52 W in a Y

૨૭. 9 L of a C

૨૮. 60 M in a H

૨૯. 23 P of C in the H B

૩૦. 64 S on a C B

૩૧. 9 P in S A

૩૨. 6 B to an O in C

૩૩. 1000 Y in a M

૩૪. 15 M on a D M C

પ્રભુ પ્રાર્થના

હે પ્રભુ!

મને એટલી શક્તિ આપ કે, હું મારી મયોદાઓનો પ્રામાણિક સ્વીકાર કરી શકું;

મને એટલી વિવેકબુદ્ધિ આપ કે પ્રશંસાના પૂરમાં મારી નમતા તણાઈ ન આપ;

અસત્તની સામે અરીખમ ઉભા રહેવાનું બળ આપ;

નિદકોને આવકારી શકું એવી નિલેખતા આપ;

અન્યોની નબળાઈઓ પરતે આપ અપાર કરુણા;

મારી પોતાની ભૂલોને ઓળખવાની ક્રમતા આપ;

મહાનતાનો આદર કરવાની તટસ્થતા આપ;

મિત્રની પડખે ઉભા રહેવાની અડગતા આપ;

મન, વચન, કાયાથી તુજને સમર્પિત રહેવાની હૃપા આપ.

સોઝન્ય : “સમજાણા સૂર”

આંજો કાર

'મંગલ મંદિર' વિશે.... 'ગાગરમાં સાગર'

સુંદર, આકર્ષક અને રંગળિન મુખ્યપૃષ્ઠ ધરાવતો માર્ચ-૨૦૨૧નો 'મંગલ મંદિર'નો અંક પ્રથમ નજરે જ પ્રેમમાં પડાય એવો છે. આખાય અંકનું રસપાન કરતાં જણાય છે કે આપે ગાગરમાં સાગર ભરી દેવાનું કામ કર્યું છે. વિવિધ રસ ધરાવતા વાંચકોને મનગમતું ભાથું મળી રહે તેવો સંશોધ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ભાવકોને છેલ્લા પાના સુધી વાંચવા મજબૂર કરે છે. એક જાગૃત સમાજ સ્વભળે સમાજની પ્રવૃત્તિ અને ઉદ્દેશ્ય માટે કેવી રીતે સેવા પ્રવૃત્ત રહી શકે, તે અંક વાંચતા સહેજે જણાઈ આવે છે. આપ સર્વે આપના પ્રયત્નોમાં સફળ થતા જણાવ છો, એમાં બે મત નથી. હજુ સફળતાના વધુ જીંચા શિખરો સર કરો એવી દિલી શુભેચ્છા પાઠવું છું. આ કર્મયોગમાં સહયોગી થનાર સર્વેને મારા હાર્દિક અભિનંદન.

**આનિદ મહે - હિંમણનગર
મો. ૯૪૦૬૦ ૨૨૯૩૦**

સદનવાડીના સંસ્કરણ

માર્ચ માસના 'મંગલ મંદિર' સામયિકની અનુકમણિકા વાંચતા એક નામ ઉપર નજર અટકી ગઈ - "સરસ્વતી સદન - સદનવાડી." આ નામ વાંચતા જ ૮૦ વર્ષ પહેલાનો સમય યાદ આવી ગયો. જ્યારે ૬-૭ મહિના માટે જ બાળકોના સ્વર્ગસમી આ સંસ્થામાં રહેવાનો મને અવસર મળ્યો હતો. એ દિવસો આજ સુધી ભૂલાયા નથી.

વતન મુંદ્રામાં આખાય કુટુંબનો આર્થિક આધાર તે વખતના બર્મની આવક ઉપર હતો. બીજા વિશ્વયુધમાં જાપાન બર્મના આંગણો આવ્યું ત્યારે ૧૯૪૮માં બધા લોકો પાછા આવ્યા હતા.

એ સમયે મારા કૌટુંબિક કાકા કેશવલાલભાઈ સદનવાડીમાં કોઠાર સંભાળતા હતા. તેમની ભલામણથી વીલોએ મને ત્યાં ભાણવા મોકલ્યો હતો.

એ વર્ષમાં (૧૯૪૮) મુંદ્રામાં યુસુફ મહેરઅલીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. ત્યાં સદનવાડીના બાળકોને સ્વયંસેવકો તરીકે મોકલવાનું નક્કી થયું. ઊંટગાડીઓમાં બેસીને બધા મુંદ્રા પહોંચ્યા હતા.

સ્વયંસેવક તરીકેના કામમાં સફાઈ કામ પણ સામેલ હતું અને એ જ કારણે તે વખતની વાણિયાના ન્યાતમાં હો-હા થઈ ગઈ. "છોકરાઓ પાસે ભંગીકામ કરાવે છે."

મારી સાથે મુંદ્રાના અન્ય બે બાળકો પણ હતા. આજ કારણથી અમને ત્રાણેને રોકી લેવામાં આવ્યા. જાણે સ્વર્ગમાંથી પાછા ધરતી ઉપર આવી ગયા!

૧૯૪૪માં કચ્છ છોક્કું ત્યારે જ એ સંસ્થા બંધ થવાની છે એવા ખબર કાકાશ્રી મારફત મળ્યા હતા.

વર્ષો બાદ (બનતા સુધી ૧૯૮૨-૮૪) મારા વેવાઈ અને એક સમયના સર્વોદ્ય કાર્યકર છગનભાઈ વોરા મારફત મગનભાઈ સોનીને મળવાનો અવસર મળ્યો હતો, એ સદ્ગુરૂભાગ્ય હતું.

સદનવાડી તે વખતના કચ્છથી ૫૮-૬૦ વર્ષ આગળ હતી. કચ્છના દુભર્યિયે એ ન ચાલી.

જૂની યાદ તાજી કરાવવા બદલ ઉપરોક્ત લેખના લેખક નરેશભાઈનો આભાર.

**મગનલાલ સંધ્યી - અમદાવાદ
મો. ૯૮૨૪૧ ૪૪૫૬૬**

પ્રાદેશિક ભાષા અંગે

'મંગલ મંદિર'ના ફેલ્બુઅારી માસના અંકમાં ઘણા વખતે મુરજુભાઈ ગડાનું પ્રાદેશિક ભાષાઓ અંગે નક્કર વાસ્તવિકતાને ઉજાગર કરતું લખાણ મળ્યું.

અંગ્રેજ માધ્યમમાં શિક્ષણનો મોહ, શહેરો સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રવેશી ચૂક્યો છે. આ બાબતના મૂળ ઘણા ઉંડા છે.

આજાદી બાદના વર્ષોમાં અને તે વખતના ગાંધીવાડીઓની માન્યતાના કારણે ૮મા ધોરણથી અધકચરું અંગ્રેજ શીખવવાનું શરૂ થયું. એમાં એ વખતની આખી પેઢી સારા અંગ્રેજ શિક્ષણથી વંચિત રહી ગઈ. પાછળથી પાંચમા ધોરણથી અંગ્રેજ શિક્ષણ શરૂ કર્યું હતું પણ માણખું એ જ રહ્યું.

આ પરિસ્થિતિના પ્રત્યાવાત એવા આવ્યા કે આજની પેઢી પોતાના સંતાનો માટે આંખો અને હિમાગ બંધ કરીને 'ઇજિલશ મીડિઅમ' પાછળ પડી છે. પરિણામે નવી પેઢી સ્વભાષાથી વંચિત થઈ રહી છે. ગુજરાતી લખાણ હોય તો તેઓ રોમન લિપિમાં લખે છે! ગુજરાતમાં શરૂઆતથી જ અમારી પેઢીને મળેલ એવું ઘનિષ્ઠ શિક્ષણ અંગ્રેજનું મળ્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન આવત. આ આજાદી પહેલાની વાત છે.

આપણો દેશ પણ વિશિષ્ટ છે. એક જ દેશમાં આટલી બધી વિકસિત ભાષાઓ હોવાનો દાખલો બીજે ક્યાંય નહીં મળે. જુદા જુદા પ્રાંતોમાં આમ જનતાની પરસ્પર બોલચાલની હિંદી ભાષા હવે દક્ષિણ ભારતમાં પણ સારા પ્રમાણમાં અપનાવાઈ રહી છે.

પણ દરેક પ્રાંત વચ્ચે પરસ્પરની તેમજ મધ્યસ્થ સરકાર સાથેના વ્યવહારોમાં, ઉદ્યોગો અને કંપનીઓમાં તથા એક બીજા સાથેના વ્યવહારોમાં તેમજ સરકારી ખાતાઓ સાથેના વ્યવહારોમાં અંગ્રેજ જ ચાલે છે અને ચાલશે.

ભારતમાં દક્ષિણ ભારત સિવાયની બધી જ ભાષાઓના મૂળ સંસ્કૃતમાં છે, તેમ અંગ્રેજનું મૂળ લેટિનમાં છે. અંગ્રેજો ભૂતકાળને છોડીને વર્તમાનની અનેક ભાષાઓના શબ્દોને અપનાવીને અંગ્રેજ ભાષાને સમૃદ્ધ બનાવતા રહ્યા છે. આપણે ત્યાં આજાદી બાદ ભૂતકાળને પકડીને સંસ્કૃત પ્રચૂર હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ ગયો. લોકો જેને સરકારી હિંદી કહે છે, એ આજે ઘણાને સમજાતી નથી.

મધ્ય પૂર્વના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની ભાષાનો પ્રભાવ આજે સર્વવિદ્યિત છે. પણ મને તો એનો પ્રત્યક્ષ અનુભવ ૧૭ વર્ષની ઉમરે જ થઈ ગયો હતો. ૧૮૪૬-૪૮ દરમિયાન તે વખતના બર્માના નાના ગામડાંમાં નોકરી કરવાનું થયું ત્યારે ત્યાંની ભાષા બોલવા ઉપરાંત લખતા વાંચતા શીખ્યો ત્યારે મારા આશ્ર્ય સાથે જાણવા મળ્યું કે લખાણ અને ઉચ્ચાર અલગ હોવા છતાં મૂળમાં આખોય કક્કો સંસ્કૃત ઉપર જ આધારિત હતો!

ફરી ગુજરાતમાં આવીએ. ગુજરાતીઓ ભાષાની બાબતમાં ઉદાર (કદાચ વધારે પડતા!) છે. એક જ દાખલો. આખા અમદાવાદના બજારો, દુકાનો, ઓફિસો, મોલ વગેરેના સાઈન બોર્ડ જુઓ. કેટલા ઉપર ગુજરાતી લખાણ જોવા મળશે? આ જ પરિસ્થિતિ ગુજરાતના બધા મોટા શહેરોમાં જોવા મળશે. બીજી તરફ મુંબઈ, પૂજો વગેરે જુઓ. ફરક દેખાઈ આવશે. અહીં મોટાભાગના નામ મરાઠી ભાષામાં હોશે.

ગુજરાતી ભાષાની વાત કરીએ તો તેનું મૂળ સંસ્કૃતમાં હોવા છતાં તેમાં ઘણા બધા શબ્દો ફારસી અને અરબી મૂળના છે અને કેટલાય શબ્દો અંગ્રેજીના પણ અપનાવાઈ રહ્યા છે. આમાં કંઈ ખોઢું નથી. એથી ભાષા સમૃદ્ધ થાય છે. ભર્દંભદ્રિય ભાષાંતરો કરવાનો કશો અર્થ ન હોય.

કંઈપણ ભાષાની વાત કરીએ તો પોતાની લિપિ નથી એ જેમ જેમ મૂળ ભાષામાં અપાતા ભાષાતરનો વ્યાપ વધશે તેમ તેમ તેનો ઉપયોગ ઓછો થઈ જશે. એ અનિવાર્ય છે.

કોઈપણ ભાષાની તેના સંખ્યાબળના કારણે અન્ય ભાષાઓ ઉપર હાવી ન થઈ શકે. હિંદી ભાષીઓની સંખ્યા વધારે હોવા છતાં આજાદી પહેલાના અને બાદના સમયમાં હિંદી ભાષી પ્રદેશો શિક્ષણ અને સાહિત્યની બાબતમાં પણત હતા. તે વખતે બંગાળી સાહિત્યની બોલબાલા હતી. તે ઉપરાંત મરાઠી, ગુજરાતી અને દક્ષિણ ભારતની ભાષાઓ પણ સાહિત્યની દસ્તિએ સમૃદ્ધ હતી. રાષ્ટ્રભાષા તરીકે હિંદીના વિરોધનું આ પણ એક કારણ હતું.

માતૃભાષા અંગેની મધ્યસ્થ સરકારની નવી જાહેર થયેલ

નીતિઓનો જો સારી રીતે અમલ થાય તો ગુજરાતી સહિત પ્રાદેશિક ભાષાઓ બચશે. આના અમલીકરણની ફરજ પ્રાંતિય સરકારોની છે. દુબિયે આ બાબતમાં ગુજરાતની સરકાર જ ગંભીર નથી. ભવિષ્યમાં ભાષા સંબંધી બધું સારું થાય એવી આશા રાખી શકાય.

અમારાના સંઘરી - અમારા
મો. ૮૮૪૪૯૪૪૫૬૬

ગેમ્સ જવાબ : કેપિટલ અક્ષર પરથી વાક્યની રચનાના જવાબ

૧. ૨૪ Hours in a Day
૨. ૨૬ Letters of the Alphabet
૩. ૭ Days of the Week
૪. ૧૨ Wonders of the World
૫. ૧૨ Signs of the Zodiac
૬. ૬૬ Books of the Bible
૭. ૫૨ Cards in a Pack (W/o jokers)
૮. ૧૩ Stripes in the US Flag
૯. ૩૯ Books of the Old Testament
૧૦. ૧૮ Holes on a Golf Course
૧૧. ૧૩ Bills in How They Run
૧૨. ૩ Biimid Milice (See How They Run)
૧૩. ૧૦૦ in a Right Angle
૧૪. ૫ Toes on a Foot
૧૫. ૩ Books of the New Testament
૧૬. ૧૨ Months in a Year
૧૭. ૧૩ is Unlucky For Some
૧૮. ૩૬૫ Days in a Year
૧૯. ૧૨ Weeks in a Year
૨૦. ૧૩ Loaves in a Bakkers Dozen
૨૧. ૬૪ Squares on a Chess Board
૨૨. ૨૩ Pairs of Chromosomes in the Human Body
૨૩. ૬૮ Minutes in an Hour
૨૪. ૧૩ Lives of a Cat
૨૫. ૫૨ Weeks in a Year
૨૬. ૯ Lives in a Year
૨૭. ૬૦ Minutes in an Hour
૨૮. ૧૫ Provinces in South Africa
૨૯. ૬૪ Blalls to an Over in Cricket
૩૦. ૧૦૦ Men on a Dead Mans Chest
૩૧. ૧૦૦0 Years in a Millennium
૩૨. ૬ Balloons to an Ovel in Dead
૩૩. ૧૦૦00 Years in a Millenium
૩૪. ૧૫ Jlemen on a Dead Man

...તો સારું લાગે (ગજલ)

ગડમથલને છોડી થોડીવારમાં મળતા રહો તો સારું લાગે,
આત સરખી થાય ત્યારે અંતરે ટળતા રહો તો સારું લાગે.
શાસ કરતા ગાઢ વિશાસે છઠાં છળતા રહો તો સારું લાગે?
મેળ પડતા ઘાટ સંઘળા અવનવા ઘડતા રહો તો સારું લાગે.
સ્વાંગ રચતા આવડે નહીં એટલે ઉધડી જતા ક્યાં વાર લાગે?
સાચની સાથે હવે હળવા બની ભળતા રહો તો સારું લાગે.
નામ લઈને ચાલતા થઈ જાય બેડો પાર, અમાં ખોટું શું?
ગડતરી પણ છોડી દઈને ભાવથી ભજતા રહો તો સારું લાગે.
સાવ સીધા હોય તેને ખ્યાલમાં આવે જ નહીં પ્રપંચલીલા,
ભીતરથી સાદ ધીમે સાંભળી વળતા રહો તો સારું લાગે.
કોડ જાગ્યા ત્યારથી ધાના જવી જાવા બધે ટળતા રહીએ,
મનમરીને મેળ જામ્યો એટલે ગમતા રહો તો સારું લાગે.

- કવિ ગજાનન પટેલ



...તો સારું લાગે – એક આસ્વાદ

- રમેશ પટેલ, લખક/કવિશ્રી

ઉપરોક્ત ગજલ વાંચતા ભાવકના જીવને પણ સારું જ લાગશે. કવિ મૂલત: ગજલકાર અને ચિંતનશીલ નિબંધકાર છે.

આ ગજલનો રદીફ છે : ‘રહો તો સારું લાગે.’ કાફિયાઓ છે : મળતા, ટળતા, છળતા, ઘડતા, ભળતા, ભજતા, વળતા, ગમતા. ગજલમાં બે મતલાના શે’ર અને બાકી ચાર શે’રમાં આ ગજલનું આંતરબાધ્ય સ્વરૂપ આ લખનારને પણ સારું લાગે છે.

આ ગજલકાર બોલચાલની સાદી ભાષામાં જ ગજલોનું સર્જન કોઈપણ પ્રકારના ઉહાપોહ વિના કરે છે.

માનવમન, કવિમન સતત ગડમથલ / ચિંતન કરતું રહે છે. નવા શબ્દોની પ્રતીક્ષા કરે છે. કવિ ગડમથલને અંતે કંઈક નવું જ પ્રામ કરે છે. કવિ શબ્દના ઊંડા સાગરમાં ઝૂભકી મારી ‘કાવ્યમોતી’ જગ્ઘળતા પ્રામ કરે છે. શબ્દ મોતી પામીને કવિનો આત્મા રાજુ રાજુ થાય છે. કવિ, એ ઈશ્વરની દેન છે. આજ રીતે ચિંતનને અંતે ‘કાવ્યમોતી’ મળતા કવિને સારું લાગે છે! ભીતરે અંતરનો ઉજસ પામી ઈશ્વર તરફ ટળતા રહે છે. ઈશ્વર પણ કવિને જોઈ આનંદ પામે છે.

કવિના શાસમાં છે કવિતાના શબ્દો. કવિને હોય છે શબ્દો પ્રતિ ગાઢ વિશાસ. કવિને વિશાસ માત્ર ઈશ્વર પ્રતિ હોય છે. કવિનું હદ્ય કોમળ હોય છે. કવિ દુન્યવી બ્યવહારથી પર રહે

છે. કવિ કાવ્યનો ઘાટ ઘડતા રહે છે. ભલે એમને જગતના કોઈ ઠગ ઠગી જાય - છળી પણ જાય.

કવિ સ્વાંગ રચવા કોઈપણ પ્રકારનો પ્રચાર કે ઉહાપોહ કરવાનું યોગ્ય માનતા નથી. એ તો ફૂલથી કોમળ બની મહેકી જવામાં માને છે. હંમેશ સત્ય વાણી કવિ ઉચ્ચારે છે. સાચી વાણીમાં જ શ્રીરામના દર્શન પામી કવિ વાદળ જેવા હળવા, હવાથી પણ હલકા બનીને ટકાવે છે. આમ, કવિ શબ્દે શબ્દે ટહુકો કરી ભાવક જોડે ભળતા રહે છે. આથી જ ચાહકને સારું લાગે છે.

કવિને કીર્તિની કોઈ લાલસા નથી. નામ છે ગજાનન પટેલ પણ સતત કેંક લખવામાં, સર્જન કરવામાં વ્યસ્ત રહે છે અને આનંદ માણે છે. કવિ આમ જ શબ્દનો ચમત્કાર સર્જે છે. કવિ ગડતરીબાજ નથી. એ પૂરા ભાવથી જગતને ચાહે છે. સુંદરમે આથી કહું છે : ‘સેહની કરી સર્વથી વડી.’ આમ, સેહભાવથી કાવ્ય - ભીતર રહેલા ઈશ્વરને ભજતા રહેતા કવિને સારું લાગે છે.

કવિ તો સીધાસાદા માણસ છે, એને લોકોની જેમ ‘પ્રપંચલીલા’માં રસ નથી, એ ધૂની છે. પોતાના સર્જનમાં જ મસ્ત રહે છે. એ તો ભીના ભીના હદ્યનો ધીમો રવ - ધ્વનિ સાંભળી લખતા રહે છે અને કવિતાના નવા વળાંકે વળતો રહે છે. આથી ભાવકને પણ સારું લાગે છે. આમ જ આપણને પ્રેમભાવે મનમાં રહીને એકમેકના મન સુધી જવાની વાત કરે છે. જે આપણે પ્રેમથી જીવીએ તો વિશ્વશાંતિના આકાશમાં શાંતિના શ્વેત કબૂતરો જરૂરથી ઉડાડી શકીએ!

કવિતા સર્જનના કોડ જાગ્યા છે એટલે સાતત્યપૂર્ણ લખતા રહી - શબ્દથી શબ્દ સુધી જઈ ઘડતા રહીએ તો જ આપણે મળતા રહીશું. કવિતા એ જ કવિની અમૃત્ય મૂડી છે. કવિ ધન, વૈભવ કે સમૃદ્ધિ નહીં પણ કોક ઉત્તમ કવિની કવિતાનું વાંચન જ ઈચ્છે છે. સારી કવિતા અહીં ઈશ્વરને ભજવાની પ્રાર્થના બની રહે છે.

આ ગજલને સમજવી એ સાચા ભાવક માટે તો ઉત્તમ નજરાણું છે. કવિ તમે સતત લખતા રહો તો અમને પણ સારું લાગે.

**‘પાંજલ’, ૩૦, આનંદ વાટીકા સોસાયટી,
સરદાર પુત્ર પાલે, અડાજાય રોડ,
સુરત-૩૮૪ ૦૦૮. મો. ૮૮૨૫૧ ૦૦૨૫૫**

દિવ્ય ચેતના

મનુષ્યના અણુએ અણુમાં દિવ્ય ચેતનાનો સંચાર થયા કરે છે. દિવ્ય ચેતના વિચારોમાં વહે છે ત્યારે બુદ્ધિપ્રતિભા આપે છે. દિવ્ય ચેતના નિશ્ચયબળમાંથી વહે છે ત્યારે સદ્ગુરી આપે છે પણ જ્યારે તે હદ્યમાંથી વહે છે ત્યારે પ્રેમ અને કરુણા આપે છે.

କ୍ଷେତ୍ର ଦଶନ

● સંકલન : દિનેશ આર. મહેતા ●

- **કચ્છમાં સ્થિતિ વણસી રહી છે :** રાજ્યના અન્ય વિસ્તારોની જેમ હવે કચ્છમાં પણ કોવિડ હોસ્પિટલોમાં પથારી ખાલી નથી. દર્દીને મોતના મુખમાંથી બચાવવા આવશ્યક એવા વેન્ટિલેટર અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે. દિન પ્રતિદિન સ્થિતિ વણસી રહી છે. આ સંઝોગોમાં જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક યોગ્ય પગલાં ભરાય તેવી માંગ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં કરી છે.
 - **કચ્છમાં કોરોનાએ જૂનો રેકૉર્ડ બ્રેક કરી વધુ ૫૮ લોકોને કર્યા સંકભિત :** સરહદી કચ્છમાં કોરોના મહામારીએ બરાબરનું માથું ઊંચક્કું છે. દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કચ્છમાં કોરોના વિસ્કોટ થયો હોય તેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીના જૂના રેકૉર્ડ બ્રેક કર્યા હતા અને વધુ ૫૮ લોકો તાજેતરમાં કોરોનાથી સંકભિત થયા હતા. મહામારીના સંક્જામાં સપદાયેલા કચ્છમાં બે મુખ્ય મથકો ભુજ અને ગામોમાં સ્વૈચ્છિક નાઈટ કફર્યુ, આંશિક રીતે બજારો બંધ વગેરેનો અમલ શરૂ થયો છે. જિલ્લામાં આ અહેવાલ સુધી કુલ પોઝિટિવ કેસનો આંક ૫,૫૨૫ થયો છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી ૪,૮૬૬ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
 - **તાંજાનિયાથી મુંદ્રા પોર્ટ પર આવી રહેલા ઇજરાયલી જહાજ પર મિસાઇલ હુમલો :** આફ્રિકાના તાંજાનિયાથી ભારતમાં મુંદ્રા પોર્ટ આવી રહેલા કન્ટેનર ભરેલા એમ.એસ.સી. લોરી નામના માલવાહક વ્યાપારી જહાજ ઉપર હુમલાની ઘટના બની છે. મધદરિયે દારેસલામ નજીક તાજેતરમાં આ હુમલાનો બનાવ બન્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઈજરાયલ વચ્ચે વણસત્તા સંબંધો દરમિયાન સમુદ્રી જહાજ ઉપર થયેલા મિસાઇલ હુમલાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચક્યાર સર્જ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રયુર્ટસના સમાચાર અનુસાર ઈરાન દ્વારા ઈજરાયલી સમુદ્રી જહાજ ઉપર બે મિસાઇલ છોડી હુમલો થયા બાદ જહાજની સપાટી ઉપર નુકસાન થયું હતું. જો કે, મશીન ડ્રાઇવ અને પણ નુકસાન ન હોઈ જહાજ નાસી

શુટવામા સફળ રહ્યું હતું.

હુમલાની આ ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર,
કન્ટેનર ભરેલું લોરી નામનું આ જહાજ ત્યાંની એક્સ.ટી.
કંપનીની માલિકિની હોવાનું જાણવા મળ્યું છે. જો કે,
મધદરિયે જહાજ ઉપર મિસાઈલ હુમલાના આ બનાવને
આંતરરાષ્ટ્રીય સ્તરે ચક્કાર સર્જી છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા
એજન્સીઓ એલટ થઈ છે.

દરમિયાન, મુંદ્રા પોર્ટ ઉપર પહોંચેલા ઈજરાયલી જહાજ ઉપર બનેલ મિસાઈલ હુમલાના આ બનાવ વિશે જાણકારી મેળવવા ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ હતી.

- કચ્છના મોટા રણમાં પક્ષીઓની વસાહતમાં માનવોનું અમાનવીય કૃત્યા : સુરખાબની જેમ ગુલાબી ધોમડો નામના પક્ષીઓ શિયાળામાં છે ક્યુરોપથી આવીને પાકિસ્તાન સરહેદે મકરાનના ડિનારે હુડા મૂકી બચ્યા ઉછેર કરતા હોવાનું પક્ષીવિદ્ય ડો. સલીમઅલીએ નોંધ્યું છે. અત્યાર સુધી કચ્છમાં આ પક્ષીઓ ક્યાં પ્રજનન કરે છે તેની ધારણાઓ કરતા કરતા પક્ષી શાસ્ત્રીઓ કચ્છમાં ભટકતા રહેતા હતા. પરંતુ આ વર્ષે પ્રથમવાર પક્ષીઓની મોટી વસાહત મોટા રણમાં જોવા મળી હતી. પરંતુ હાલે તેમના હજારો હુડાઓ અને પક્ષીઓની કલેએઆમ કરાઈ હોવાનું બહાર આવતા ગુનેગાર સામે વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠી છે. સારા વરસાદને કારણે કચ્છના રણમાં પાણી ભરાતા સુરખાબને ત્રણેક વાર બચ્યાં ઉછેરવાની તક મળી હતી. ભરઊનાળામાં પણ રણમાં પાણી હોવાથી અહીં પક્ષીસૂચિ ફ્લીફાલી છે.

જાણીતા પક્ષીવિદુ ડૉ. સલીમ અલીએ કચ્છમાં પક્ષીઓની ઉપરાંત જાતની યાદી નોંધી છે. જેમાં ઉત્સાહી નવા પક્ષી નિરીક્ષકોએ પર જેટલી નવી જાતનો ઉમેરો પોતાના અવલોકન દ્વારા કર્યો છે. હાલે કચ્છમાં પક્ષીઓનો આંકડો અવલોકન મુજબ ૪૦૦ને આંખી જાય છે. અલીએ નોંધ્યું કે ગુલાબી ધોમડો યુરોપથી આવીને પાકિસ્તાન સરહદે મકરાનના નિકારે બચ્ચા ઢેતા નોંધાયેલો છે. ત્યારે પેલીકન, સુરખાબ અને ઉલ્ટીચાંચના પ્રજનન બાદ કચ્છમાં ગુલાબી ધોમડોની પ્રજનન કોલોની વિકસવી તે જિલ્લા માટે અનન્ય ઘટના છે.

● કચ્છમાં સતત બે દિવસ કરા સાથે વરસાદ વરસ્યો : કચ્છમાં કમોસમી વરસાદના આપટાનો દોર તાજેતરમાં યથાવત રહેવા પામ્યો છે. ભુજમાં જોરદાર આપટું વરસ્યું હતું. તાલુકાના ભારાપર, ભુજેડી તથા અંજારને ખેડોઈ ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. માનકુવાના વાડી વિસ્તારમાં ટોર્નેડો જેવું વંટોળ રચાયું હતું. ભુજના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો લાંબા સમય સુધી બંધ રહેતા લોકો અકળાયા હતા. વેપારીઓને દુકાનો વહેલી બંધ કરવાની ફરજ પડી હતી. ચૈત્ર માસની કાળજાળ ગરમીના માહોલ વચ્ચે ભચાઉ, રાપર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ સતત બીજા દિવસ સુધી વરસાદના હળવાથી જોરદાર આપટાનો દોર યથાવત રહેવા પામ્યો હતો.

● ભચાઉના શિકારપુર ગામમાં દૂબી જતાં એક જ પરિવારના ગ્રામ બાળકોનાં મોત : ભચાઉ તાલુકાના શિકારપુર ગામ ખાતે તાજેતરમાં ગ્રામ તરુણો નહાવા માટે નદીના પટમાં બનેલા ખાડાઓમાં ફૂદકો લગાવી બેઠા હતા. ગેરકાયદેસર ખનીજ ખનન બાદ બનેલા આ ખાડાઓમાં છેલ્લા આઠક માસથી પાણી ભરાયેલું પડ્યું છે, જેણે તરુણોમાં આકર્ષણ જગાવ્યું હતું. નહાવા પડ્યા બાદ આ તરુણો ખાડાના કાદવમાં ફસાયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા અને મોતને ભેટ્યા હતા. એક જ પરિવારના આ પિતરાઈ ભાઈઓ આ રીતે દૂબી જતાં ગામમાં અરેરાટી ફેલાઈ હતી, તો સમગ્ર પંથકમાં આ બાબતે વાત ફેલાઈ જતાં લોકોમાં ખનીજ માફિયાઓ પરત્યે તીવ્ર રોષની લાગણી પ્રગતી હતી.

(ડામાનપાત્રો પર આધ્યાત્મિક)

રોગ અને સાવધાની....

- દરવાજાના બેલ, હેન્ડલ વગેરેને સીધો હાથ ના લગાડો.
- રૂમાલ કે ટીસ્યુ પેપર હાથમાં રાખીને કામ કરો.
- અન્ય સ્થળેથી આવતાની સાથે ઘરના ફર્નિચર, દીવાલ તથા અન્ય સાધનોને હાથ ધોયા વગર અડવું નહીં.
- સાધન - સામગ્રીને સેનેટાઈઝ વડે સાફ કરવા તથા તેની સપાટીને સાફ કર્યી પછી જ વાપરવા.
- હંમેશાં માસ્કનો ઉપયોગ કરો. જ્યારે માસ્ક કાઢો ત્યારે તેને સીંધું જ ટાંકણાવાળા ડસ્ટ્બીનમાં નાખો.
- હાથ ધોવામાં સમય, સાખુ કે સેનિટાઈઝરની કરકસર અથવા આળસ કરવી નહીં. કાળજીપૂર્વક હાથ ધોવા.
- આવીને ઘરના સભ્યોને મળતા પહેલાં બહારના કપડાં ધોવામાં નાખવા.
- બહારથી આવીને તુરત સ્નાન કરવું જરૂરી છે.

આ રીતે ભયમુક્ત અને સાવધાનીયુક્ત જીવન અગર જીવવામાં આવે તો અવશ્ય કોઈ પણ રોગના ભરડામાંથી બચી શકાય.

કોરોના સંક્રમણ માટે ઘરમાં નીચે મુજબ જરૂરી કીટ રાખી શકાય

- ★ પેરાસિટામોલ અથવા ડોલો 650 mg SOS
- ★ બીટાડિન ગાર્ગલ - માઉથવોશ માટે.
- ★ Tab Limee 500 mg (દિવસમાં ૩ થી ૪ વાર ચૂસવાની). આ ખૂબ જ શક્તિવર્ધક છે અને ઈભ્યુનિટી વધારે છે. (વાયરસને અસંક્રિય કરે છે.)
- ★ Tab વિટામિન D3 60K - સપ્તાહમાં ૧ (૪ સપ્તાહ સુધી).
- ★ Tab બી કોમ્પ્લેક્સ - તે સાથે મલ્ટી વિટામિન ટ્રેસ એલિમેન્ટ્સ... જેમ કે Neurokind Plus (દિવસમાં ૧. ૧૦ થી ૧૫ દિવસ). ઈભ્યુનિટી વધારે છે.
- ★ નાસ લેવાની.
- ★ પલ્સ ઓક્સિમીટર રાખવાનું

વધુ જાણકારી માટે ડૉક્ટરની સલાહ લેવી.

રજૂઆતકર્તા : દિનેશ આર. મહેન્દ્રા

કોરોનાના કેટલાક લક્ષણો....

કોરોના વાયરસનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફરી એક વખત કોરોના પૂરજપે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે પહેલાની સરખામણીએ આ વખતે કોરોનાથી સંકભિત લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે અથવા તો તેમનામાં કોઈ લક્ષણો જોવા નથી મળી રહ્યા. જો તમારી આસપાસ પણ આવા કોઈ સામાન્ય લક્ષણો અથવા જો એસિસ્ટોમેટીક હોવાની શંકા હોય તો સેલ્ફ આઇસોલેટ થવું વધારે યોગ્ય છે. પરંતુ સેલ્ફ આઇસોલેટ થવાની યોગ્ય રીત શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું પણ ખૂબ જરૂરી છે.

કોરોના સંકભિત વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો

- ★ શ્વાસ લેવામાં તકલીફ.
- ★ ઓક્સિજન લેવલ ઓછું થવું.
- ★ છાતીમાં ફુંખાવો.
- ★ હોઠનું ફિક્કા પડી જવું.
- ★ સરળ કામ કરવામાં તકલીફ.

સેલ્ફ આઇસોલેટ થવા માટેના જરૂરી નિયમો

- ★ પોતાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ થતાની સાથે જ પોતાને ૧૪ દિવસ માટે પરિવારના અન્ય લોકોથી અલગ રૂમમાં પોતાને સેલ્ફ આઇસોલેટ કરવા.
- ★ સેલ્ફ આઇસોલેશન દરમયાન અલગ બાથરુમનો ઉપયોગ કરવો તેમજ પોતાના વાસણો પણ અલગ જ રાખવા.
- ★ જો તમારા ઘરમાં એક જ બાથરુમ હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા ફેસ માસ્ક જરૂરથી પહેરવું. તેમજ તેનો ઉપયોગ કર્યા બાદ તેને ખૂબ સારી રીતે સાફ કરવું.
- ★ જો તમે તમારો રૂમ કોઈ અન્ય વ્યક્તિ સારે શેર કરતા હોવ તો તેમની સાથે પોતાનું સ્ટીમ, નેબ્યુલાઈઝર શેર ન કરવું.
- ★ કોરોના દર્દી માટે ઘરમાં અલગ અને હવા-ઉજાસવાળો રૂમ હોવો ખૂબ જરૂરી છે.

કોરોના સંકમણથી બચવા..... સાવચેતી રાખીએ

- ા માસ્ક પહેરો
- ા હવા વારવાર સાયુ કે સેન્ટોએરીઝરથી સાફ કરો તથા
- ા બે મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખો.

કોરોના – વેક્સિન અભિયાનને સફળ બનાવો.

સ્વાસ્થ્ય માટે ધ્યાન આપશો....

બલડ પ્રેશર

- ૧૨૦ / ૮૦ – નોર્મલ
- ૧૩૦ / ૮૫ – નોર્મલ (કંટ્રોલ)
- ૧૪૦ / ૯૦ – થોડું વધારે
- ૧૫૦ / ૯૫ – ધૂંધું વધારે

ઓક્સિજન લેવલ

ઓક્સિજન - ઓક્સિમીટરથી ચેક કરતી વખતે...

- ૮૪ – નોર્મલ
- ૮૫ થી ૧૦૦ – ઓક્સિજન લેવલ સારું
- ૮૦ થી ૮૩ – ઓક્સિજન લેવલ થોડું ઓછું કહેવાય
- ૮૦ થી ૮૮ – ઓક્સિજન લેવલ ધૂંધું ઓછું (ડૉક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ થવું પડે.)

પલ્સ

- ૭૨ પ્રતિ મિનિટ – (સ્ટાન્ડર્ડ) સારું
- ૬૦ થી ૮૦ પ્રતિ મિનિટ : નોર્મલ મધ્યમ
- ૬૦ થી ૧૨૦ : વધારે પલ્સ

ટેમ્પરેચર

- ડિજિટલ થર્મોમીટરથી ચેક કરતાં....
- ૯૨ – ૯૮.૬ F – નોર્મલ
- ૯૯.૦ F – થોડો તાવ
- ૧૦૦ F થી ૧૦૨ F – વધારે તાવ

HRCT અથવા ચેસ્ટ CT SCAN

1. HRCT Score : 0 – 8 (Mild infection)
2. HRCT Score : 9 – 18 (Moderate infection)
2. HRCT Score : 19 – 25 (Severe infection)

કોરોના વાયરસ

- સાવધાન રહો. ● સતર્ક રહો અને ● સુરક્ષિત રહો... જયહિન્દ

બીજા માટે

ઇંડ બંધારણ : ગાલગા / ગાલગા / લગાગા / ગા

સારું સધણું ન હો બધા માટે,
દર્દ થઈ ઉભરે ઘણાં માટે.
એ નિકટ હોત તો થતે સારું,
વાયદા હોત ના વફા માટે.
છું સમયનું વિહગ જઈશ ઉડી,
તુંય તરસશે પિંજરા માટે!
જળને જીવાડે જળપણું આવી,
ને જીવે જળ આ બુદ્ધુદા માટે!
કોક અનુમાને જીવે, તો કોઈ,
તથયને રાખે જીવવા માટે
અધવચાળે આવી જે અટકે છે,
એ ન રસ્તો બને બીજા માટે!

કાવ્ય / ગીત
સૃષ્ટિ

કિંજલ પટેલ
માણસવાર

હરિ આવો

(ગાન)

હરિ આવો અજવાળાં થઈને,
મારા અંતરમાં દીવાઓ થઈને.
હું તો જાજમની જેમ શાસ પાથરું
સૂક્કાં પાંડાની જેમ જળમાં તરું.
મને ભાન ક્યાં છે તારી કૃપાનું,
હું તો જળમાં જ ખોબલા ભરું!
હરિ ચાલ્યા જતાં ના દૂર... દૂર
મને મારી આ ઓળખાણ દઈને...
હરિ આવો અજવાળા લઈને...
મને જીવતરનો ભાર બહુ લાગે,
મારું તન-મન બળે છે એક આગે.
થાય અંદરથી ભણકારો તારો,
જેમ મંદિરમાં જાલર છે વાગે.
હું તો પાછી ફરું છું દૂર જઈને,
ખૂબ થાકી છું એકલી રહીને.
હરિ આવો અજવાળાં લઈને....

અપસ્થિતિયા - ભાવનગર
મો. ૮૪૨૮૧ ૮૩૭૭૮

અવસર

ઇંડ બંધારણ : ગાલગાગા, ગાલગાગા, ગાલગા

પ્રીત અક્ષરમાં લખાવી જાણજે,
વિશ્વથી ખુદને બચાવી જાણજે.
દુશ્મનોનો દબદબો છે ચોતરફ,
દોસ્તથી નાતો નિભાવી જાણજે.
એકબીજાના સહારે ચાલજે,
જ્યોત નિરંતર જગાવી જાણજે.
અટપટા માર્ગે ન હિંમત હારજે,
શૌર્યથી માથું ઉઠાવી જાણજે.
ભાગ્યવશ અવસર મજાનો સાંપડે,
ભૂખ બીજાની બુઝાવી જાણજે.
જિંદગીને તું ચીતરવા ધાર તો,
રંગમાં પીંછી દૂબાવી જાણજે.

સ્થાય ચોટલિયા 'ઘરા' - રાજકોટ
મો. ૭૬૦૦૩ ૮૨૪૮૭, ૮૪૭૭૮ ૦૩૨૦૧

ગામડું

દોડવા લાગી ગયું છે ગામડું,
શહેરને આંબી ગયું છે ગામડું.
ચાંદનીની શીતથી મોં ફેરવી,
વીજથી દાંજી ગયું છે ગામડું.
ચોક, ચોરો, પાદરો, પનઘટ થકી,
દૂર લ્યો, ભાગી ગયું છે ગામડું.
રોટલો, દહીં, દૂધ, ધી ભાવે નહીં,
ફાસ્ટ કૂડ ચાખી ગયું છે ગામડું.
બજાર ઓઢીને ફરે ભભકા ભલે,
ભીતરે ભાંગી ગયું છે ગામડું.
પહોંચ બારા આંધળા અનુકરણથી,
કેટલું હાંફી ગયું છે ગામડું.
સાવ ભોળુંભટ હવે ના માનશો,
અનુભવે જાગી ગયું છે ગામડું.

ડૉ. નટુભાઈ પ્ર. પંક્યા - ભાવનગર
મો. ૮૪૨૭૫ ૫૮૦૪૩

લતા યાદ આવી

ઇંડ બંધારણ : લગાગા, લગાગા, લગાગા, લગાગા
(ઇંડ - મુતકારિબ)

અમોને અમારી કથા યાદ આવી,
પછી બાળપણની મજા યાદ આવી.
કરી'તી રમત ને કર્યા'તા તમાશા,
પછી ઠેકભરતી, રજા યાદ આવી.
હસી'તી ખરી બા જરા આંખ કાઢી,
પછી મેળવેલી સજ યાદ આવી.
હતા ખૂબ માસુમ ને સાવ ભોળા,
છતાંયે રચેલી સભા યાદ આવી.
મળી ના કદીયે ફરી એ જ યાદો,
ઝતુઅ કરેલી ખતા યાદ આવી.
થયા ખૂબ મોટા સયાના છતાં પણ,
સમાજે કરેલી દશા યાદ આવી.
મળ્યો છે સહારો ભલા માનવીનો,
હવે પાંગરેલી લતા યાદ આવી.

દર્શના રાવલ - ભાવનગર
મો. ૯૪૨૬૧ ૪૮૩૨૦

કાવ્ય / ગીતાલ સૃષ્ટિ

ઇંડ બંધારણ : ગાલગાગા, ગાલગાગા, ગાલગા

સાધુ, સંતે ના ઉકેલી હોય છે,
જિંદગી અવરી પહેલી હોય છે!

એક રેલા જેમ ના કયારે વહી,
જિંદગી કણ કણ ધકેલી હોય છે!

આપણું ખુદનું કહું માને નહીં,
કણ ઘણી માથા ફરેલી હોય છે!

નમ્રતાના પાઠ ડાળી શીખવે,
પ્રાસ ફળ થાતાં નમેલી હોય છે.

સ્પર્શ ના કરતા વિખેરાઈ જરે,
સૌ હવા સૌરભ ભરેલી હોય છે!

અંખની કીકી સમી એ ચીજ ગણ,
જે વિરાસતમાં મળેલી હોય છે.

આસમાને અગ્રકમ એ પામતી,
જે હુવા માએ કરેલી હોય છે!

આનિદ ભટ્ટ - હિંમતનગર (સાલરકાંડા)
મો. ૯૪૦૬૦ ૨૨૧૩૦

ગીતાલ

ઇંડ બંધારણ : ગાગા, ગાગા, ગાગા, ગાગા, ગા

માણસ છું પણ માણસનો ડર લાગે છે,
બધાર હતો શું એવો અંદર લાગે છે?
શું પાખ્યો ને શું ખોયું એ ક્યાં જાણે?
પૈસાના વ્યવહારે સરભર લાગે છે.
નામ નગરને રૂંકું કોણે આપ્યું આ?
સમ ખાવાને ખુલ્લું ના ધર લાગે છે.
હોઠે વાતો જ્ઞાન-ધરમની એ ધરતો,
વર્તન જોતાં કર્ય કર્ય ભીતર લાગે છે.
મન મૂકીને વરસે એવું ક્યાં બનતું,
હસતો તો પણ જાણે ફરફર લાગે છે.

દર્શના પંક્યા, લેખક/કવિશ્રી - ભાવનગર
મો. ૯૪૨૮૪ ૦૯૬૨૭

સ્નેહનું કારણ મળો,
ભેટવાની કણ મળો.
મહોરણે ચકલીપણું,
જો મને દર્પણ મળો!

કંઈ
માં

આ જગત પાછળ હવે;
ને કવિ આગળ હવે.
ચોતરફ ધોંઘાર છે,
તું મને સાંભળ ગવે!

દર્શના પટેલ - મુસ્ત - મો. ૯૮૨૪૧ ૦૦૨૪૫

જો તો ખરો!
આ ચાંદની
કેવી મસ્ત છે!
તમ સૂરજ
તો ગયો,
હવે તું
શેનાથી
ત્રસ્ત છે?

ચાંદ
સાગરમાં
પોતાનું પ્રતિબિંબ
જોવા ગયો અને
એમાં પડી ગયો
એમ કરીને
એ એને મળી ગયો.

ચાંદને જોઈ,
કોઈના ગાલ પર
પડે છે
શરમના શેરડાં
પણ
શું તમને
ખબર છે?
ચાંદને જોઈ,
કદીક
અંખોમાં પડે છે
ઉઝરડાં.

અનુષ્ણા અનુષ્ણા કક્કર 'માદવી' -
મુજ, કચ્છ
મો. ૯૮૭૬૪ ૩૬૧૯૮

આવું થાય કેમ?

જે ખોજની ધૂન હોય છે એ ખોજ દૂર જાય કેમ?
યુગોથી રહ્યો પ્રયાસ એ જ નિષ્ઠળ જાય કેમ?
રાહ અને રાહબરની તલાશ ન પૂરી થાય કેમ?
જિંદગીઓ કેટલીય વળી આમ વર્થ જાય કેમ?

આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિની ખ્વાહિશ છે,
નીત નવા રોગ સામે નીત નવા ઉપચાર છે;
અપોષણ અને શોષણ થકી ગરીબો સપડાય છે,
સર્વ સવલતો છતાં પણ અમીરો ય પટકાય છે.

સુખ અને સમૃદ્ધિ કેરી અજબની ખેવના રહી,
એમની પ્રાપ્તિને કાજે દોડધૂપ વળી થાય છે;
મળતું જ જાય છે ને મેળવાતું ય જાય છે,
અભિભાસ છતાં આ કેવીક જે ન સંતોષાય કેમ?

સુખની ય ખોજ છે ને શાંતિની પણ જંખના,
જંખના ને ખોજ પાછળ જિંદગી વહી જાય છે;
સાધનો ને સગવડોનો ટગ સહુ ખડકી જ દીધો,
છતાંય સુખશાંતિ આ વળી દૂર દૂર જાય કેમ?

જ્ઞાન વધ્યું, વિજ્ઞાન વધ્યું ને વધી વળી શોધખોળ,
ઉપકરણો ને સવલતો સુખ સગવડ કાજેય વધ્યા;
હુનિયા પણ એને લીધે બહુ સાંકડી થતી જાય છે,
અંતર ઘટયું એક રીતે, તો ય અંતર વધે જાય કેમ?

અગવડો ઘટતી ગઈ ને સગવડો વધતી રહી,
ઝુંપડા ત્યાગીને વળી મહાલયોએ વસતી રહી;
એક નંબર બાજુ પરે ને બે નંબર વધતી રહી,
પાર્થિવ આ પ્રગતિ પણ મન રંક થાય કેમ?

ઈશ્વરની આ સૂચિ ને ઈશ્વરની જ છે પ્રકૃતિ,
વળી એમની જ સંગ વિકસી માનવીય સંસ્કૃતિ;
'આરસી' લુંટાતી જોતી ઈશ્વરની આ દેખાગીને,
સૂચિ જ્યાં લુંટાય એ ઈશ્વરથી જ સહેવાય કેમ?

ઈશ્વરથી સહેવાય કેમ? ને ચૂપ જ રહેવાય કેમ?
બાળસહજ ચેષ્ટા, પણ જોતાં જ વળી રહેવાય કેમ?
પ્રગતિ ને વિકાસને નામે સૂચિ આ શોખાય કેમ?
ઈશ્વરનો જ બાળ માનવ, સૂચિની સામે થાય કેમ?

'આરસી' શાહ - અમદાવાદ
કોન : (૦૭૯) ૨૭૪૩ ૮૫૬૩

Enjoy... Math Calculations!

Husband borrowed Rs. 250 from wife.

After a few days, he again borrowed Rs. 250.

After few days she asked husband to return the money.

When asked, "How much?"

Wife said that he owes her Rs. 4100

On request, below is math given by wife.

$$\begin{array}{r} 1. \quad \text{Rs. } 2 \ 5 \ 0 \\ 2. \quad \text{Rs. } 2 \ 5 \ 0 \\ \hline \text{Rs. } 4 \ 1 \ 0 \ 0 \end{array}$$

Husband is still finding the school, where she learned Maths.

Later :

Husband gave her Rs. 400 back and asked how much balance he has to pay back.

She wrote :

$$\begin{array}{r} \text{Rs. } 4 \ 1 \ 0 \ 0 \\ \text{Rs. } 4 \ 0 \ 0 \\ \hline 0 \ 1 \ 0 \ 0 \end{array}$$

He gave back Rs. 100.

Both lived happily ever after.

Only Maths died....!

Wife must have been IAS topper.

Husband primary school teacher!

Nano Nine શાબુ રમત તથા સુડોકુ

કોરોના સંક્રમણના ભારી પ્રકોપના પગલે હાલે –
Nano Nine શાબુ રમત તથા સુડોકુનું પ્રકાશન
શક્ય નથી. એટલે હાવના તબક્ક મોકૂફ રાખવામાં
આવેલ છે. જેની નોંધ લેશો.

- સંકલનકર્તા : રજનીકાંત પાટેલ



બાલુડેં જયું ગાલ્સિયું

સંકલન : ગુલાબચંદ ધારશી રાંભિયા

બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : પુતર બચુડા, અજ આઉ નેર્યો ક પાંજે સામેજે ફ્લેટમેં જખુબાપાજો પુતર રમેશ અનજ ઘરવાળી જો હથ પકડેને અનજ હથેળીમેં મહી જો ઢેણો રખેને ચેં, હાણે તોજ ઈચ્છા પૂરી થઈ ન...? પણ મુંકે કી ગાલ સમજાણી નાય. અતરે તું તપાસ કરે ને ચો... ક રમેશ હી કુલા કેં?

બચુડો : (તપાસ કરે ને ચેં) ઈતા ઈ ગાલ વી ક રમેશજી ઘરવાળી રમેશ કે ચેંટે, હતરા ઈ થે વ્યા, પણ આંઈ મુંજે હથમેં કોઈ ઈ હીરા - મોતી - સોના ચાંદી દેના નાયો. અતરે પોય રમેશ પંદજ ઘરવાળી જે હથમેં મહી જો ઢેણો રખેને ચેં, 'મેરે દેશ કી મિહી સોના ઉગલે.... ઉગલે હીરે મોતી.... હાણે ગોતે ગન જુકો ખ્પે ઈ...'

ખિલજી મ ભલા

મંગુ : જુણાણાની હદ કોને કહેવાય?

ચંગુ : એક ચીની છોકરી અરીસા સામે ઊભી રહીને ગીત ગાતી હોય, કે યે મેરે દો મસ્ત મસ્ત નયન...!

☺ ☺ ☺ ☺ ☺

ભોગીલાલ : (જ્યંતીલાલને) યાર, હું ગજબના ધર્મસંકટમાં મૂકાઈ ગયો છું.

જ્યંતીલાલ : કેમ?

ભોગીલાલ : પત્નીનો પાર્લરનો ખર્ચ સહન થતો નથી.

જ્યંતીલાલ : તો ખર્ચ બંધ કરાતી દે!

ભોગીલાલ : તો પછી પત્ની સહન થતી નથી!

☺ ☺ ☺ ☺ ☺

મગન : વાઈફ ક્યારે સારી લાગે અને લાઈફ ક્યારે સારી લાગે?

છગન : કોની? એ પૂછ્યું નથી!!!

☺ ☺ ☺ ☺ ☺

કવિતા : (ચિત્રકારને) તમે મારા માટે એક સરસ ચિત્ર બનાવો અને ગણામાં ૫૦ તોલાનો હાર પણ ચીતરજો.

ચિત્રકાર : પણ એવું શા માટે?

કવિતા : કદાચ હું વહેલી મૃત્યુ પામું અને મારા પતિ બીજા લગ્ન કરે તો નવી આવેલી ઘરવાળી એની પાસે આ હાર માંગે અને બંને વચ્ચે રોજ જઘડા થાય એટલે મારા આત્માને શાંતિ મળે.

☺ ☺ ☺ ☺ ☺

મગન : (છગનને) છબિલી સાથે આટલી બધી ઉચ્ચ ચર્ચા ચાલતી હતી ત્યારે તું એકદમ શાંત કેમ થઈ ગયો?

છગન : આ તો છબિલીએ છેલ્લે કહી દીધું હતું કે તું જીતવા માંગે છે કે જીવવા માંગે છે? એટલે પછી હું સમજને ચૂપ જ થઈ ગયો!

☺ ☺ ☺ ☺ ☺

પતિ : તારી સાથે લગ્ન કરીને મને બહુ મોટો ફાયદો થયો.

પત્ની : શું...? ખબર ન પડી...

પતિ : મારા તમામ ગુનાઓની સજી મને આ જન્મમાં જ મળી ગઈ!

☺ ☺ ☺ ☺ ☺

ચીન્ટુ : પતિ અને ચાપતીમાં શું સમાનતા છે?

મોન્ડુ : બનેના નસીબમાં ઉકળવાનું જ લખેલું હોય છે!

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : સૌથી પવિત્ર વસ્તુ કઈ?

પર્વ : સાહેબ, મોબાઈલ...

શિક્ષક : કઈ રીતે?

પર્વ : આ એક જ એવી વસ્તુ છે કે જેને તમે મંદિરમાં, ટોઇલેટમાં, રસોડામાં, બાથરૂમમાં, બેડરૂમમાં બધે જ લઈ જઈ શકાય છે અને એ પણ ધોયા વિના...

☺ ☺ ☺ ☺ ☺

માલતી : ડિયર મયંક, પાણીની બોટલ લાવી આપો ને, બહુ તરસ લાગી છે.

મયંક : કેમ દહી કચોરી ખાવી છે?

માલતી : વાહ! સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું.

મયંક : હવે બોટલની કયાં જરૂર પડવાની! મોટા અને ખોટા ખર્ચમાંથી બચ્યો...!

૮/૬, ગંગામણિ ફ્લેટ્સ, વસ્તંત્રનગર સોસાયટી,
ગોપાલચોક, મહિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮.

ફોન : ૨૪૪૬૮૭૬૦

સમાજ દર્પણ

અવસાન નોંધ - પુષ્પાંજલિ

- ડા. ૧-૪-૨૦૨૧
રાજુલાભેન નલિનભાઈ કેશવજી મોમાયા (ઉ.વ. ૭૫)
(વરાડિયા - અબડાસા, અમદાવાદ)
- ડા. ૧૧-૪-૨૦૨૧
વર્ષાબેન રવિલાલ પોપટલાલ પારેખ (ઉ.વ. ૮૭)
(મુંદ્રા - અમદાવાદ)
સ્વર્ગસ્થના સુપુત્ર પિયુષ રવિલાલ પારેખ, આ સમાજના દ્રસ્તી છે.
સદ્ગતશ્રીઓના આત્માના શ્રેયાર્થે પ્રાર્થના.

સાભાર સ્વીકાર

શ્રી જલારામ અશ્રક્ષેત્ર ખાતે
રૂ. ૧,૦૦,૦૦૦/-નું માતબર દાન
માતુશ્રી દેવાભાઈ કુંવરજી ચેરિટેબલ ટ્રસ્ટ
જુહુ સ્કીમ, વિલેપાર્લે, મુંબઈ તરફથી પ્રાપ્ત થયેલ છે.
દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર.

શ્રી કમલેશભાઈ શાહ તથા અન્ય કાર્યકર્તાઓના
સહયોગથી ઉમદા કાર્ય સંપદ થયું

દેહદાન તથા ચક્ષુદાન કરવામાં આવ્યું

બોટાદના શ્રી દશા શ્રીમાણી જૈન સ્થાનકવાસી શ્રી વસંતભાઈ એચ. શાહ (ઉ.વ. ૮૭)નું તા. ૪-૪-૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. સ્વર્ગસ્થશ્રી તથા તેમના પરિવાજનોના આદર્શ અને ઉચ્ચ વિચારો થકી તથા સમાજના કાર્યકર્તાઓ પરેશ મગનભાઈ સંધવી, ડૉ. કેતન શાહ અને દેહદાન તથા અવયવ દાન સમિતિના કન્વીનર શ્રી કમલેશ બાબુભાઈ શાહના સહયોગ તથા પ્રયત્નોથી સ્વ.શ્રી દ્વારા દેહદાન અને ચક્ષુદાન થતાં અન્યજનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.

મનુષ્યના મૃત્યુ બાદ સ્થૂળ શરીરને બાળતા પ્રદૂષણમાં વધારો થતો હોય છે. તે સિવાય, અગર દેહદાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં જરૂરી અભ્યાસ અર્થે તેનો ઉપયોગ થઈ શકે. તેવી રીતે દાણ વિહીન લોકોને તેમના ચક્ષુદાન થકી અમૂલ્ય દાણ પ્રાપ્ત થતી હોય છે. આ પ્રકારના ઉમદા અને ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય કરનારને ધન્યવાદ ઘટે છે.

- કન્વીનર, દેહદાન તથા અવયવદાન સમિતિ

મનુષ્યની ઈચ્છા સદાય પરિપૂર્ણ થતી નથી...

દેહદાન - ચક્ષુદાન સંબંધી સ્વ. વર્ષાબેન પારેખની મક્કમ ઈચ્છા અધૂરી રહી ગઈ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના પરિવારજન - આદરણીય વર્ષાબેન રવિલાલભાઈ પારેખ (મુંદ્રા - કચ્છ)નું તા. ૧૧-૦૪-૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. અતે ખાસ ઉલ્લેખનીય છે કે, સ્વર્ગસ્થશ્રીએ પોતાના મૃત્યુ બાદ દેહદાન તથા ચક્ષુદાન કરવાની પોતાની જીવંત અવસ્થામાં અનેક વખત અદ્ય ઈચ્છા પ્રગટ કરી હતી તે બાબત ધ્યાનમાં લેતાં તેઓશ્રીના નિધન બાદ તેમના પરિવારજનોએ પણ આ પ્રકારના ઉત્કૃષ્ટ દાન માટે સમાજની દેહદાન - અવયવદાન સમિતિના કન્વીનરશ્રી કમલેશભાઈ શાહને જણાવ્યું હતું. આ અન્વયે જરૂરી કામગીરી તુરત કરવા માટે શ્રી કમલેશભાઈએ જાતે જરૂરી અથાગ પ્રયત્નો કર્યા હતા. તે સમયે સંબંધિત સંસ્થાઓ તરફથી તેમને જણાવવામાં આવ્યું હતું કે, હાલે છેલ્લા એકાદ સમાહિથી કોરોના સંકમણ ખૂબ મોટા પાયે થતાં અને સરકારશ્રીએ જાહેર કરેલ નવી ગાઈડલાઈન્સની જોગવાઈ મુજબ આ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. તે કારણ હેઠળ આ વિશિષ્ટ દાન સ્વીકારવા સત્તાવાળાઓએ અસર્મથતા બતાવી હતી. આ રીતે સંજોગોમાં અચાનક પરિવર્તન થતાં સ્વ.શ્રીની દેહદાન - અવયવ દાનની મક્કમ ઈચ્છા પરિપૂર્ણ થઈ નહીં. (અતે એ પણ ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ શ્રી કમલેશભાઈ અને અન્ય સભ્યશ્રીઓના પ્રયત્નોથી એક અન્ય ડિસ્સામાં આ પ્રકારનું અમૂલ્ય દાન કરવાની કામગીરી સફળતાપૂર્વક થઈ હતી, જેનો અહેવાલ આ અંકમાં અન્યત્ર પ્રકાશિત કર્યો છે.)

સ્વ. વર્ષાબેન પારેખ ધર્મા વર્ષો અગાઉ દેહદાન - અવયવદાન માટે જરૂરી ફોર્મ પણ ભર્યું હતું. સ્વ.શ્રીના તથા તેમના પરિવારજનોના ઉચ્ચ વિચારો અને ઉમદા ભાવનાની નોંધ લઈને બિરદાવીએ છીએ. કન્વીનરશ્રી, દેહદાન - અવયવદાન સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

ઓર્ગેનિક અનાજ, કઠોળ, કરિયાણાનું વિતરણ

મિત્રો,

આપણા શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા, શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતે કેમિકલ અને પેસ્ટિસાઈડ તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ વગરના અનાજ, કઠોળ, ધી, તેલ, કરિયાણું વગેરેનું વિતરણ આ મહિનાથી જ શરૂ કર્યું છે અને આપણને તેનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે.

આપણી આ પ્રવૃત્તિને વેગ મળે એ હેતુથી એક વોટ્સઅંપ ચુપ ખોલવામાં આવ્યું છે. જેમાં વિશેષ માહિતી આપવામાં આવે છે અને દરેક મહિનાની ૧૦થી ૧૫ અને ૨૫થી ૩૦ તારીખ સુધી ઓર્ગેનિક અનાજ, કઠોળ વગેરેનું વિતરણ થાય છે. દરેક સભ્યને ઓર્ડર આપવા માટે ગૂગલ ફોર્મનો ઉપયોગ કરવો જરૂરી છે અને ગૂગલ ફોર્મમાં દરેક વસ્તુઓના ભાવ વિશેની માહિતી આપેલી છે. ઓર્ડર મુજબ જ સામાન એકઠો કરાય છે. માટે એડવાન્સમાં ઓર્ડર આપવો જરૂરી છે.

ધણા સભ્યોને કદાચ એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક ભોજનમાં એટલો બધો શું ફરક પડતો હશે? બજારમાં જે મળે છે તે ઓર્ગેનિક જ હોય અને તેનો ઉપયોગ કરવાથી આપણને કંઈ નુકસાન થવાનું નથી...

તો આવો સમજીએ, ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક - બંને વચ્ચેનો મૂળભૂત તંત્રજ્ઞાન.

આપણે સૌ શાકાહારી છીએ એટલે કે અનાજ, કઠોળ, ધી, દૂધ અને શાકભાજ તેમજ ફળફળાદિ વગેરેને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આપણા શરીરને ઉર્જા ક્યાંથી મળે છે? ભોજન, વિશ્રામ-નિંદ્રા, શાસોચ્છવાસની પ્રક્રિયા, ધ્યાન તથા યોગ દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ. હવે જો ભોજનની વાત કરીએ તો જૈન ધર્મમાં તો ભોજન એટલે કે આહાર માટેનું મોટું વિજ્ઞાન છે. ક્યારે ભોજન લેવું, ક્યારે ના લેવું, કેટલી માત્રામાં લેવું તેમજ ઋતુઓ પ્રમાણે પરેણ પાળવી વગેરે...

સાત્ત્વિક, રાજસિક અને તામસિક - એમ ગ્રાણ પ્રકારના મનુષ્યના ગુણ કે વિકાર છે. તેનું સીધું કનેક્શન ભોજન સાથે છે. આપ સૌને ખબર જ હશે કે માંસાહાર, વધારે તેલવાળું, તીપું અને રાંધ્યા પછી ૫-૬ કલાક પછીનું બધું જ ભોજન એ તામસિક છે અને આવા ભોજનનો ઉપયોગ કરવાવાળા સ્વભાવે તામસિક એટલે કે ગુસ્સાવાળા, ડરપોક, જીદ્દી અને આકમક હોય છે. રાજસિક એટલે વધારે પડતું ગળ્યું, જંક ફૂડ / ફાસ્ટ ફૂડ (પીઝા, બર્ગર, ચીજ), ડ્રાયકુટ્સ વગેરે... હવે રજસ વધારે હોય તેવી વ્યક્તિ હાઈપર એક્ટિવ હોય, ધૈર્યનો અભાવ અને આળસ પ્રકૃતિના હોય. આપણામાં કહેવત છે કે આરંભે શૂરા... એટલે કે દરેક કામ શરૂ તો કરી દે પરંતુ કોઈ પણ કાર્ય પૂર્ણ ના કરે અને અધ્યૂરું જ છોડીને બીજું નવું કામ હાથમાં લે. ટૂંકમાં અને એવું મન અને અને તેવો ઓડકાર... વગેરે કહેવતો વિશે આપણે જાણીએ જ છીએ અને સાત્ત્વિક ભોજન એટલે તાજા શાકભાજ, ફળફળાદિ, અનાજ, કઠોળ વગેરે સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન. એક ખોબો કે અંજલિમાં ભરાય તેટલું ભોજન દિવસમાં ૨-૩ વખત લઈએ એટલે તેમાં આખા દિવસ દરમિયાનની જરૂરી ઉર્જા આપણને મળે અને શરીરની પાચન વ્યવસ્થા પણ સરસ રીતે કાર્ય કરે એ સાત્ત્વિક ભોજન.

આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ખડુરસ (હ પ્રકારના સ્વાદ) જરૂરી છે. ખાટો, ખારો, કડવો, ગળ્યો, તીખો અને તૂરો. જો આ પ્રમાણે ભોજન લઈએ તો સદાય નિરોગી રહી શકાય અને સ્વાસ્થ્યની સુખાકારી વધે. નાની ઉમરે જ ઘડપણ ના આવે અને દવાખાના કે ડોક્ટરનો ખર્ચ ઓછો થાય. વર્ષો પહેલા જ્યારે ભીડાનું કે કારેલાનું કે અન્ય કોઈ શાક બને અથવા તો કોઈ દાળ - કઠોળ કે કોઈ વાનગી બને તો આજુબાજુના ૩-૪ ઘરમાં પણ સુગંધ આવતી. અત્યારે તો રસોડામાં રસોઈ થતી હોય તો શ્રોદીંગ રૂમમાં પણ ખબર ના પડે કે શેની રસોઈ થઈ રહી છે. આનું મૂળ કારણ છે કે અનાજ અને શાકભાજમાં ખડુરસનો અભાવ! કારણકે કેમિકલવાળી અને રાસાયણિક અને જંતુનાશક દવાઓથી ઉગાડેલા અનાજ, કઠોળ, શાકભાજ વગેરેમાં કોઈ પણ પ્રકારની પૌષ્ટિકતા હોતી નથી અને ફક્ત શરીરને લાંબાગાળે નુકસાન કરતા જેરીલા તત્ત્વો જ હોય છે.

જમીનમાં ઝેરી રસાયણો અને દવાઓના છંટકાવથી તેયાર થયેલા અનાજ અને કઠોળમાં ખડુરસનો અભાવ જોવા મળે છે. આવા અનાજને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી કેન્સર, મંદબુદ્ધિ, નપુંસકતા અને બીજા અવનવા રોગ થવાની સંભાવના વધી જાય છે. પંજાબના એક ગામથી હિલ્ડી જતી રેલવેને કેન્સર ટ્રેઇનના નામથી ઓળખાય છે. કેમ? કારણકે કેમિકલ અને પેસ્ટિસાઈડથી થતી ખેતીને કારણે આખા વિસ્તારના બધી લોકોને કેન્સરની બીમારી થઈ છે અને હિલ્ડીમાં તેમના ઈલાજ માટે આખી ટ્રેઇનમાં

કેન્સરના દર્દીઓને લઈ જવામાં આવે છે.

જે રસાયણો અને પેસ્ટિસાઈડ જમીન, ભૂગર્ભ જળ અને આસપાસની હવાને ખરાબ કરે અને માટીમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવશુંઓનો નાશ કરે તેવા શાકભાજી અને અનાજ - કઠોળ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ? જરા વિચાર કરો... કે આપણો દેશ તો ખેતીપ્રધાન દેશ છે અને વર્ષોથી આપણાં પૂર્વજી ખેતી જ કરતા હતા અને તેમનું આયુષ્ય અને આરોગ્ય કેવું હતું? શું તેવું આરોગ્ય આપણી આજની જનરેશનનું છે? બિલકુલ નહીં... કારણકે આપણે સર્સ્તું અને કેમિકલવાળું અનાજ ઉપયોગમાં લઈએ છીએ અને પૂરતી માહિતીના અભાવે કૂપોષણવાળું અનાજ આપણા શરીરમાં પ્રવેશવા દઈએ છીએ. પછી જ્યારે જવલેણ રોગ થાય ત્યારે બચાવેલા પૈસા ડોક્ટરને આપીને ગમે તે રીતે જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. શું તમને ખબર છે કે કેમિકલવાળી ખેતી કરતો ખેડૂત પણ પોતાની ઉગાડેલી શાકભાજી અને અનાજ, પોતાના ઉપયોગમાં લેતા નથી અને પોતાના પરિવાર માટે અલગથી ધરું વાણિયું કરીને કેમિકલ વગરનું અનાજ અને શાકભાજી ઉગાડે છે???

હવે સમજવાની વાત એ છે કે આપણા પૂર્વજી અને વર્તમાન સમયની ખેતીમાં એવો તે શું બદલાવ આવ્યો કે ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક શાખા ચલણમાં આવી ગયો? ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકમાં ભારતમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા વધારે હતી. પરંતુ સમગ્ર દેશમાં ક્યાંય પણ કેમિકલ અને પેસ્ટિસાઈડનો વપરાશ નહોતો થતો. તે સમયે ભારતમાં ગ્રીન રિવોલ્યુશનના નામે અને ઘઉંની નવી જાતોને ઈન્ટ્રોડ્યુસ કરવા માટે અમેરિકન અને બ્રિટીશ કંપનીઓ દ્વારા વિદેશી બિયારણ સાથે કેમિકલ ફાર્મિંગ અને પેસ્ટિસાઈડનો પ્રવેશ કરવાનાવવામાં આવ્યો અને ત્યારથી યુરીયા - ડીએપી અને રાસાયણિક દવાઓ, વિદેશી બિયારણો દ્વારા ખેતીની શરૂઆત થઈ. પાણીની અછત સર્જાઈ. ખેતીમાં નવા રોગો આવ્યા માટે જંતુનાશક દવાઓ આવી અને છેવટે આપણે ઓર્ગેનિકમાંથી નોન ઓર્ગેનિક બન્યા.

ત્યારબાદ હવે એ જ વિદેશી કંપનીઓએ આપણને એવું સમજવાનું ચાલું કર્યું કે ઓર્ગેનિક ખેતી કરો અને સર્ટિફિકેટ આપો તો જ તમારી ખેત પેદાશોને ખરીદીશું!! છે ને નવાઈની વાત? હવે આપણને આપણી સંસ્કૃતિ ભૂલાવી દઈ કેમિકલ ફાર્મિંગ કરવાનું વિદેશના લોકોએ શીખવાછું. પછી એ જ લોકોએ આપણને ઓર્ગેનિક ખેતી કરવા માટે કહું. આપણો ભોજો ખેડૂત છેતરાઈ ગયો અને આપણા સમાજના સુશિક્ષિત લોકો પણ હવે આપણા ખેડૂતને કહેવા લાગ્યા કે ઓર્ગેનિક સર્ટિફિકેટ આપો!!

આપણા શ્રી કચ્છી જૈન ભવન ખાતેથી જે કંઈ પણ વસ્તુઓનું વિતરણ થાય છે તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પેસ્ટિસાઈડ વગરની ખેતીથી ઉત્પાદિત કરેલા અનાજ અને કઠોળ, સીધા ખેડૂત મિત્ર પાસેથી લેવાય છે અને આપ સુધી પહોંચાડાય છે. આપ સૌને નમ વિનંતી છે કે એક સંકલ્પ લઈએ કે ઝેર ખાવું નથી અને નાના નાના ખેડૂતોને મદદ કરીએ. જેથી તેઓને સજીવ ખેતી (ઓર્ગેનિક) કરવા માટે પ્રોત્સાહન મળતું રહે અને આપણને પણ પૌષ્ટિક આહાર મળતો રહે.

જો આપ પણ કેમિકલ વગરના અનાજ અને કઠોળ ખરીદવા માંગતા હો, તો ગૂગલ લીક દ્વારા આજે જ ઓર્ડર આપી શકો : <https://tinyurl.com/Kutchhi-Bhavan>

જે સ્થાયો અમદાવાદમાં નથી રહેતા અને ખરીદી કરવા માંગતા હોય તો કુરિયર / ટ્રાન્સપોર્ટેશન ચાર્જિસ અલગથી આપીને પણ ઓર્ડર આપી શકે છે. કોરોનાનું સંકમણ ઓછું થાય પછી, કુરિયર વગેરેની તપાસ કરીને અમે દરેક સામાન આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. વધુ માહિતી માટે નીચે આપેલા ફોન પર વાત કરી શકો છો. રોહિતભાઈ : ૯૮૨૪૪૦૦૬૬૪૮, વિમેશભાઈ : ૯૮૭૯૯૧૧૦૪૬૭.

ઓર્ગેનિક અનાજ, કઠોળ અને પ્રાકૃતિક ખેતી માટે વધુ માહિતી મેળવવી હોય તો ચિંતનભાઈ (૯૮૨૫૦૦૭૩૦૮)ને વ્યક્તિગત મેસેજ કરી શકો છો.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત

નવનીત મેડિકલ સેન્ટર - બોપલ ખાતે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮ વર્ષથી

ઉપરના માટે વિના મૂલ્યે કોરોના રસીકરણ કેન્દ્ર

શરીર કરવામાં આવેલ છે...

રસીકરણની ટીમ જોખ્પુર અર્બન હેલ્પ સેન્ટર પરથી આવે છે.

રસીકરણનો સમય :

સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ સુધી
બપોરે ૨.૦૦ થી ૪.૦૦ સુધી

● સ્થળ ●

રસી લેવા આવનાર
વ્યક્તિગત પોતાનું
આધાર કાર્ડ અથવા
પાન કાર્ડ સાથે રાખવું

નવનીત મેડિકલ સેન્ટર

બીજો માણ, ગાલા હબ અનેક્ષ, ગાલા જિમખાના પાસે,
સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦ ૦૫૮.

ફોન : ૯૮૨૪ ૮૮૦ ૩૦૩, ૯૮૨૪ ૮૮૦ ૪૦૪

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

ખાગમા ડોલેટ કરવા અંગે....

આજના કોરોના મહામારીની પરિસ્થિતિમાં સમાજના ગુપ્તમાં ઈમરજન્સીમાં રોજ કોઈને પણ પ્લાઝમાની જરૂર પડે છે અને જેથી શ્રી કંચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ અને “રેડ કોસ” સાથે મળીને ભવિષ્યમાં આપણા સમાજના સત્યોને ઈમરજન્સીમાં દોડવું ના પડે તે માટે પ્લાઝમા બેંક તૈયાર કરવા માંગે છે.

ਪਲਾਂਕਮਾ ਕੋਣਾ ਡੋਨੇਟ ਕਰੀ ਸ਼ਕੇ?

- જે વ્યક્તિ ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલા કોવિડથી રીકવર થઈ હોય (રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય.)
 - જે વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષ સુધીની હોય.
 - વજાન ૫૦ કિ.ગ્રા.થી વધારે હોય.
 - રસીનો એકપણ ડોઝ છેલ્લા ૨૮ દિવસમાં લીધો ના હોય.
 - કોઈપણ માતા પાપાજમા ડોનેટ કરી શકશે નહીં.

આપણા સમાજની કોઈપણ વ્યક્તિ કોવિડ સંક્રમણથી સાજા થયેલ હોય તેઓને નમ્ર વિનંતી કે આગળ આવો અને પ્લાઝમા ડોનેટ કરી બીજાની જિંદગી બચાવવામાં મદદરૂપ થાઓ.

હાલ તુરંતમાં પ્લાજમા ડોનેટ કરવા ઈચ્છીત વ્યક્તિ નીચે મુજબ પોતાની વિગત મોકલી આપે.

૧. નામ
 ૨. ઉમર :
 ૩. વજન :
 ૪. કોવિડ નેગેટિવ થયા તારીખ
 ૫. બ્લડ ગ્રૂપ
 ૬. વેક્સિન લીધી છે : હા / ના
લીધી હોય તો તેની તારીખ :

ગમે ત્યારે ખાજમા ડોનેટ કરવા માટે રેડકોસ સોસાયટી - પાલડી
ખાતે જવાની તૈયારી લોય તે ગમ લખાવે.

આપણા સમાજના સત્યોની જ સેવા કરવાની છે.

ગમે ત્યારે ગમે તેને જરૂરિયાત ઉભી થઈ શકે છે.

• તથા વિગત કે માહિતી માટે દુદ્દત લોડસરેન •

નિદેશ સંસ્કરણ એસ. (અધિકારી) : ૦૮૦૮૭ ૧


ਮਲਿਆ ਜਾਣੁਮਾਈ ਰਾਹ (ਸਕਾਟਪਾਣਾ) : 98987 4
ਪੰਜਾਬ ਪੰਜਾਬ ਸੇਵਿਆ : 94292 0

राज्य विभाग : 94292 0
नं. (H.K.) ८५२ : २२२५३ १

ਰਾਜਨ (Hk) ਸ਼ਾਹ : 98250 1

- કંદીનર, એલેન તથા ચક્કાનર વિશે

- ફોનર, ઇલેક્ટ્રિક તથા ચાદુંદાન સામાજિક



વ્હી વિદ્યુતી આજા લારતાં લોશટીક સોલ્યુશન આપતી કંપની



800+
MODERN
VEHICLES

22
STATES+
4 UTs

650+
BRANCHES

આમારી વિશેષતાઓ - સિંગાલ વિન્ડો પ્લોટકોર્સ

- VT/VX ની ડાયરી ૮૫૦+ શામાઓ
- ISO 9001:2015 પ્રમાણિત કંપની
- Robust Systems & Processes પર કાર્યરત
- Trace & Track Facility સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ નેટવર્ક
- બુકીંગ થી ડિલીવરી સુધી સામાનને Complete Insurance Cover

- ૧૦ કિલોથી કુલ ટ્રક લોડ સુધીના પાર્સલ સ્વીકારીએ છીએ
- ૧૦૦૦૦૦+ સંસ્કૃત આહકો
- Hard Freight Surface Transportation માં ક દાયકાનો અનુભવ
- રોડ, એર અને રેલને ક્રાસ્ ડોર તો ડોર તો એક્સપ્રેસ કર્ગો
- વિસ્તૃત થઈ શકતી Supply Chain & Inventory Management



Our other Divisions



**આ પુસ્તકોનાં
પ્રાપ્તિસ્થાન**

ગુજરાતના કાર્યાલય



ગુજરાત
સાહિત્યભવન


રાજ્યપોણનકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ - 380 001
ફોન : 079-22144663.
e-mail : goorjar@yahoo.com


ગુજરાત
સાહિત્ય પ્રકાશન


102, બેન્ડમાર્ક બિલ્ડિંગ,
ઘટેલીયમ રિટીસેન્ટર પાસે,
ચીમા હોલની સામે, અમદાવાદ-15
ફોન : 26934340, મો. 9825268759
ઈમેલ : gurjarprakashan@gmail.com

કોરોના મહામારી સામે ધ્યાન-યોગ દ્વારા સામય્ય કેળવો









ધ્યાન વિશે વિંતન યોગસનો	શ્રી એમ. અનુ. નીતિન ભટ્ટ	200
યોગવિદ્યા	ડૉ. જી. રી. સરવૈયા	60
યોગ એ જ જીવન	અરૂપ ઠાકર	280
જીવનયોગ	સ્વામી અધ્યાત્માનંદ	280
યોગ અને આરોગ્ય	સ્વામી અધ્યાત્માનંદ	150
યોગ અને સ્વાસ્થ્ય	સ્વામી અધ્યાત્માનંદ	250
Yoga A way of life	Swami Adhyatmanand	350
Yoga for Better Living	Swami Adhyatmanand	300
Yoga and Health	Swami Adhyatmanand	125
યોગ ઔર સ્વાસ્થ્ય	સ્વામી અધ્યાત્માનંદ	300
શિક્ષણ અને યોગ	સ્વામી અધ્યાત્માનંદ	180
યૌગિક શોધનકાર્ય	ભાષાદેવ	75
યૌગિક બંધ અને મુદ્રા	ભાષાદેવ	100
અંતર્ગ યોગ	ભાષાદેવ	125
સંપૂર્ણ પ્રાણાયામ	ભાષાદેવ	150
	ભાષાદેવ	400

તાજગી અને તંદુરસ્તીનો મેળાપ કરાવતું આરોગ્ય સાહિત્ય

બાળારોગ્ય વિશેનાં પુસ્તકો	બાળકોમાં એલજર્ની તકલીફ	40	હેલ્પ-ટિસ્ટબિટ્રસ	270
ડૉ. હર્ષદ વી. કામદાર	બાળકોમાં ડિડનીના અને મૂત્રમાર્ગના રોગો	340	હાસ્યચિકિત્સા	5
બાળકોની માવજત જતે કરો	બાળકોને પડતી સામાન્ય તકલીફ	40	ડૉ. પી. જી. શાહ	100
બાળકોમાં કાયમી શરદી અને ખાંસી	બાળકોની ઊંચાઈની સમસ્યા	20	એક્યુપંક્ચર (પુરસ્કૃત)	35
એલજર્નીને ઓળાખીએ	બાળવિકાસ અને સંભાળ	20	એક્યુપંક્ચર :	50
બાળકોને અપાતી આધુનિક રસીઓ	બાળારોગ્યની વાતો	50	ઓબેસિટીનો સચોટ ઈલાજ	50
બાળકોમાં કાયમી જાડા અને તેના ઉપાયો	જનરલ આરોગ્ય વિશેનાં પુસ્તકો	15	એક્યુપંક્ચર :	50
બાળકોની ઊલટીની સમસ્યા	ડૉ. મુર્છદ મહેતા	400	દુઃખાવાનો સચોટ ઈલાજ	30
અને તેના ઉપાયો	હેલ્પ હાઇવે	15	એક્યુપંક્ચર :	30
બાળકોની ઊલટીની સમસ્યા	આરોગ્યની આડી લીટી -	15	લકવાનો સચોટ ઈલાજ	30
અને તેના ઉપાયો	સીધી લીટી	350	એક્યુપંક્ચર (અંગ્રેજ)	60
બાળકની ભૂખ વધારવા	ફિટનેસ ફિડમેન્ટલ્સ	300	હોમિયોપેથિક સારવાર	12
શું કરશો ?	ફાઈન યોર ફિટનેસ	300	હાર્ટએટેક : નિદાન અને સારવાર	10

If undelivered please return to :

શ્રી કાચી જૈન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કાચી જૈન ભવન,

૪૩-૪૪, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
નવચેતન હાઇસ્ક્વુલની સામે, પાલડી - એલિસાંગ્ઝ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૭૯) ૨૬૫૭ ૮૮૯૨, ૨૬૫૮ ૧૫૦૧

To,

મંગલ મંદિર • મે-૨૦૨૧ • ૬૪